

ગીત શાસ્ત્ર

ભાગ પહેલો

ગીત 1

- 1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી; પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી; દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતાં નથી; તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
- 2 યહોવાના નિયમશાસ્ત્રી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
- 3 તેઓ નઢી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો એતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઈ કામ કરે છે, તેમાં સફળ થાય છે.
- 4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવાં છે.
- 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહીં; ન્યાયીઓની સભામાં પાપીઓ ઉભા રહી શકશે નહીં.
- 6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

ગીત 2

- 1 બીજા રાષ્ટ્રના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
- 2 કારણ, આ રાષ્ટ્રના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
- 3 તેઓ કહે છે, “આવો આપણે, દેવના બંધન તોડી પાડીએ. ગુલાભીમાંથી મુક્ત થઈ જઈએ.”
- 4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે. મારો માલિક તેમની મજાક કરે છે.
- 5 અતિ કોધમાં બોલી તેઓને ઠપકો આપણે, દેવના પ્રકોપથી સૌ અતિ ત્રાસ પામશે.
- 6 યહોવા કહે છે, “મારો પવિત્ર સિયોન પર્વત પર મે મારા રાજાને અભિષિકત કર્યો છે.”
- 7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરવને વિષે કહીશ. યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે. આજે હું તારો પિતા થયો છું.”

- 8 તું મારી પાસે માંગ એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
- 9 તેમના પર લોકાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે જેવી રીતે લોકાનો સણિયો માટીના ઘડાને તોડી નાખે. તેમજ તું કરજે.
- 10 પૃથ્વીના રાજવીઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે, સત્તાધીશો તમે હવે આ બોધ લો.
- 11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો. અને ભયથી થર થર કાંપો.
- 12 તેના પુત્રને ચુંબન કરો, જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય. કારણ કે યહોવા ક્રીએપણ સમયે તેનો ક્રોપ દેખાડવા તૈયાર છે. જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

ગીત 3

પોતાના પુત્ર આભ્યાલોમથી નાસી જતી
વધતનું દાઉદનું ગીત.

- 1 “હે યહોવા, મારા વેરીઓ ધણા વધી ગયા છે; ધણા લોકો મારું ખોડું ઈચ્છનારા છે.
- 2 મને દેવ કદી તારશે નહીં, એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.”
- 3 પણ હે યહોવા, તમે મારી છાલ છો; તમે મારું ગૌરવ છો; શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફક્ત તમેજ ઉપર ઉંઘાવી શકશો.
- 4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
- 5 પછી હું શાંતિથી સૂર્ય જાઉ છું, સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
- 6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે તેઓથી હું જરાય ડરીશ નહીં.
- 7 હે યહોવા, ઉઠો; મારું તારણ કરો મારા દેવ; એમ હું તમને હાંક મારીશ; કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યો છું.
- 8 યહોવાની પાસે તારણ છે, લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

ગીત 4

નિર્દેશક માટે, તારવાળાં વાજુંતો સાથે ગાવા
માટે. દાઉદનું ગીત.

- 1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે, મને ઉત્તર આપજો, મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો, મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
- 2 હે મનુષ્યો! કયાં સુધી મારા માટે ખરાબ ભોલશો? ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
- 3 તમારે જાગવું જોઈએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગમીને સાંભળે છો. તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
- 4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહીં, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ ત્યારે તમારાં હદ્યમાં ઉડે સુધી વિચાર કરો અને શાંત થઈ જાવ.
- 5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પજો ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો.
- 6 એવું પુછનાર તો ધણા છો, "અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા! તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!"
- 7 હે યહોવા! જાતનું પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છો. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હદ્યમાં મૂકી છો.
- 8 હું સૂઈ જઈશ ને શાંતિથી ઉધી પણ જઈશ, કારણ; હે યહોવા! તમેજ એક મને સુરક્ષાથી સુવા દો છો.

ગીત 5

સંગીત નિર્દેશક માટે, બંસરી વાદી માટે, દાઉદનું ગીત.

- 1 હે યહોવા મારી પ્રાર્થના પર કાન ઘરીને જરા, મારા ચિંતન પર લક્ષ રાખો.
- 2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ, હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહીં.
- 3 હે યહોવા! નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો, જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું. અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છું.
- 4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી; તમે કોઈની ભૂંડાઈ કે પાપ સાંખી લેતા નથી.
- 5 તમે ઉદ્ઘત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને વિકારો છો.
- 6 હે યહોવા! તમે જૂદું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ અને ગુપ્ત રીતે બીજાને ઈજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
- 7 હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંઠણિયે પડીશ.

- 8 હે યહોવા! તમારા ન્યાયી અને સાચા માર્ગ મને ચલાવો. કારણ કે મારા દુશ્મનો મારા દરેક પગલાં પર નજર રાખે છે; મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
- 9 કારણ, તેમની વાણીમાં કોઈ સચ્ચાઈ નથી, તેઓનું હદ્ય નીચાતાથી ભરેલું છે. તેઓ મધુરભાષી છે! તેઓનું ગળું એક ઉધાડી કબર જેવું છે. તે પોતાની જીબે પ્રશંસા કરે છે.
- 10 હે દેવ! એ સૌને તમે દોષી, ગણો, અને તેમને તેમના પોતાના જ છટકમાં સપડાવા દો તેમને તેમના પાપના બોજ તળે કચડાઈ જવા દો. કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઈ ગયાં છે.
- 11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો—તેમને હમેશા માટે આનંદિત કરો, તેઓનું રક્ષણ કરો, જેઓ જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
- 12 હે યહોવા, જ્યારે તમે સજજન લોકોને આશીર્વાદ આપો છો, ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.

ગીત 6

નિર્દેશક માટે; તારવાળાં વાજુંતો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

- 1 હે યહોવા! તમારા કોધમાં, મને ધમકાવશો નહીં, અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહીં.
- 2 હે યહોવા! મારા પર દયા કરો, કારણ, હું માંદો અને દુર્ભણ છું. હે યહોવા, મને સાજો કરો, કારણ, મારા હાડકો બહુ દુઃખે છો.
- 3 હું ધણો ભયભીત છું; મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઈ ગયું છે. હે યહોવા, મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો?
- 4 હે યહોવા! પાછા આવો, મારો જીવ બચાવો. કૃપા કરી દયા દાખવી મને મરણથી બચાવો.
- 5 મૃત લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગ્યાએ કોઈપણ તમારી સ્તુતિ કરતું નથી.
- 6 આખી રાત પ્રાર્થના કરીને અને નિઃસાસા નાખીને હું નિર્બણ થયો છું, રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિધાનું ભીજવું છું.
- 7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને કારણે રૂદ્ધનથી મારી આખો દુર્ભણ બની ગઈ છે.
- 8 ઓ બંધુ કરનારાઓ, મારાથી બધા દૂર થઈ જાઓ. કારણ, યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે યહોવા.
- 10 મારા બધા શત્રુઓએ ભયભીત અને નિરાશ થશે. ઓચિંતા કઈ થશે અને તેઓ બધા લજીજત બની ચાલ્યા જશે.

ગીત 7

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાહિલના
સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

- 1 હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
- 2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ ના હોય, અનેવું થવા દેશો નહીં.
- 3 હે મારા યહોવા દેવ! જો મેં એમ કર્યું હોય; તો મારા હાથમાં કઈ ભૂડાઈ હોય.
- 4 અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય, અને વિના કારણે કોઈ શત્રુ પર હુમલો કર્યા હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂટી હોય.
- 5 તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે, અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગ્ઘોળી નાખે! અને મારા આત્માને મૃત્યુની જગ્યાએ ઘડેલી દેવાય.
- 6 હે યહોવા! કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના કોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
- 7 હે યહોવા સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો. તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુનઃ બિરાજો.
- 8 હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો, મને જાહેરમાં ન્યાયી હઠવો, અને તેઓ સમક્ષ મને તમે નિર્દ્દાષ ને પ્રમાણિક સાબિત કરો.
- 9 હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો. ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સામર્થ્ય આપો, કારણ કે તમે ન્યાયી દેવ છો, અને બધાના હદ્ય અને આત્મા જોઈ શકો છો.
- 10 દેવ મારી ઢાલ છે, જે સત્ય અને ન્યાયી હદ્યવાળાને તારે છે.
- 11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે; તે સર્વ દુષ્ટો પર, હમેશા કોપાયમાન થાય છે.
- 12 જો માણસ પાપનું પ્રાયશ્વિત નહીં કરે, તો તેની તીક્ષ્ણ તલવાર તે કરશે. તેણે પોતાના ધનુષને તાણીને સિદ્ધ કર્યું છે.
- 13 યહોવાએ તેને માટે ભયંકર હથીયાર સજજ કર્યા છે. અને પોતાના તીરોને અભિનીથી સણગતાં કર્યા છે.
- 14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે. તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે અને જૂદને જન્મ આપે છે.
- 15 તેણે ખાડા અને ખાઈ ખોદ્યા છે. અને તે પોતેજ તેમાં જઈને પડશે.
- 16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે.

- 17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છું. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સંમાનવા સ્તોત્ર ગાઈશ.

ગીત 8

નિર્દ્દશક માટે, "ગિતીથ સાથે ગાવાનું" દાઉદનું ગીત.

- 1 હે યહોવા, અમારા દેવ! સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે. ને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
- 2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પગટી છે. તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શક્તિશાળી ગીતો આપ્યા છે.
- 3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું. ને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું, ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
- 4 પછી મને આશ્રય થાય છે, કે માનવજાત શું છે, જેનું તમે સ્મરણ કરો છો? માણસો તે કોણ છે કે તેઓને તમે ધ્યાનમા લો છો?
- 5 કારણ, તમે અને દેવ કરતાં થોડોજ ઉત્તરતો સજ્યો છે, અને તેનાં માથા પર, મહિમા ને માનનો મુગટ મૂક્યો છે.
- 6 તમેજ તેને, તમે ઉત્પન્ન કરેલી સૂદ્ધીનો અધિકાર આપ્યો છે. અને તે સધળી સૂદ્ધિનો, તમે તેને કારભારી બનાવ્યો છે.
- 7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
- 8 વળી આકાશનાં પક્ષીઓ, સમુદ્રમાં રહેતા માઇલાં તથા જીવોનો પણ.
- 9 હે યહોવા, અમારા દેવ! સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

ગીત 9

નિર્દ્દશક માટે. રાગ: "બેન નો અલઅમોથ"

દાઉદનું ગીત.

- 1 હું યહોવાની, મારા સંપૂર્ણ હદ્યથી આભારસ્તુતિ કરીશ; અને તેમના અદ્ભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યક્તિ સમક્ષ પ્રગટ કરીશ.
- 2 હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઈશ.
- 3 મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઈને નાશ પામશે.
- 4 અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યા છે. તમે મને ન્યાય કરીને મારી સજી નિશ્ચિત કરી છે.
- 5 હે યહોવા તમે વિદેશી રાષ્ટ્રોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યા છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂસી નાખ્યાં છે.

- 6 હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે. ને સદાકાળ માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યા.
- 7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાડી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
- 8 તે જગતનો ન્યાય નિશ્પક્તાથી કરે છે. અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રમાણિકતા થી કરે છે.
- 9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને ડિલ્વારૂપ થશે, તે સર્વ સંકટોમાં સહૃ લોકોના ગઠ થશે.
- 10 જેઓ તમારું નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશો, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે ક્યારેય તરફોડ્યા નથી.
- 11 યરુશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ; ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જગ્યાવો.
- 12 કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રખે છે.* તેઓ રૂદ્ધ કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભૂલતો નથી.
- 13 “હે યહોવા, તમે મારા પર દયા કરો, મને મોતના મુખમાંથી બચાવો, મને કેવું દુઃખ છે! તે તમે જુઓ.
- 14 જેથી પછી હું યરુશાલેમના દરવાજે બધી લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઈશ. અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
- 15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડ્યા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપદાયા છે.
- 16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે. અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઈ ગયા છે.
- 17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ઘકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સધળાં લોકો શેઓલમાં જશે.
- 18 ભિખારીઓ કદીય ભૂલાઈ જશે નહીં. ગરીબોની આશા હુમેશ માટે નિરાશામાં નહીં ફેરવાય.
- 19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો! ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સન્મુખ થાય.
- 20 હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણો કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

ગીત 10

- 1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો? સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે, તમે પાછા કર્યાં સંતાઈ ગયા છો?
- 2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સત્તાવે છે અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઈ જાય છે.

કારણ ... યાદ રખે છે મૂળ પ્રમાણે, “લોહી શોધતા.” જે માણસને મારી નાંખવામાં આવ્યો હોય તેનો પરિવાર મારનારને સજી અપાવવા ન્યાયાલયમાં જઈ શકે. અહીં, દેવ ન્યાયધીશ જેવા છે જે બીજા લોકોથી પિડીત લોકોને સાંભળે છે.

- 3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઈચ્છાઓનું અભિમાન કરે છે; લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
- 4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ઘત માણસો માને છે કે દેવ છે જ નહીં; દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
- 5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે; ને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે. દેવનો ન્યાય તેમનાથી ધર્મો ઉચ્ચો છે.
- 6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ સુધી ક્રોઈ વિપત્તિ નહીં આવે.” એવી બડાઈ તેઓ હાંકે છે.
- 7 તેમનું મોહું જુદ્ધાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે. તેમની જીબ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
- 8 નિર્દ્યાગ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે. ક્રોઈ કમનસીબ વ્યક્તિને પસાર થતો જોવા માટે તેઓ છુપાઈ જાય છે.
- 9 જેમ સિંહ ગુજામાં છુપાઈને ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે; અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
- 10 તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે, અને લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.
- 11 તે પોતાના હદ્યમાં વિચાર કરે છે “આ શું થઈ રહ્યું છે? દેવ ભૂલી ગયા છે? તેમણે પોતાનું મુખ જોયું નથી સંતાડી રાખ્યું છે. અને શું તે કદી જોશ નહીં?”
- 12 હે યહોવા, હે દેવ, ઊઠો! તમારો હાથ ઉચ્ચો કરીને દુષ્ટ લોકોને શિકા કરો અને ગરીબને ભૂલશો નહીં.
- 13 હે દેવ! દુષ્ટો શા માટે તમારો દુરૂપયોગ કરે છે? શા માટે તેઓ તેમના હદ્યમાં વિચારે છે કે દેવ તેમની પાસે ક્યારેય જવાબ નહીં માગે?
- 14 હે યહોવા, તેઓ જે કાંઈ કરી રહ્યા છે તે તમે જુઓ છો. તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છો, તેઓની નજરમાં હુમેશા ઉપદ્રવ અને ઈર્ધા હોય છે. તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિકા કરો, હે યહોવા, ગરીબ માણસની દૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે તેમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
- 15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો. તેમાંથી એકને પણ છોડશો નહીં અનિષ્ટ કરનારાઓનો દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
- 16 આવનાર સદાકાળનો યહોવા રાજા છે. વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂસી નંખાયા છે.
- 17 હે યહોવા, તમે નમ્રની અભિમાન જાણો છો; તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો. ને તેઓના વ્યથિત હદ્યોને દિલાસો આપશો.

- 18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઈ પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહીં.

ગીત 11

નિર્દશક માટે. "દાઉદનું ગીત."

- યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી "શા માટે તમે મને, સુરક્ષા માટે પક્ષીની જેમ ઉડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?"
- કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણાછ બેચે છે જુઓ, તેમણે પણાછ પર તેમના તીર ચઢાવ્યા છે. તેઓ અચાનક આકુંઠા કરવા માટે જાડીમાં છુપાઈ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હદ્યમાં તીર વીધવાનું ધ્યેય રાખે છે.
- જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઈ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે?
- યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે. અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે. અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
- યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને વિકારે છે.
- દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અદ્દિન અને ગંધકનું નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂસિવાય કરી નહીં મેળવે.
- કારણ, યહોવા ન્યાયી છે ને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઈ શકશે.

ગીત 12

નિર્દશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે..

દાઉદનું ગીત.

- હે યહોવા, રક્ષા કરો; દેવથી ડરનારાઓનો નાશ થઈ રહ્યો છે તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
- લોકો તેમના પોતાના પાડોશીઓ સાથે જૂહું ભોલે છે. લોકો જૂડાણાથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
- પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો અને બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
- તેઓએ એમ કણ્ણું, "અમારી જીભથી અમે જીતિશું; હોઠ અમારો પોતાના છે. અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?"
- યહોવા કહે છે, "હવે હું તીભો થઈશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિઃસાસા લઈ રહ્યા છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ."
- યહોવાના શબ્દો સાત વખત ભડીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

- હે યહોવા, તેઓને સંભાળજો; આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
- દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે. અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.

ગીત 13

નિર્દશક માટે. "દાઉદનું ગીત."

- હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિઃસહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
- આખો દિવસ માલં હદ્ય દુઃખથી ભરાઈ ગયું છે અને હું મારી જાતને પૂછ્યા કરું છું; જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હદ્યમાં આ દુઃખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જુતતા રહેશો?
- હે યહોવા, મારા દેવ, ધ્યાન દઈ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિન્દ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જ્યોતિ પ્રગટાવો.
- શત્રુઓને કહેવા દેશો નહીં કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રણજીત ન કરતાં.
- મેં હુમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તમારી પાસેથી મુક્તિ મેળવવામાં મારા હદ્યને આનંદ મળશે.
- યહોવા સમક્ષ હું ગાયન ગાઈશ, કારણ, યહોવાએ મારા પર કૃપા કરી છે.

ગીત 14

નિર્દશક માટે. દાઉદનું ગીત.

- મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: "દેવ છે જ નહીં." તે માણસ બ્રષ્ટ અને અનોટિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઈ સત્કર્મ કરનાર નથી.
- યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જીણવા માટે, કે કોઈ ડાંધાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
- પણ ના! ત્યાં કોઈ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઈ ગયા છે.
- તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે, ને તે દુષ્કર્મા કરનારાઓ દેવને નથી જીણતા. તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
- જુઓ! તેઓ ભયભીત થઈ ગયા છે, કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
- દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે. પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
- ભલે ઈસ્થાભેલનું તારણ સિયોન પર્વત પર આવે. જ્યારે યહોવા ઈસ્થાભેલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી.

આપણે ત્યારે યાકૂબ પ્રસન્ન થશે. અને ઈસ્તાએલ સુખી થશે.

ગીત 15

દાઉદનું ગીત.

- 1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
- 2 જે સાધુશીલતા પાળે છે, જે ન્યાયથી વર્તતા હદ્યથી સત્ય બોલે છે.
- 3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી, તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી. તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી; ને કયારેય પોતાના પાડોશીને હાની પહોંચાડતો નથી.
- 4 તેની દૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
- 5 તે તેણે ધીરલાં નાણાં ઉપર બહુ ઊંચું વ્યાજ લઈને તે કોઈનું શોષણ નથી કરતો. તે નિર્દ્યાષ માણસો સામે જૂઠી સાક્ષી દઈને કદી લાંચ નથી લેતો. જેઓ આ રીત જીવે છે તે હમેશા સુરક્ષિત રહેશે.

ગીત 16

દાઉદનું મિખામ.

- 1 હે યહોવા મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છું.
- 2 મે યહોવાને કર્યું છે, "તમે મારા માલિક છો. મારી પાસે જે બધું સારું છે તે ફક્ત તમારી પાસેથી જ આવ્યું છે.
- 3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે; એવાં સ્ત્રી પુરુષના સંગમાંજ મને આનંદ મળે છે.
- 4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુઃખના દરિયામાં દૂબી જશે. હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના અર્પણોમાં જોડાઈશ નહીં. હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહીં.
- 5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા ઘ્યાલાનો ભાગ છો. હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
- 6 આનંદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે.
- 7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું. રોજ રાતે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
- 8 મે યહોવાને સદા મારી સામે રાખ્યા છે, તેથી મને કદી પડવાનો કે ઢોકર ખાવાનો ડર નથી. હું તેમના

જમણા હાથ પાસેજ છું, ત્યાંથી મને કોઈ ખસેડી શકે તેમ નથી.

- 9 તેથી મારું હદ્ય ભરપૂર આનંદમાં છે. ને મારો આત્મા પણ ખુશ છે; તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
- 10 કારણ, તમે મારો આત્મા, શેઓલને સોંપણો નહીં. તમે તમારા ભક્તિને કબરમાં સડવા જવા દેશો નહીં.
- 11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગ મારે જવું. તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે. તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.

ગીત 17

દાઉદની પ્રાર્થના.

- 1 હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની મારી પ્રાર્થના પર ધ્યાન આપો; કારણકે હું પ્રમાણિક છુ અને સત્ય બોલું છુ, જે ન્યાયી છે તે જ મેં કર્યું છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
- 2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે, તમે સત્યને જોઈ શકો છો.
- 3 તમે મારા હદ્યને ઉડાણમાંથી જોયું છે. તમે રાત્રે મારી સાથે હતો. તમે મારું પારખું કર્યું છે અને મારો કોઈ દોષ કાઢ્યો નથી. હું કદી ખરાબ યોજના કરતો નથી, અને તે તમે જ્ઞાનો છો.
- 4 મેં સદા તમારી આશાનું પાલન કર્યું છે, અને જીવમિઓના માર્ગથી હું દૂર રહ્યો છું. ને કૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
- 5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યા છે, ને મારો પગ કદી લપસ્યો નથી.
- 6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો અને તેનો જવાબ આપો.
- 7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગો છે; તેઓને તમે તમારા જમણો હાથે તમારી અદ્ભુત કરુણા બતાવી બચાવી લો છો.
- 8 તમારી આંખની કીકી સમજુને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
- 9 મને લુંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો, મને ચારેબાજુ ધરી વળેલા ભયજનક શત્રુઓથી મુક્ત કરો.
- 10 તેઓ તો દયાહીન અને ઉદ્ઘત છે, તેઓના મોઢે તેમની બડાઈ સાંભળો.
- 11 તેઓ અમને ડગલે ડગલે ધેરીને ઉભા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પદ્ધાડવાને તાકી રહી છે.
- 12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. અને ત્રાકવાની રાહ જોતા છુપાઈ ગયેલા સિંહના બચ્યાના જેવા છે.

- 13 હે યહોવા, તમે ઉઠો; આવો અને શત્રુઓની સામે થાઓ, તેઓને પાડી નાખી, પરાજીત કરી દો, અને તમારી તલવાર વડે મને દૃષ્ટોથી બચાવો.
- 14 હે યહોવા, તમારી શક્તિ દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી આ સજ્જવાની દુનિયામાંથી દૂર કરો. પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે, હે યહોવા તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે પણ પુષ્કળ હશે અને તેથી તેમનાં પૌત્રો માટે પણ પૂરંતુ બચાવી શકે.
- 15 પણ હું ન્યાય પૂર્વક વર્ત્યો હું તેથી હું તમારો ચહેરો જોઈ શકું, અને તમને જોઈને મને સંતોષ થશે.

ગીત 18

નિર્દશક માટે. યહોવાના સેવકનું ગીત, જે દિવસે યહોવાએ તેને તેના બધા શત્રુઓના હાથમાંથી તથા શાલિનાં હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનું વચન કર્યું.

- 1 "હે યહોવા, મારા સામર્થ્ય, હું તમને ચાહું હું."
- 2 યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે. દેવ મારો ખડક છે. તે મારણ આશ્રયસ્થાન છે. તે મારી ઢાલ છે. તેની શક્તિ મારું રક્ષણ કરે છે.* પર્વતોમાં ખૂબ ઉચ્ચાઈ પર તે મારણ સુરક્ષાનું સ્થાન છે.
- 3 યહોવા સ્તુતિપાત્ર છે. હું તેમને વિનંતી કરીશ અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.
- 4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે. અને દુષ્ટાનાં મોઝી મારા પર ફરી વળ્યાં છે.
- 5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે. મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.
- 6 મને મારા સંકટમાં સહાય કરવાં મેં યહોવાને ક્રાણાભરી વિનંતી કરી તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો, અને તેનાં ક્રાનમાં મારી અરજ પહોંચી ગઈ.
- 7 ત્યારે ધરતી થરથર ધુજુ ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા, ને હલવા લાગ્યા. પર્વતો ધુજુ ઊઠ્યા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.
- 8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અનિ નીકળવા લાગ્યો. તેમનામાંથી સણગતાં તણખા નીકળ્યાં.
- 9 તેમણે આશાને ચીર્યું અને પગની નીચે કાળા વાદળા સાથે નીચે ઉત્તર્યાં.
- 10 તેઓ કરુબ પર ચડીને દેવદૂત પર ઊડતા હતાં. અને તેઓ પવનમાં ઉચ્ચ ઊડતા હતાં.
- 11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે. અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દિવેલ છે.

તેની... કરે છે મૂળ પ્રમાણે: "તે મારા તારણનું શીંગ છે."

- 12 એકાએક તેમના ઉજ્જવળ ઘડાકા સાથે વીજળી ચ્યમકી. પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યાં.
- 13 યહોવાએ આકાશમાંથી ગર્જના કરી. ને પરાત્પર દેવે મોટો અવાજ કાઢ્યો. એના પરિણામે ત્યાં કરા પડ્યા અને વીજળીના ચ્યમકારા થયા.
- 14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર છોડ્યા અને તેમને મુજબીને વિખેરી નાખ્યાં.
- 15 પછી હે યહોવા, તમારી આશાથી, જુઓ, સમુદ્રનાં તળીયાં દેખાયા. તમારાં નસકોરાનાં શ્વાસથી ધરતીના પાયા ઉઘાડા થઈ ગયા.
- 16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો અને મહા વિપત્તિના ઊડા જળમાંથી મને બહાર બેંચી લીધો.
- 17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્રેષ્ટિઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતા જોરાવર હતા ને મને ધિક્કારતાં હતા.
- 18 મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, અને હું તો અતિ નિર્બણ હતો, પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો.
- 19 તેઓ મને ખુલ્લી જગ્યામાં દોરી ગયાં. અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.
- 20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે, મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
- 21 કારણ કે મેં યહોવાની આશા પાળી છે, ને મેં તેમની વિમુખ થઈને ભૂલાઈ કરી નથી.
- 22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો હું. મેં તેમની આશા હમેશા સન્મુખ રાખી છે અને તેમાની એકેય આશાની અવગણના કરી નથી.
- 23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રમાણિક હતો. અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોધ્ય કરવાથી દૂર રાખી છે.
- 24 યહોવાએ મારણ ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધકતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદ્બિનિ દીધું છે.
- 25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો. જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, અને તમે એકનિષ્ઠ છો.
- 26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો. પણ જેઓ હીન અને ચારીયા છે તેઓને તમે પડકારી શકો છો.
- 27 તમે ગરીબ લોકોને બચાવો છો, અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
- 28 યહોવા, મારા દેવ! તમે મારા હદ્યમાં દીવાં પ્રગટાવો છો! મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરબ્યો છો.

- 29 તમારા સામર્થ્ય વડે હું હવે કિલ્વો પણ કૂદી જાઉ છું.
અને કોઈપણ સૈન્યની ટૂકડી પર હું આકમણ કરી
શકું છું.
- 30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ
પારખેલો છે. જેઓ તેના પર ભરોસો રાખે છે, તે
સધળાની એ ફાલ છે.
- 31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે? તેના વિના
ખડક સમાન બીજું કોણ છે?
- 32 તેમની શક્તિથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર
જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
- 33 તે મારા પગોને હરણીની જેવું દોડવાં જેવા બનાવે છે
અને ઉચાઈઓ પર પણ મને સ્થિર રાખે છે.
- 34 મારા હાથોને તેઓ લડતાં શીખવે છે. પિતળનું ઘનુષ્ય
ખેંચવાની શક્તિ તેઓ મને આપે છે.
- 35 તમે ફાલ બનીને મને સંરક્ષણ આપ્યુ છે, તમારા
જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે, અને મને
વારંવાર મદદ કરી છે.
- 36 તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે, જેથી મારા
પગ કદી લપસ્યાં નથી.
- 37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી
પાડીશ. અને તેઓનો નાશ ન થાય ત્યાં સુધી પાછો
ફરીશ નહીં.
- 38 હું તેઓને એવા સખત પણાડીશ કે તેઓ ફરી ઊભા
નહીં થઈ શકે. તેઓ મારા પગે પડશે અને હું તેમની
ડોક પર પગ મૂકીશ.
- 39 કારણ તમે મને શક્તિરૂપી શસ્ત્રથી સજજ કર્યા છે.
મારી સામે થનારને તમે મારે તાંબે કર્યા છે.
- 40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક
આપી હતી. તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યા છે, તે
સર્વનો મેં સંહાર કર્યા છે.
- 41 તેઓએ ઘણી બૂમો પાડી છતાં તેઓને બચાવનાર
કોઈ નહોતું. હા, તેઓએ યહોવાને વિનંતી કરી, પરંતુ
કોઈ જવાબ મળ્યો નહીં.
- 42 પવનથી કૂકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં
છે અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી
નાખ્યાં છે.
- 43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. મને
બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો. જે લોકોને હું જાણતો
પણ નથી તેઓ મારી સેવા કરશે.
- 44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે. ને મારો હુકમ
સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
- 45 પરદેશીઓ હિંમત ગુમાવી બેંકા છે, ને ધૂજતાં ધૂજતાં
તેઓ કિલ્વાની બહાર આવે છે.
- 46 યહોવા જીવતા જાગતા દેવ છે. મારા રક્ષકને ધન્ય
હો; મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર
કરો.

- 47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે અને રાષ્ટ્રોને
મારા તાબામાં મુકું છે.
- 48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે. અને મારી સામે
થનાર પર મને વિજય અપાવે છે. મારી લાજ લુંટનાર
માણસથી, મને બચાવે છે.
- 49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,
અને હું તારા નામના સ્તોત્ર ગાઈશ.
- 50 યહોવા તેમના દ્વારા પરસંદ કરેલા રાજાઓને ઘણા
વિજયો મેળવવામાં મદદ કરે છે, યહોવા પોતે
અભિષિક્ત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે. યહોવા
દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.

ગીત 19

નિર્દશક માટે. દાઉદનું ગીત.

- 1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે. અંતરિક્ષ તેના
હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
- 2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો
કહે છે. દરેક રાત દેવના સામર્થ્ય વિષે વધારે કહે છે.
- 3 ત્યાં વાણી નથી ત્યાં શબ્દો નથી. કોઈ અવાજ
સાંભળાતો નથી,
- 4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો”
સાંભળે છે. તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
- 5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરયાજા
જેવો છે, તે દોડની સ્પર્ધાના આનંદિત, તેજસ્વી અને
બળવાન ખેલાડી જેવો છે.
- 6 તે આકાશને એક છેડથી નીકળી અને તેના બીજા
છેડા સુધી પરિકમજા કરે છે. તેની ઉષ્ણતા પાંચાં
વિના કોઈ બાકી રહી જતું નથી.
- 7 યહોવાના પવિત્ર વચ્ચનો સંપૂર્ણ છે. તે આત્માને તાજળી
આપે છે. યહોવાની વાણી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાઢ્યા થવા માટે મદદ કરે છે.
- 8 યહોવાની વિવિધો યથાર્થ ને સત્ય છે. તેઓ હંદયને
ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મણ
છે. જે આંખોને પ્રકાશ આપે છે.
- 9 યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદિ છે. યહોવાના
દરાવો નિર્ણય અને સાચા છે. તેઓ સંપૂર્ણપણે
ન્યાયી છે.
- 10 તે શુદ્ધ સોના કરતાંય વધુ, પસંદ કરવા યોગ્ય છે. ને
વળી મધ્યપૂડાનાં ટીપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં
છે.
- 11 કારણ, તમારા ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે
છે અને તેઓ જેઓ તેનું સદ્ય પાલન કરે છે, તેઓને
સફળતા આપે છે.
- 12 મારા હંદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકું
કરો.

- 13 મને કોઈનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુક્ત અને પૂર્જ થઈ અને મહાપાપ કરવામાંથી બચી જઈશ.
- 14 મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા; મારા મુખના શબ્દો, તથા હદ્યનાં વિચારો જે હું તમારી સમક્ષ વ્યક્ત નથી કરી શક્યો, તે તમે સદ્ય માન્ય રાખો.

ગીત 20

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

- 1 સંકટનાં દિવસોમાં યહોવા, મારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપે; યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરે.
- 2 ભલે તેઓ પોતાના પવિત્ર સ્થાનમાંથી તેમની મદદ મોકલે અને તમને સિયોનમાંથી શક્તિ આપે.
- 3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી, અને તારું દહ્નાર્પણ સ્વીકારે.
- 4 તને તારી ઈચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
- 5 તમારી મુક્તિ અમને સુખી બનાવશે, ભલે યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
- 6 યહોવાએ પોતે જેને અભિષિક્ત કર્યા છે, તેને વિજય અપાવે છે, તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારક શક્તિથી તને જવાબ આપશે.
- 7 કોઈ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્ત્રો વિષે અભિમાન કરે છે, બીજા કોઈ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે. પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
- 8 તેઓને નમીને પડી ગયા છે. પણ આપણે અડગ ઊભા રહીશું.
- 9 હે યહોવા અમારા રાજાને વિજય આપો. અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ તમે જવાબ આપો.

ગીત 21

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

- 1 હે યહોવા, તમારી શક્તિથી રાજા ખૂબ આનંદ પામે છે. તમારા તારણથી તને એટલો બધ્યો ગર્વ અને આનંદ થાય છે.
- 2 કારણ કે તમે તેને તેનાં હદ્યની ઈચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠ કરેલી અરજીને તમે કદી નકારી નથી.
- 3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાઓ છે. અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગાટ પહેરાવ્યો છે.
- 4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માંગ્યુ, અને તમે તેને સર્વકાળ રહે તેવું દીર્ઘયુદ્ધ આપ્યું.

- 5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની ડિર્ટિમાં ધણો વધારો થયો. તમે તેને કૃપાના અને ગૌરવના વસ્તોથી શાણગાયો છે.
- 6 કારણ કે તમે તેને હુમેશા આશીર્વાદ આપો છો. અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
- 7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાતપર દેવની કૃપાથી વચ્ચિત કરવામાં નહીં આવે.
- 8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢો કે કોણ તમને ધિક્કારે છે.
- 9 જ્યારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અંજિમાં નાશ પામશે. તેઓ યહોવાના કોપથી ગળી જશે અને તેમનો કોપાંજી તેમને બાળીને રાખ કરી દશે.

- 10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે; માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
- 11 કારણ, હે યહોવા આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતલું કર્યું છે. છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
- 12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે. તે જ્યારે તેઓ જોશો, ત્યારે તેઓએ પાછા હટી જવું પડશે.
- 13 હે યહોવા, તમારા મહાન સામર્થ્ય માટે અમે તમારી; સુતિ કરીએ છીએ; અને તમારા મહાન કર્માની ઉજવણી કરવા સુતિગીતો બનાવી ગાઈશું.

ગીત 22

નિર્દેશક માટે. દાણ: "પરોણનું હરણ." દાઉદનું ગીત.

- 1 હે મારા દેવ, તમે મને કેમ ત્યજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
- 2 હે મારા દેવ! દિવસ દરમ્યાન હું રૂદ્ધ કરું છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
- 3 દેવ, તમે પવિત્ર છો તમે તે ઈચ્છાએલની પ્રંશસાના સિંહાસન પર બિરાજો છો.
- 4 અમારા પૂર્વજીએ, તમારા પર ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
- 5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યા. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા!
- 6 હું, માણસ નથી, પણ હું તો માત્ર કીડો છું. સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે. અને મને તુચ્છ ગણે છે.

- 7 જેઓ મને જૂએ છે, તેઓ બધાં મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધૂણાવી ને અડવી વાણી
બોલે છે.
- 8 તેઓ મારી મશકરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે
કારણ તે તને ખૂબ પસંદ કરે છે.”
- 9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં
હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ
તમે મારી સંભાળ લઈને વિશ્વાસ જગાવ્યો હતો.
- 10 હું જ-મથી જ તમારા હાથમાં સૌંપાયેલ છું. મારા
બાળપણથી જ તમે મારા દેવ છો.
- 11 તમે મારાથી જરાય આધા ખસશો નહીં કારણ મારા
માથે સંકટ આવ્યું છે. અને મને સહાય કરે તેવું મારી
સાથે કોઈ નથી.
- 12 ધણા ભયંકર શત્રુઓએ, મને ઘેરી લીધો છે. બાશાનના
આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
- 13 જેમ ઝડી ખાનાર સિંહ ગર્જના કરતો પોતાના શિકાર
પર આકમણ કરે છે, તેમ તેઓ પોતાના મોં ખુલ્લા
રાખીને મારી તરફ ધસી આવે છે.
- 14 જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ પણ ચાલી
ગઈ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલા થઈ છૂટા પડી
જાય છે, તેમ મારું હંદય પણ મીણનાં જેવું પોચું થઈ
અને આંતરડામાં ઓગળી ગયું છે.
- 15 મારું બળ મારીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવું
સુદુર થઈ ગયું છે. મારી જીભ મારા મુખના તાળવે
ચોટી જાય છે. અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર
નાખી દેવામા આવ્યો છે.
- 16 કારણ, મારી આસપાસ કુતરાં ફરી વળ્યા છે; અને
મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ
મારા હાથપગ વીધી નાખ્યા છે.
- 17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગળી શકું છું. આ માણસો
કેટલા દુષ્ટ અને કૂર છે! તેઓ ધારી ધારી ને કેવા
જુએ છે!
- 18 તેઓ, મારા વસો, અંદરો અંદર વહેચી લે છે અને
મારા જભા માટે અંદરો અંદર ચિંહી નાખે છે.
- 19 હે યહોવા, મારાથી દૂર ન જશો. હે દેવ! હે મારા
આશ્રય; મારા સામર્થ્ય, મારી મદદે આવો.
- 20 મને આ તલવારથી બચાવો, મારી રક્ષા કરી મારું
મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
- 21 મને સિંહોના જડબામાંથી બચાવો. તે બળદોના
શિંગડાઓથી મારું રક્ષણ કરો. *
- 22 હું તમારી વિષે મારા બધા ભાઈઓને વાત કરીશ. હું
ભરી સભામાં તમે કરેલી અદ્ભૂત વસ્તુઓ વિષે વાત
કરીશ.”
- 23 હે યહોવાનો ભય રાખનારાઓ! તેમના ગુણગાન
ગાઓ. તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
હે ઈચ્છાએલી પરિવારો, તેમનો ભય રાખો.
- 24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય, ત્યારે કદી એમની
અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ
એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને
પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
- 25 મોટી મંડળીમાં; હું તમારી દૃપાથી તમારી સુતિ કરું
છું ; સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી
માનતા પૂરી કરીશ.
- 26 દરદ્રીજનો ખાઈને તૃપુથ થશે, જેઓ યહોવાને શોધે
છે, તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સુતિ કરશે.
- 27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની
પાસે પાછા ફરે. ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને
યહોવાની ઉપાસના કરે.
- 28 કારણ, યહોવા રાજા છે, અને તે સર્વ પ્રજા ઉપર રાજ
કરે છે.
- 29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ
ખાદું છે અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે – હા,
એ બધા જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે
બધાં યહોવાની સામે નીચા નમશે.
- 30 યહોવાનાં અદ્ભુત કર્મા વિષે આવતી પેઢી પણ
સાંભળશે, ને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા
કરશે.
- 31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં
સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું
ન્યાયીપણું પ્રગટ થશે.

ગીત 23

દાઉદનું ગીત.

- 1 યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કદી, કશી
ખોટ પડશે નહીં.
- 2 તે મને લીલાં બીડમાં સુવાડે છે. અને મને શાંત
જળની તરફ દોરી જાય છે.
- 3 તે મને નવું સામર્થ્ય ને તાજગી આપે છે. તેમનાં
નામનો ભહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને
માર્ગ ચલાવે છે.
- 4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો
હું ડરીશ નહીં; કારણ હે યહોવા, તમે મારી સાથે
છો, તમારી લાકડી તથા છડી મને આશ્વાસન આપે
છે.
- 5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઈવો છો.
અને માથા ઉપર તેલ રોડો છો. મારો પ્યાલો તમે
વરસાવેલા આશીર્વાદથી છલકાઈ જાય છે.

- 6 તમારી ભલાઈ અને દ્યા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે. અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

ગીત 24

દાઉદનું ગીત.

- આ પૃથ્વી યહોવાની છે! અને જગતનું સર્વ કાઈ પણ તેનું છે, આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
- તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાંખ્યો છે. અને તેમણે નદીઓ પર સ્થાપન કર્યું છે.
- યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમનાં નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકશે? તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઉભો રહી શકશે?
- ફક્ત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હદ્ય નિર્મળ છે, તેઓએ મારા નામના જૂહીનું સમ લીધા નથી, તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી, અને જૂહુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
- તેઓ યહોવાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
- તેઓ પેઠીના લોકો છે જેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
- પ્રવેશદ્વારો તમારાં માથા ઊચા કરો! હે પ્રાચીન પ્રવેશદ્વારો ઉધડી જાઓ અને, માનવંત રાજા અંદર આવશે!
- તે ગૌરવવાન રાજા કોણ છે? એ સામર્થ્યવાન બળવાન યહોવા છે, તે યહોવા જે યુદ્ધમાં પરાકર્ણી છે.
- પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊચા કરો. અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો. હે પ્રાચીન પ્રવેશદ્વારો ઉધડી જાઓ; અને માનવંત રાજા અંદર આવશે!
- આ ગૌરવવાન રાજા કોણ છે? યહોવા આકાશોના સર્વ સૈન્યનો માલિક અને ગૌરવવાન રાજા છે.

ગીત 25

દાઉદનું ગીત.

- હે યહોવા, મારી જાતને તને સોપું છું.
- હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઈ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહીં.
- જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહીં રહે. પણ વિશ્વાસધાતીઓની માનહાનિ થશે. તેઓને તેમના વિશ્વાસધાતથી કોઈ ફાયદો નહીં થાય.
- હે યહોવા, મારે ક્યા માર્ગ જવું, તે તમે મને બતાવો; ને ચાલવાનો યોગ્ય માર્ગ તમે મને બતાવો.

- મને માર્ગદર્શન અને જ્ઞાન આપો કારણ, તમેજ માત્ર મારા તારણ આપનાર છે. હું આખો દિવસ તમારી રાહ જોઉં છુ.

- હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દ્યાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.

- જીવાનીનાં પાપ અને અપરાધનું સમરણ ન કરો. હે યહોવા, તમારા શુભ નામને માટે, તમારી કૃપા અને અનુકૂળા સાથે મને યાદ કરો.

- યહોવા સારા અને પ્રમાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગ દોરે છે, અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ત છે તે શીખવે છે.

- તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માર્ગ જીવવાનું શીખવે છે.

- જ લોકો તેના પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમનાં તરફ યહોવા દ્યાળું અને વિશ્વાસું છે.

- હે યહોવા, મારા પાપ તો ધણાં છે, તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.

- યહોવાથી ડરે એવા માણસો કયાં છે? શ્રેષ્ઠ જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.

- તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે; ને તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.

- જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે. તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.

- સહાય માટે મારી દ્રષ્ટિ સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ઝાંદામાંથી કાઢશે.

- હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દ્યા કરો. હું નિરાશ્શીલન, દુઃખી, નિઃસહાય અને એકલો છું.

- મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે. હે યહોવા, તે બધામાંથી મને મુક્ત કરો.

- મારા દુઃખને વેદના પર જરા નજર કરો, અને કૃપા કરી સર્વ પાપની ક્ષમા કરો.

- મારા શત્રુઓ ધણાં છે તે જરા જુઓ; તેઓ કેટલી કૂરતાથી મારી ધૃતા કરે છે તે જુઓ.

- મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો. લાજ જવા દેતા નહીં મારી, કારણ, હું તમારો વિશ્વાસ કરું છું.

- મારા પરાકર્મીપણા તથા ન્યાયીપણાના, તમે રક્ષ બનો. કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.

- હે યહોવા! હવે તમે ઈસાએલને સર્વ સંકટોમાંથી છોડાવો.

ગીત 26

દાઉદનું ગીત.

- હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રમાણિકપણે વર્ત્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડર્યો

- નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દ્યાપ જાહેર કરો.
- 2 હે યહોવા, પૂરી તપાસ કરી, મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની ઈચ્છાઓને પણ કસોટીની એરણે ચંદ્રાવી પરીક્ષા કરો.
 - 3 કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું. અને હું હમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
 - 4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
 - 5 હું દુષ્ટોની સંગતને વિકારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહીં.
 - 6 હું મારી નિર્દ્યાપતા સાબિત કરવા મારા હાથ ધોઈશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
 - 7 હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચયમત્કારી કર્મ પ્રગત કરું છું.
 - 8 હે યહોવા! મને પ્રિય છે તમારું મંદિર, અને તે જગ્યા જ્યાં તમારું ગૌરવ છે.
 - 9 પાપીઓ સાથે મારો સર્વનાશ કરશો નહીં. માણસોની સાથે મને મારી નાખશો નહીં.
 - 10 તેઓ હમેશા ધૂણાજનક કૃત્યો કરે છે. અને તેમના જમણા હાથ લાંઘુરુસ્વતથી ભરેલાં છે.
 - 11 હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રમાણિકપણાના માર્ગ ચાલું છું, મારા પર દ્યા કરી મારો બચાવ કરો.
 - 12 યહોવાએ મને પડી જવા દીધો નથી, નથી દીધો મને લપસવા. માટે હું યહોવાની સુતિઓ ગાઈશ. જેમણે લોકોને ભેગાં કર્યા છે તેઓ વચ્ચે હું ઊભો છું

ગીત 27

દાઉદનું ગીત.

- 1 મારું તારણ અને પ્રકાશ છે, યહોવા. શા માટે મારે ક્રોઈથીય ડરવું? મારા જીવનનું સામર્થ્ય છે, યહોવા. શા માટે મારે ક્રોઈનાથી ડરવું?
- 2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠાકર ખાઈને નીચે પડશે.
- 3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તો પણ હું જરાય ડરવાનો નથી; ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે; પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
- 4 હું એકજ વસ્તુ માંશુ છું યહોવાથી, "મારા જીવનના સર્વ દિવસો પર્યત મને યહોવાના મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્ર કિલ્વાઓની મુલાકાત કરું."
- 5 સંકટના સમયે તેઓ ખરેખર મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે. અને મને તેમની સુરક્ષિત જગ્યાએ લઈ જશે.
- 6 મારા શત્રુઓ મને વેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે. હું તેના મંડપમાં હર્ષનાદ

સાથે અર્પણો ચંદ્રાવીશ. હું સુતિગીતો ગાઈશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યક્ત કરે.

- 7 હે યહોવા, મારી વિનતી સાંભળો મારા પર દ્યા કરીને મને જરૂરી સહાયતા આપો.
- 8 મારું હદ્ય તમારા વિષે કહે છે કે તમે ઈચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા! હું તમારી પાસે તમારું મુખું શોધવા આવું છું.
- 9 હે યહોવા, હું તમારી પાસે આવું છું. તમે તમારું મુખ મારાથી ફેરવશો નહીં. તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, અને મને ધક્કો મારી કાઢી ન મૂક્યો એ તમે જ છો જેણે મને ભૂતકાળમાં મદદ કરી છે. હે મારા તારણહાર, મારા દેવ, હવે મને ધોડી ન દેતા અને મને ત્યજી ન દો.
- 10 જો મારા માતાપિતાએ મને ત્યજી દીધો છે, પરંતુ યહોવા તો પણ મને સાંભળશે અને સ્વીકારશે.
- 11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું? હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉં છું. માટે હવે મને તમે સત્કર્મના સરણ માર્ગ દોરી આઓ.
- 12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો. કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે તથા તેઓ હમેશા મને નિષ્ઠુરતાથી ઈજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
- 13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી ધોડાવશે, અને હું જીવનમાં તેમની દ્યાનો અનુભવ કરીશ.
- 14 તું યહોવાની રાહ જોજે, વૈર્ય ગુમાવીશ નહીં; તેઓ જરૂર આવશે અને તને બચાવશે; બળવાન થા અને હિંમત રાખ; હા, તું યહોવાની રાહ જોજે, તેઓ તને સહાય કરશે.

ગીત 28

દાઉદનું ગીત.

- 1 હે યહોવા! તમને મદદ માટે પ્રાર્થના કરું છું. હે મારા ખડક, તારા કાન બંધ નથી રાખતો, કારણકે તું મારા મદદના પોકાર નો જવાબ નહીં આપે તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
- 2 હે યહોવા! મદદ માટેની મારી બૂમો સાંભળો. તમારી સૌથી પવિત્ર જગ્યા તરફ હું હાથ ઊચા કરું છું; અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
- 3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા. તે નીચે લોકો તેમના પડોશીઓને "સલામ" * કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.

સલામ આ હિંબુ શબ્દનો અર્થ છે શાન્તિ. એ શબ્દ સત્કાર માટે વપરાતો હતો.

- 4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો, તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો; જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
- 5 તેઓ યહોવાની, તેમના મહાન કર્માની અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે; જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે ને ફરી કદી સ્થાપિત કરશે નહીં.
- 6 યહોવાની સ્તુતિ થાઓ, કારણ, તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
- 7 યહોવા મારું સામર્થ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે. મારા હદ્દે તેમનો ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. મારા હદ્દ્યમાં અત્યંત આનંદ થાય છે તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનું છું.
- 8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે. યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સામર્થ્ય છે.
- 9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો, અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું હમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊચકી રાખો.

ગીત 29

દાઉદનું ગીત.

- 1 હે પરાકમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સામર્થ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
- 2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો. યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસો પહેલીને આવો અને તેમની ઉપાસના કરો આવો અને તેમનું ભજન કરો.
- 3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે; ગૌરવવંતા દેવ મહાસાગર પર ગજના કરે છે.
- 4 યહોવાનો અવાજ તેમની શક્તિ નિરૂપે છે, યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
- 5 યહોવાના અવાજથી ગંધતરુઓ ભાંગી ગયા છે લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
- 6 યહોવા હેર્માન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધુજવે છે. તે તેમને વાઇરડાની જેમ કૂદાવે છે.
- 7 યહોવાનો અવાજ વીજળીઓને ભેટી અને ગર્જના કરે છે.
- 8 યહોવાના સાદના પડધા રણને, અને કાદેશના એ રણને ધુજાવે છે.
- 9 યહોવાનો અવાજ દેવદારના વૃક્ષોને ધુજાવે છે અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે. 'યહોવાનો મહિમા થાય.'

- 10 જળપ્રલય સમયે યહોવા, સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા. અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
- 11 યહોવા પોતાના લોકોને સામર્થ્ય આપશે, અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીત 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનું. દાઉદનું ગીત.

- 1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ, તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીઘો નથી.
- 2 હે યહોવા મારા દેવ, મેં તમને અરજ કરી, ને તમે મને સાજો કર્યા.
- 3 હે યહોવા, તમે મને શેષોલમાંથી પાણો કાઢી જીવતો રાખ્યો છો! તમે મને કબરમાં પડવા દીઘો નથી.
- 4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની પ્રશાસ્તિ ગાઓ. અને તેમના પવિત્ર નામની સ્તુતિ ગાઓ.
- 5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૂપા "જીવન"ભર માટે છે. રૂદ્ધ ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષનાદ થાય છે.
- 6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કંધું હતું, "હું ડોશ નહીં." હું સમજતો હતો કે આ સ્થિતિ સદ્ગ્ય રહેશે.
- 7 હે યહોવા, તમે મારા પર કૂપા કરી મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે, પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને તમે મને ભયભીત કર્યો છે.
- 8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો અને મેં તમને વિનંતી કરી.
- 9 "હે યહોવા! હું મરી જઈશ તો તમારું શું સારું થશે? મારી કબરની ધૂળ તમારી પ્રશાસ્તિ કરી શકશે? શું તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
- 10 હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સાંભળો મને સહાય કરો."
- 11 પછી તમે મારા દુઃખનું સુખ કર્યું, અને રૂદ્ધને બદલે મૃત્યુ આપ્યું; મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
- 12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ; હે યહોવા, મારા દેવ, હું સદ્ગ્ય તમારી આભારસ્તુતિ કરીશ.

ગીત 31

નિર્દ્દશક માટે. દાઉદનું ગીત.

- 1 હે યહોવા! હું તમારી ઉપર આધાર રાખ્યું છું મને નિરાશ ન કરશો. મારી સાથે હમેશા સારા રહેજો અને મને કૂપા આપતા રહેજો.

- 2 હે યહોવા, મને સાંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગ્યા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો.
- 3 દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારો નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો.
- 4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો. કારણ તમે મારો કિલ્લો છો.
- 5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે સત્યના દેવ યહોવા, તમે મારો ઉદ્ધાર કર્યો છો.
- 6 જૂઢા દેવોની પૂજા કરનારને હું વિક્કારું છું, હું ફક્ત યહોવામાં ભરોસો કરું છું; યહોવા, હું તમારી દ્યાથી આનંદથી હરખાઈશ તમે મારું સધળું દુઃખ જોયું છે, મારા આત્માની વ્યથા નિહાળી છે.
- 8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છો.
- 9 હે યહોવા; હું સંકટમાં છું, હિંમત હારી ગયો છું, મારા પર દ્યા કરો; શોકથી મારું શરીર, આંખને મારો પ્રાણ ક્ષીણ થાય છે.

- 10 મારા જીવનનો અંત આવે છે. ઉદાસીમાં મારા વર્ષો નિઃસાસામાં પસાર થાય છે. મારા પાપોએ મારી શક્તિ હણી લીધી છે. અને મારા હાડકા બરડ થઈ રહ્યાં છે.
- 11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પાડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સંબંધીઓને મારો બય લાગે છે; તેથી તેઓ મને અવગાણે છે. જેઓ મને જુઝે છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
- 12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું; હું ફક્ત દીઘેલાંને ફૂટી ગયેલાં વાસણ જેવો છું.
- 13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે. તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને ક્રાવતરાં કરે છે.
- 14 પરંતુ હે યહોવા! હું તમારો વિશ્વાસ કરું છું મેં કંધું, "ફક્ત તમેજ મારા દેવ છો."
- 15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે. મારા પર દ્યા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યા છે તેમનાથી બચાવો.
- 16 તમારો સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફીથી પાડો. અને મારા પર તમારી દૂપા દર્શાવી મારો બચાવ કરો.
- 17 હે યહોવા, હું નિરાશ થઈશ નહિં; કારણકે મેં તમને પ્રાર્થના કરી છું. દુષ્ટજનોને લિજિત કરી અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
- 18 જૂઢા હોઠ મુંગા થાઓ; તેઓ ડક્ષાસ મારે છે અને સજજનોની વિરુદ્ધ દ્રેષ્ટાવ રાખીને ખરાબ વાતો કહે છે.
- 19 જે ઉદારતા તમારા ભક્તોને ખાતર તમે, રાખી મુક્કી છે, તે તમે તમારે ભરોસે રહેનાર માટે ખૂબ દાખવી

- છે. અને તમારો બય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
- 20 તમે તમારી સમુખ તેઓને સંતાડી રાખશો, અને તેમનું ક્રવતરાબાજો વિરુદ્ધ રક્ષા કરશો. તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
- 21 યહોવાની જરૂર પ્રશસ્તિ થાય, કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે દુશ્મનોએ નગરને ધેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દ્યા દાખવી.
- 22 અધીરતાથી મેં કરી દીધું હતું કે, યહોવાએ મને તરણોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.
- 23 હે યહોવાના સર્વ ભક્તો, તમે તેમનાં પર પ્રેમ રાખો; વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છો, અને અભિમાનીને શિક્ષા કરે છો!
- 24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુઓ છે. ભલે તમારા હદ્યય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!

ગીત 32

દાઉદનું માસ્કીલ.

- 1 જેના દોષને મારી મળી છે, ને જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે અને તે જ સુખી છે.
- 2 જેને યહોવા દોષિત ગણતા નથી ને જેનો આત્મા કૃપટથી રંગાએલો નથી તે માણસ આશીર્વાદિત છે.
- 3 હું બયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઈ ને મારા હાડકાં જીણ થઈ ગયા.
- 4 આખો દિવસ ને આખી રાત, તમારો ભારે હાથ મારા પર હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય તેમ મારી શક્તિ હણ્ણાઈ ગઈ હતી.
- 5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. મેં મારા પાપોને છુપાવવાનું બંધ કર્યું. મેં પોતાને કંધું, "હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ." અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
- 6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય, ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે. અને જો પ્રચ્યદ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહીં.
- 7 જીવનનાં સર્વ સંક્રામાં તમે મારી છુપાવવાની જગ્યા છો, તમે સંકટોમાં ઉગારી લો છો; મારી આસપાસ તમારા સુતીગીતો ગવાય છે.
- 8 યહોવા કહે છે, "જીવનનાં પ્રત્યેક તબક્ક તારે ક્યાં માર્ગ જવું તે હું તને બતાવીશ, હું તારો સતત ખ્યાલ રાખી, તને હંમેશા સાચો બોધ આપીશ.

- 9 ઘોડા તથા ખચ્યરને કે જેને સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે. તું તેમનાં જેવો આણસમજુ થઈશ નહીં."
- 10 દુષ્ટ લોકોને ઘણી તકલીફી સહન કરવી પડે છે. પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાનાં સાચા પ્રેમથી ધેરાયેલાં રહેશે.
- 11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ. હે શુદ્ધ હંદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીત 33

- 1 હે ન્યાયી લોકો, હરખાઓ; યહોવામાં શુદ્ધ હંદયવાળા લોકો માટે યહોવાની સ્તુતિ કરવી સારી છે.
- 2 વીજા વગાડી, યહોવાની સ્તુતિ કરો, દસ તારનું વાળુંત્ર વગાડી ગાઓ; સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
- 3 યહોવાના નૂતન ગીતો ગાઓ; વાળુંત્રોને સંગીત વાધો કુશળતાથી અને મોટેથી વગાડો.
- 4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે, તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
- 5 તે ન્યાય અને નિષ્પક્તતાને ચાહે છે. પૃથ્વી તેમનાં માયાળું પ્રેમથી ભરાઈ ગઈ છે.
- 6 અમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
- 7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાં અને તેના અતિશય ઊડાણોને વખારોમાં ભરી રાખે છે.
- 8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ, ને પૃથ્વીવાસી! ભય રાખો તેનો અને આદર કરો.
- 9 કારણ, તેઓ બોલ્યા અને સૂછિ ઉત્પન્ન થઈ; અને તેમણે આજ્ઞા કરી ને તે સ્થિર થઈ.
- 10 તેઓ તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરથક બનાવે છે.
- 11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે. તેમણે કરેલી ધારણા પેઢી દર પેઢી રહે છે.
- 12 જે પ્રજાના યહોવા દેવ છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે. તેઓને ઘન્ય છે.
- 13 યહોવાનું નિવાસસ્થાન આકાશ છે, ત્યાંથી તે સર્વ માનવજીત પર, નજર રાખે છે.
- 14 હા, તે આકાશમાંથી, સૃષ્ટિમાં વસતા સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
- 15 યહોવા સર્વના હંદયના સર્જનહાર છે, અને તેઓ જે કાંઈ કરે છે તે એ સમજે છે.
- 16 રાજા ફક્ત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફક્ત પોતાની બહાદુરીથી બચી જતો નથી.

17 યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે, તેઓ પોતાના બાહુબળથી કોઈને ઉગારી શકતા નથી.

18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે; ને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.

19 તે તેઓના જીવને મૃત્યુ થી બચાવે છે, અને દુષ્કાળ સમયે તેઓને જીવતા રાખે છે.

20 અમે પૂર્જી શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે, અને તે અમારી ઢાલ છે.

21 અમે યહોવામાં આનંદિત છીએ. અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ. અમને તેમના પવિત્ર નામમાં વિશ્વાસ છે.

22 હે યહોવા, અમે રાહ જોઈ અને તમારી આશા રાખી છે કે તમારી કૃપા અમારા પર થાય.

ગીત 34

દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અભીમલેખ તેને કાઢી મુકે. દાઉદ આ રીતે તેનાથી નાસી છુટ્યો.

- 1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
- 2 મારો આત્મા યહોવાની મોટાઈ કરશે. આથી નમ માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
- 3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ. અને તેના નામનો મહિમા વધારીએ.
- 4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી વસ્તુઓનો ભય હતો તેમાથી બચાવ્યો.
- 5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પકાશિત છે; તેઓના મુખ પર કોઈ નિરાશા કે જ્વાનિ નથી.
- 6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટોમાંથી ઉગાર્યો.
- 7 યહોવાનો દૂત, યહોવાના ભક્તોની આસપાસ પડાવ નાખે છે અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
- 8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને શીખો. જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ નસીબદાર છે.
- 9 યહોવાનાં પવિત્ર અનુયાયીઓ યહોવાનો ભય રાખે છે અને તેમનો આદર કરે છે; કેમકે, તેને કોઈ વસ્તુની કુમી નથી.
- 10 અને કદાચ તંગી પડે સિંહના બચ્યાને ભૂખ વેઠવી પડે છે, પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની તાણ પડતી નથી.

- 11 મારા બાળકો આવો, મને સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
- 12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે? અને તમારા માંથી જીવન વહાલું કોને છે?
- 13 તો હુંમેશા તમારી જીબ પર કાબૂ રાખો; ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
- 14 દરેક દુષ્ટ વસ્તુથી દૂર રહો ને ભલું કરો. શાંતિ શોધી અને તેની પાછળ લાગો.
- 15 યહોવાની આંખો હુંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે. તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો ક્રાન સદા ખુલ્લો હોય છે.
- 16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી ભૂસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
- 17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળો છે, અને તેઓને સર્વ સંકટોમાંથી છોડાવે છે.
- 18 યહોવા હુંમેશા તેઓની સાથે હોય છે જેમના હદ્ય ભાંસી ગયા છે. જેમનો આત્મા કુચાઈ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુક્તિ આપે છે.
- 19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુઃખો આવે છે, પણ કૃપાળું યહોવા તેમને તે સર્વમાંથી ઉંગારે છે.
- 20 યહોવા તેનાં સર્વ હાડકાનું રક્ષણ કરે છે, તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
- 21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે, અને ન્યાયીઓના દ્રેષ્ટીઓ દોષિત દરશે.
- 22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઈ દોષિત દરશે નહીં.

ગીત 35

દાઉદનું ગીત.

- 1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારું સામે તમે યુદ્ધ કરો; મારી ઉપરના તેઓના આકમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
- 2 તમે ઢાલ અને બખ્તર ધારણ કરી ઊભા રહો, ને મારું રક્ષણ કરો.
- 3 ભાલો હાથમાં લઈને મારી પાછળ પડેલાને અટકાવો, મારા આત્માને ખાત્રીથી કહો કે, “તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”
- 4 જેઓ મારા જીવના તરસ્યા છે, તથોની ફિજેત થઈને તેઓ બદનામ થાઓ; જેઓ મારું નુકશાન ઈચ્છે છે, તેઓ રજણી પડો ને પાછ હડો.
- 5 તેઓ પવનથી ઊડતાં ભૂસા જેવાં થાય, અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
- 6 હે યહોવા તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાવ; યહોવાનો દૂત તેમની પાછળ પડો.
- 7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ઝાંદો ગોઠવ્યો છે, વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
- 8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો, પોતાના ઝાંદામાં તેઓ પોતેજ ફસાઈ જાઓ; પોતાના ખોટેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
- 9 પણ હું યહોવાથી આનંદિત થઈશ, અને તેમની મુક્તિમાં સુખી થઈશ.
- 10 મારું સમગ્ર વ્યક્તિત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું છે કોણા? જે લાચારને બળવાનથી બચાવે છે, ને કુગાલને લૂંટનારથી છોડાવે છે.”
- 11 નિર્દ્ય લોકો જૂઠી સાક્ષી આપે છે, અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી; તેના માટે મારા પર આરોપ મુકે છે.
- 12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે, તેઓ મારા આત્માને રડાવે છે અને દુઃખી કરે છે.
- 13 તેઓ જ્યારે બિમાર હતા, ત્યારે મેં ઉપવાસ કરીને કંતાના વસ્તો પહેરિને મારી દિલગીરી બતાવી હતી. તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
- 14 તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો; જેમ કોઈ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે, તેમ હું તેમના માટે દુઃખી હતો.
- 15 તેઓ ટોળામાં ભેગા થયાં. અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં. તે લોકો સાચા મિત્રો ન હતાં. હું તેમને ઓળખતો પણ ન હતો. પરંતુ તેઓ મને ઘેરી વણ્ણા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહીં.
- 16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા, તેઓએ મારા તરફ દાંત કયકચાવીને ગુસ્સો વ્યક્ત કર્યો.
- 17 હે યહોવા, મારા માલિક ક્ષાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણોને બચાવી લો. મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.
- 18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ. ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
- 19 મારા જૂઢા શત્રુઓને મારા પર હસવા દેશો નહીં. આ દુશ્મનો જેઓ વિના કારણ મને વિકારે છે તેઓ મારા તરફ આંખ પણ ન મીચકારે.
- 20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી. ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
- 21 તેઓ મોટેથી કહે છે કે “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે, તેઓ કહે છે” અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
- 22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો, હવે તમે શાંત બેસી રહેશો નહીં; અને મને તરણોડી દૂર થશો નહીં.

- 23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
મારા માલિક ઊભા થાઓ અને મારા ડિસ્સાનો બચાવ
કરો.
- 24 હે યહોવા, મારા દેવ તમારો ન્યાયીપણાથી મારો ન્યાય
કરો. મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહીં.
- 25 તેમને એમ કહેવાની તક આપશો નહીં, કે “તેમનાથી
વિમુખ થવાની અમારી ઈચ્છા પરિપૂર્ણ થઈ છે અને
તેમનો વિનાશ કર્યો છે.”
- 26 કોઈના નાશ નુકશાનમાં આનંદ પામનારાં સર્વેની
ફજેતી થાવ અને તેઓ લજીજત થાવ. મારી વિરુદ્ધ
બદાઈ કરનારા સધળા અપમાનિત થઈ અને શરમાઈ
જાઓ.
- 27 જે લોકો મને નિર્દ્દીષ ઠરાવવા માંગતા હોય તેઓ હર્ષ
મનાવે અને સુખી થાય. તેઓ હંમેશા કહો, “યહોવા
મહાન છે! તે તેમના સેવકો સુખી થાય અને શાંતિ
પામે તેવું ઈચ્છે છે.”
- 28 મારી જીબ આખો દિવસ તમારી નિષ્પક્ષતાની વાતો
કરશે અને તમારી પ્રસંશાની સ્તુતિઓ ગાશે.

ગીત 36

નિર્દ્દશક માટે. યહોવાના સેવક દાઉદનું ગીત.

- 1 દુષ્ટના ગહન હદ્દયમાં પાપ તેને લલયાવે છે. અને
દુષ્ટ કાર્યો કરવા પેરે છે; તેના હદ્દયમાં દેવનો ભય કે
જે તેને પાપ કરતાં અટકાવે.
- 2 તે પોતાના મનમાં, અભિમાન કરે છે કે મારા અન્યાય
પ્રગટ થશે નહીં. અને મારો તિરસ્કાર થશે નહીં.
- 3 તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છિતરપિંડીવાળા
છે. તેણે ડાઢ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.
- 4 તે રાત્રે પલંગમાં જાગતો રહે છે, ને કપટ કરવાની
યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે.
ને તે દુષ્ટતાથી કટાગતો નથી.
- 5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ
છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
- 6 તમારી નિષ્પક્ષતા ઊચામાં ઊચા પર્વતથી *પણ ઊચી
છે. અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
અને તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
- 7 હે યહોવા, તમારી અવિરત કૂપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય
લે છે.
- 8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે, તમારી
સુખ-સમૃદ્ધિની નદીમાંથી તે પાણી પીશે.
- 9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે, અને અમે
તમારા અજવાળામાં પ્રકાશ જોશું.
- 10 હે યહોવા, જેઓ તેમને સાચી રીતે ઓળખે છે, તેમના
પર તમારી દ્વારા બતાવવાનું ચાલુ રખજો, અને જેમના
હદ્દય ચોખ્ખા છે, તેમની સાથે ન્યાયીપણું ચાલુ રખજો.

ઊચામાં ઊચા પર્વત એટલે. “અલનો પર્વત.”

- 11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહીં, દુષ્ટ
લોકોના હાથ હાંકી કાઢે નહીં, તે તમે જોજો.
- 12 “જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે!
તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઊઠી શકશે નહીં.”

ગીત 37

દાઉદનું ગીત.

- 1 દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઈશ નહીં. અને અન્યાય
કરનારની ઈર્ધા કરતો નહીં.
- 2 કારણ તેઓ તો ધાસ અને લીલા છોડવા જેવાં છે, જે
ચીમાળાઈને મરી જશે.
- 3 યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા
દેશમાં રહીશ અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે
આપે તેનો આનંદ માણ.
- 4 યહોવા સાથેના તારા સંબંધોનો આનંદ માણ; ખાત્રી
રાખ કે તારા હદ્દયની ઈચ્છાઓ તેના (યહોવા) દ્વારા
પૂર્ણ થશે.
- 5 તું જે કંઈ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર, તું
એના પર ભરોસો રાખ તે તારા સર્વ કામ ફળીભૂત
કરશે.
- 6 તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
અને તારા પ્રમાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ
તેજસ્વી કરશે. અને તારી નિર્દ્દીષતાની સર્વ માણસોને
જાણ થશે.
- 7 શાંત થા યહોવાની સમક્ષતામાં, અને ધીરજથી જો
તેમની વાટ, જે કુયુકિતાથી ફાવી જાય છે એમના
પર તું ખીજવાતો નહિં.
- 8 ખીજવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે, આટલો
બેચેન ન બન કે તું પણ કર્દીક અનિષ્ટ કામ કરી બેસે.
- 9 કારણ, દુષ્ટકર્માઓનો વિનાશ થશે. અને જેઓ
યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
- 10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જરૂરૂથી નાશ થઈ જશે.
તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને
તેમના નામોનિશાન નહીં મળે.
- 11 નમ લોકોને પ્રાપ્ત થશે વતન (દેવનું વચન), તેઓને
સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે. તેઓને મનની
અદ્ભુત શાંતિ મળશે અને સુખી થશે.
- 12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ ઘડે છે
અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
- 13 યહોવા જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે; તેથી
યહોવા તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
- 14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચયરણ
કરનારનો સંહાર કરવા ખુલ્લી તલવાર લીધી છે ને
ઘનુષ્યથી નિશાન તાશ્યું છે.
- 15 તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ
હદ્દયને વિંધશે; અને તેઓના ઘનુષ્યને બાણ ભાંગી
નાખવામાં આવશે.

- 16 નીતિમાન લોકો પાસે જે અલ્ય છે તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
- 17 કારણ, દુષ્ટ લોકોના હાથાની શક્તિનો નાશ કરવામાં આવશે પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
- 18 યહોવાને યથાર્થીઓના સર્વ પ્રસંગોની ખબર છે, તેની દૃષ્ટિમાં તેઓ નિર્દ્દીષ છે, તેઓને વારસો સદાય ટકી રહેશે.
- 19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં પણ કાળજી રખે છે, દુષ્કાળનાં સમયે પણ તે સર્વ તૃપ્ત થશે.
- 20 પણ દુષ્ટો અને યહોવાના શરૂઆતો, ઘાસની જેમ ચીમળાઈ જશે, ને ધૂમાડા ની જેમ અદ્રશ્ય થઈ જશે.
- 21 દુષ્ટો ઉદ્ધિનું લે છે ખરા પણ પાછું કદી આપતાન નથી, ન્યાયી જે આપવામાં ઉદાર છે, તે કરણાથી વર્ત છે.
- 22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે, પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
- 23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે. યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
- 24 તેઓ ઠીકર ખાશે છતાં પડશે નહીં, કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
- 25 હું યુવાન હતો ને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરણોક્ષા હોય કે તેના સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
- 26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હુમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે. તેઓના સર્વ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
- 27 જો તેમને હુમેશને માટે જીવવાની ઈચ્છા હોય તો ખોટું કરવાથી દૂર રહો અને બીજાનું ભલું કરો.
- 28 કારણ, યહોવા ન્યાય અને પ્રમાણિકતાને ઈચ્છે છે. તે તેમના વિશ્વાસુ ભક્તોને કદી છોડી દેતાં નથી તે તેમનું સદા રક્ષણ કરશે. અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
- 29 ન્યાયીઓ વતનનો વારસો પામશે, અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
- 30 ન્યાયીની વાણી ડાહપણ ભરેલી છે, તેની જીબ સદા ન્યાયની વાત કરે છે.
- 31 તેમનાં પોતાના હદ્દયમાં યહોવાનું નિયત્રણ છે, ને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.
- 32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે. અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
- 33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહીં. ભલે તેઓને ન્યાયાલયોમાં લઈ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહીં.
- 34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો. અને યહોવા તમને વિજયી કરશે અને તમને જે દેશનું વચ્ચે અપાયેલું હતું તે તમને વારસામાં મળશે. અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.
- 35 અનુકૂળ ભૂમિમાં રોપેલાં લીલા વૃક્ષની જેમ, મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
- 36 હું ફરી ત્યાં થઈને ગયો ત્યારે તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો પરંતુ તેનો પત્તો મળ્યો નહીં.
- 37 હવે જે નિર્દીષ છે તેનો વિચાર કરો. જે પ્રમાણિક છે તેનો વિચાર કરો. શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
- 38 દુષ્ટો સમૂહણા વિનાશ પામશે, અંતે તેઓના વંશજોનો અંત આવશે.
- 39 યહોવા ન્યાયીઓનો ઉદ્ઘાર કરે છે. સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
- 40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તેઓ દુષ્ટોથી છોડાવીને તારે છે; તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.

ગીત 38

સંભારણું- દાઉદનું ગીત.

- 1 હે યહોવા, તમે કોશમાં આવી મને ઠપકો આપશો નહીં, અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહીં.
- 2 તમારા બાણોએ મને વીધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
- 3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી. મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હડકાઓ ઈજા પામ્યા છે.
- 4 મારાં માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસર્ય થઈ પડ્યો છે.
- 5 મારી મૂર્ખાઈને કારણે ઘા પડી ગયા છે. અને ઘા પણ કોહવાઈને ગંધાઈ ઊઠા છે.
- 6 હું લથડી ગયો છું ને વાંકો વળી ગયો છું, અને આખો દિવસ હું શોક કરું છું.
- 7 મારી કમરમાં અસર્ય બળતરા થાય છે, અને મારું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.
- 8 હું નિર્બણ થઈને કચડાઈ ગયો છું, હદ્દયની વેદનાને કારણે નિઃસાસા નાખું છું.
- 9 હે યહોવા, તમને મારી સર્વ ઈચ્છાની ખબર છે, મારા એ નિઃસાસાથી તમે અજાણ્યા નથી.
- 10 મારા હદ્દયના ઘબકારા વધી ગયા છે આંખોનું તેજ ઘટી ગયું છે. ને શક્તિ ઘટી ગઈ છે.
- 11 મારા રોગનાં ભયથી, મારા સનેહીજનો ને મિત્રો દૂર થઈ ગયા છે, અને મારા સત્તાસબંધી સૌ કોઈ, મારાથી જૂદા જઈ રહે છે.

- 12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઈવે છે, મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
- 13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે. પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી, પોતાનું મોહું ઉધાડી ન શકું એવો હું મૂંગો માણસ છું.
- 14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે, હું એવા માણસ જેવો છું.
- 15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખ્યું છું કે તમે મને ઉત્તર આપશો.
- 16 મેં કલ્યાણ, "મારો પગ લાપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઈ કરનારા મારી દુઃખ પરિસ્થિત ઓઈને કદાચ આનંદ પામે.
- 17 હું હવે કોઈપણ સમયે ઠળી પડીશ, મારું દુઃખ હંમેશા મારી સાથે છે.
- 18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છું; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
- 19 વિના કારણો જેઓ મારા શત્રુ થયા છે, તેઓ અતિ પ્રભળ છે; વિના કારણ જેઓ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
- 20 ભલાઈ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.
- 21 હે યહોવા, તમે મને તરછોડશો નહીં, હે મારા દેવ, મરાથી દૂર ન થશો.
- 22 હે યહોવા, મારા તારણના દેવ, તમે જલદી આવો અને મને મદદ કરો!

ગીત 39

નિર્દેશક માટે. યદ્વારાનું માટે. દાઉદનું ગીત.

- 1 મેં કલ્યાણ, "મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ; મારી જીબે હું પાપ કરીશ નહીં. જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે હું મારા મોઢા પર લગામ રાખીશ."
- 2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહીં, ધાનોમાનો મૂંગો ઊભો રથ્યો; ત્યારે મારી આંતરિક વથા વધી અને મારો શોક વધી ગયો.
- 3 મારા હદ્યમાં આગ ભભૂકતી હતી, અણિ સણગી ઊભ્યો મારા વિચારનો; અને અંતે હું મારી જીબે બોલ્યો.
- 4 હે યહોવા, મને જણાવો; કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલું છે? મારું જીવન કેવું કણાબંગુર છે, તે મને સમજાવો.
- 5 તમે મને જીવવા માટે ખૂબ ટૂકો સમય આપ્યો છે! મારું ટૂકુ જીવન તમારી તુલનામાં કઈ નથી. પ્રત્યેક વ્યક્તિનું જીવન ઝડપથી અદ્રશ્ય થઈ જતાં વાદળ જેવું છે.
- 6 મનુષ્યનું અસ્તિત્વ તો ફક્ત આરસીમાનું પ્રતિબિંબ છે, તે જે કરે છે તે મૂલ્યહીન છે. તે સંપત્તિનો સંચય

- કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોણે મળશે?
- 7 હે યહોવા, મારે શું આશા હોય? તમેજ મારી આશા છો!
- 8 હે યહોવા મને મારા પાપોમાંથી ઉગારો, દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
- 9 હે યહોવા, હું મૂંગો રથ્યો છું હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહીં; કારણ, તમે જે કર્યું છે એ હું જાણું છું.
- 10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રભળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઈ ગયો છું.
- 11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શિખવવા માટે તમે જે લોકો ખોટા કાર્યો કરે છે તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઈચ્છે છે અને જેની ઈચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો. જેમ ઉધઈ કપડાનો નાશ કરે છે. હા, અમારો જીવન એક નાના વાદળ જેવાં છે. જે જલ્દી અદ્રશ્ય થઈ જાય છે.
- 12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો. મારા આંસુઓની અવગણના ન કરશો, આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું, મારા પિતૃઓની જેમ હું અહી એક કામચલાઉ વતની છું.
- 13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથી જાઓ તે પહેલાં તમારી વેઘક દૃષ્ટી મારા પરથી દૂર કરો; જેથી ખરેખર બણ પામું ને ફરીથી આનંદ પામું.

ગીત 40

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

- 1 મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઈ, તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
- 2 યહોવાએ મને ઉચ્ચકીને કબરની બહાર કાઢ્યો, તેમણે મને તે કાદવમાંથી બહાર કાઢ્યો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઈવ્યાં અને મારા પગલા સ્થિર કર્યા.
- 3 તેમણે આપણા દેવનું સ્તોત્ર મારા મૂખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત, જોશે અને બીશે; ને યહોવા પર ભરોસો રાખશો.
- 4 જે યહોવાનો વિશ્વાસ કરે છે તે નસીબદાર છે. તે દૃષ્ટો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
- 5 હે યહોવા, મારા દેવ, તમે અમારા માટે મહાન ચ્યાતરાએ કર્યા છે. તમારી પાસે અમારા માટે અદ્ભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઈ નથી! હું તે અસંખ્ય અદ્ભૂત કૃત્યોના વિષે વારેવાર કહીશ.
- 6 તમારે ખરેખર અર્પણોની અને ખદ્યાર્પણની જરૂર નથી. તમને અર્પણ થનાર દહનાર્પણો અથવા પાપાર્થાપણો તમે માંયા નથી. તમે મારા કાન ઉધાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકું.

- 7 મેં કથું, “હું મારા વિષે પ્રબોધકોએ ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણો આવ્યો છું.
- 8 હે મારા દેવ, હું તમારી ઈચ્છાનુસાર કાર્ય કરવાને માટે રજુ છું. તમારો કાયદો મારા હદ્યમાં છે.
- 9 એક મહા સભામાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી, હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોહું બંધ નથી રાખ્યું.
- 10 મેં કયારેય તમારી નિષ્પક્તનાને મારા હદ્યમાં છુપાવી નથી. મેં મહાસભામાં તમારી વિશ્વસનીયતા અને તારણ વિષે જાહેરાત કરી હતી.
- 11 હે યહોવા, તમારી અખૂટ દયા માગથી પાછી ન રાખશો. તમારો સાચો પ્રેમ હમેશા મારી રક્ષા કરે છે.”
- 12 કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઈ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.
- 13 હે યહોવા, કૃપા કરો ને મારી રક્ષા; કરો. હે યહોવા, હવે મને સહાય કરવા ઉત્તાવળ કરો.
- 14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓ ફજિત થાઓ, અને પરાજ્ય પામો જેઓ મારું નુકશાન કરવા માગે છે તેઓ શરમથી નાસી જાય તેવું કરો.
- 15 જેઓ, મારી મજાક કરે છે; તેઓ પરાજ્યથી પાયમાલ થાઓ.
- 16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો. ઉદ્ગાર ચાહનારા નિરંતર કહો, “યહોવા કેટલાં મહાન છે!”
- 17 હું દીન દરિદ્રી છું, મારી ચીંતા કરો; હે મારા દેવ! તમે મારા સહાયક મુક્તિદાતા છો; માટે હવે વિલંબ ન કરશો.

ગીત 41

નિર્દ્દશક માટે. દાઉદનું ગીત.

- 1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે; સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
- 2 તેનું યહોવા રક્ષણ કરે છે, ને તેને જીવંત રાખે છે; તે તેનાં શત્રુઓના બળને નશ કરે છે, અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે છે.
- 3 યહોવા તેને બીમારીના બિધાના પર ટકાવી રાખશે, અને મંદવાડમાં તેનાં દુઃખ અને ચિંતા લઈ લેશે.
- 4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા; મારા પર દયા ચાખશો અને મને મારી માંદગીમાંથી સાજો કરજો, કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
- 5 મારા શત્રુઓ આ બધી ખરાબ વસ્તુઓ મારી વિરુદ્ધ

- 6 કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઈ જશે.”
- 7 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે, ને હદ્યમાં અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે, અને નિર્બણતાની હાંસી ઊઠાવે છે.
- 8 મારો દેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે, અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
- 9 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે કે તે પથારીમાં પદ્યો છે ને પાછો ઊઠવાનો નથી.”
- 10 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતું ને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઈ ગયો છે.
- 11 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો; મને પથારીમાંથી ઊઠાડો, જેથી હું તેમનો ઈલાજ કરું.
- 12 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે; તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
- 13 હું નિર્દ્યાપ હતો અને તમે મને ટેકો આપ્યો હતો. તમારી સમક્ષ હમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
- 14 ઈશ્વાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે. આમીન તથા આમીન.

ભાગ બીજો

ગીત 42

નિર્દ્દશક માટે. ઓરાહનાં કુદુરુનું માસ્કીલ.

- 1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા હું તમારા માટે તલપું છું.
- 2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે. હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશા?
- 3 રાત દિવસ આંસુ મારું ભોજન થયું છે. શત્રુ મહેણા મારે છે “તારા દેવ ક્યા છે?”
- 4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય? ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદ્દાયમાંથી પસાર થયો, જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો. એનું સ્મરણ કરતાં, મારું હદ્ય ભાંગી જાય છે.
- 5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે? તું આટલો અસ્વસ્થ અને વ્યાદુણ શીદ થયો છે? દેવની મદદ માટે રાહ જો! તેમની કૃપા અને મદદ માટે હું હજુ પણ તેમની પ્રાર્થના કરીશ.
- 6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે. તેથી હું તમારી કૃપાનું મિજાર પર્વત પરથી જ્યાં હેર્માન પર્વત અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.

- 7 ઘરતીના ઊડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંબળાય છે. તમારા બધા મોજાઓ અને મોટા મોજાઓ મારા પર ફરી વણ્ણા છે.
- 8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે. અને રોજ રાત્રે હું તેમના સુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
- 9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે, "તમે કેમ ભુલી ગયા? મને કેમ ત્યજી દીધો છે? શા માટે શત્રુઓના જુલ્મ મારે સહન કરવા પડે?"
- 10 તારો દેવ ક્ષાં છે અને મશકરીમાં રોજ પૂછીને, મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
- 11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુઃખી છે? તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે? દેવની મદદ માટે રાહ જો! તેમની કૃપા અને મદદ માટે હું હજુ પણ તેમને પ્રાર્થના કરીશ.

ગીત 43

- 1 હે દેવ, મને ન્યાય કરો, અને મને નિર્દ્યાષ પુરવાર કરો. અને જે તમારો સનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છિંતરપીડી કરનારા માણસથી મને બચાવો.
- 2 કારણ, હે દેવ, તમે મારું સામર્થ્ય છો. તમે શા માટે ત્યજી દીધો? દુશ્મનોની કૂરતાને લીધે હું શોક કરતો કરું છું.
- 3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો; જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
- 4 તમે મારા અતિઆનંદ છો, તમારી વેદી પાસે હું જઈશ, અને હે દેવ, મારી વીજા સાથે હું તમારી આભારસ્તુતિ ગાઈશ.
- 5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો દુઃખી અને ઉદાસ છે? અને તું શા માટે બેચેન છે? દેવની મદદની રાહ જો, હજુયે હું તેની કૃપા અને મદદ માટે પ્રાર્થના કરીશ.

ગીત 44

નિર્દ્દીશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

- 1 હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાને સાંભળ્યું છે.
- 2 વિદેશીઓની પ્રજાને તારાજ કરી, તમે તમારા હાથે હાંકી કાઢી, ઈસ્થાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા.
- 3 જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તલવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શક્તિથી પોતાનું રક્ષણ કરી

શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યા હતા. તમે તેઓને તમારી બહાદુરીથી વિજયી બનાવ્યા હતા, કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.

- 4 હે દેવ, તમે મારા રાજા છો. આજા આપો અને યાકુબના લોકોને વિજય સુધી દોરી જાવ.
- 5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું; અને તમારા નામે અમે અમારા વરીઓને કચરી નાખશું.
- 6 હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, 'તલવાર' પણ મારો બચાવ કરી શકશે નહીં.
- 7 તમે અમારા શત્રુના લશકરથી અમારી રક્ષા કરી છે, જેઓ અમારો દ્રેષ કરે છે તેઓને તમે લજીજત કરો છો
- 8 આખો દિવસ પર્વત અમો દેવની સુતિ કરીશું! અમે સદ્ગાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રખીશું!
- 9 પણ હે યહોવા તમે અમને ત્યજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યા ન હતાં.
- 10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે, અને તેઓએ અમને તેમની ઈચ્છા મુજબ લૂંટ્યા છે.
- 11 તમે અમને ત્યજી દીધાં છે, અમારી હાલત બલી માટેના ઘેટાઓ જેવી થઈ છે, અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
- 12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે, શું તમારી નજરમાં અમારી કોઈ કિંમત નથી?
- 13 અમારા પાડોશીઓ આગળ તમે, અમને નિંદા રૂપ બનાવ્યા છે; અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
- 14 રાષ્ટ્રો વચ્ચે તમે અમને તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે. તેઓ અમારી સામે જોવે છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
- 15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
- 16 કારણ, મારી નિંદા થાય છે ને મારા વિષે ખરાબ બોલાય છે. જુઓ, મારા શત્રુ ને વેર વાળનારા આવું કરે છે.
- 17 ભલે, આ બધું અમારા પર આવી પણ્યું, તોય અમે તમને ભૂલી નથી ગયા; ને તમારા કરાર પ્રતિ વિશ્વાસધાતી નથી થયા.
- 18 અમારું હદ્ય તમારાથી પાછું હડી ગયું નથી, ને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
- 19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કયાણાં છે; ને અમને તમે મોતની ગાઢ છાયાથી હાંકી દીધાં છે
- 20 જો અમે અમારા દેવની આરાધના ભૂલી ગયા હોત, અને પારક દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
- 21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા, યહોવા સર્વના હદ્યનું રહસ્ય જાણો છે.

- 22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ વધેરાતા જઈએ છીએ! માર્યા જઈએ છીએ. તમારે કારણે અમને બલી માટે દોરી જવાતો ઘેટો જવા ગજવામાં આવે છે.
- 23 હે યહોવા, જાગૃત થાઓ સતેજ થાઓ! સતેજ થાઓ! હવે ઉધસો નહીં; અને અમને સદાને માટે, દૂર કરશો નહીં.
- 24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને સત્તામણીની અવગણના શા માટે કરો છો?
- 25 અમો ધૂળમાં નીચે મહો રાખીને પડયાં છીએ અને અમારા પેટ જમીનમાં દબાઈ રહ્યાં છે.
- 26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો અને તમારી અનુંકપાને કારણે અમને બચાવી લો.

ગીત 45

નિર્દેશક માટે. રાગ: "શોશાન્નિમ." કોરાહના કુટુંબનું
માસ્કીલ. પ્રેમનું ગીત.

- 1 મારું મન સુંદર શબ્દોથી ભરાઈ ગયું છે. મેં રાજા માટે કવિતા રચી છે. હું તેનું પઠન કરું છું. મારું મન શ્રેષ્ઠ લેખકની જેમ ધગા શબ્દોથી ભરાઈ ગયું છે.
- 2 તમે કોઈ પણ માણસ કરતાં વધારે દેખાવડા છો. તમારાં શબ્દો બલમનસાઈથી ભરેલાં છે. તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
- 3 હે પરાકર્મી, તમે તમારી તલવાર કમરે બાંધો; અને ગૌરવથી પતાપ પરિધાન કરો.
- 4 તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, અને ભવાઈ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ. પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શક્તિશાળી જમણી બાહુ કેળવાયલી છે.
- 5 તમારા તીક્ષ્ણ બાણો તારા શત્રુઓના હદયો વીધે છે, તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
- 6 હે દેવ, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ એ તમારું ન્યાયી શાસન છે.
- 7 તમને ન્યાયપ્રિયતા પર પ્રીતિ છે, ને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે; તને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલે અભિષિક્ત કર્યો છે.
- 8 હાથીદાનના મહેલોમાં તારાં વસ્તો બોળ, અગરને તજની સુંગંધથી કેવા મહેકે છે, ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
- 9 તમારી માનીતી સ્ત્રીઓમાં ધર્ણી રાજકુમારીનાઓ છે. શુદ્ધ સૌનામાંથી બનાવેલો મુગાટ પહેરેલી રાણી તમારી જમણો ઊભી છે.
- 10 હે રાજકુન્યા, હું કહું તે તું કાને ધર; ને પછી વિચાર કર; તારા લોકોને ભૂલીજા અને તારા બાપનું ધર ભૂલીજા.

- 11 તારા સૌદર્યમાં મોહિત થઈને રાજા અતિ આનંદ પામે છે, એ તો તારા સ્વામી છે, માટે તેની સેવાભક્તિ કર.
- 12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો લઈને તમને મળવા આવશે.
- 13 અતિ સુંદર રાજકુન્યા, જનાનખાનામાં રાહ જુએ છે; તેના સુંદર જરીનાં વસ્તોમાં, સોનાના તાર વણેલા છે.
- 14 તેણીએ સુંદર, શાખાગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે. તેણીને રાજા પાસે લઈ જવામાં આવે છે. તમારા માટે લાવવામાં આવેલી કુમારિકાઓ તેને અનુસરે છે.
- 15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે ત્યારે તેઓ આનંદ ને ઉત્સાહથી ભરેલાં હશે.
- 16 તારા વંશજો તારા પછી શાસન કરશે. તું તેમને સમગ્ર પ્રદેશના હાડેમ બનાવીશ.
- 17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ; પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

ગીત 46

નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અવામોથ સાથે ગાવાનું.

- 1 દેવ આપણો આશ્રય, ને આપણું સામર્થ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજુર છે.
- 2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય, અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌંદર્ય ડરવાની જરૂર નથી.
- 3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે, ને પર્વતો ધૂજુ ઉડ.
- 4 ત્યાં એક નદી છે અને જરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
- 5 દેવ સ્વયં તે નગરમાં વસે છે. દેવ પરોછિયે તેની સહાય કરશે, તેથી નગરનું પતન ક્યારેય નહીં થાય.
- 6 ભયથી ધૂજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો; જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઈ પીગળી.
- 7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે; આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
- 8 આવો અને યહોવાના પ્રરાકમો જુઓ. તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
- 9 તેઓ પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે, ધનુષ્યને ભાગી નાખે છે, ને ભાલાને કાપી નાખે છે; અને રથોને એ અણિથી સરળગાવી દે છે.
- 10 દેવ કહે છે, "લડાઈ બંધ કરો, નિશ્ચૈ જાણો, કે હું દેવ છું, સર્વ રાષ્ટ્રો મારો આદર કરશે. અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ."
- 11 સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.

ગીત 47

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

- 1 આવો તમે, હે સર્વ લોકો, અભિવાદન કરો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
- 2 કારણ, પરાતપર યહોવા, સમગ્ર પૃથ્વીના, રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
- 3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકું છે.
- 4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
- 5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
- 6 દેવનાં સ્તોત્રો ગાઓ આપણા રાજાના સ્તોત્રો ગાઓ; પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
- 7 દેવ સમગ્ર પૃથ્વીના સમાટ છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
- 8 તે પોતાનાં પવિત્ર રાજ્યાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
- 9 ઈબાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના નેતાઓ બેગા થયા છે. બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે, દેવ સર્વોચ્ચ છે.

ગીત 48

ગાયન; કોરાહનાં કુટુંબનું ગીત.

- 1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધર્મી સ્તુતિ થાય છે.
- 2 કેવું સિયોન પર્વતની ઊચાઈએ આવેલું અતિ સુંદર નગર; આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર, સર્વ લોકો જોઈ શકે તેવું, રમ્ય, આનંદરૂપ દ્રશ્ય, કેવું અદ્ભૂત છે!
- 3 તે નગરના મહેલોમાં દેવ આશ્રયની જગ્યા તરીકે ઓળખાય છે.
- 4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા, અને એકત્ર થઈ સૌંનગર પર કૂચ કરીને ગયા.
- 5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા, ભયથી ગભરાઈ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
- 6 તેમને ભયથી ધુજારી થઈ ગઈ અને પ્રસૂતીની પીડા જેવું કષ્ટ થયું.
- 7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધુજાલ્યા જેમ તમે પૂર્વનાં શક્તિશાળી વાયુ વડે તોતીંગ વહાણોને ભાંગી નાંખો છો.
- 8 આપણે દેવની શક્તિ વિષે સાંભળ્યું છે. આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકણ માટે, દેવે સ્થાપન કર્યું છે.

- 9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અયળ કૂપા વિષે અમે મનન કર્યું છે.
- 10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાગ્રીતું છે, પૃથ્વીની સીમા પર્વત તમારી સ્તુતિ થાય છે; તમારો જમણો હાથ ન્યાયથી ભરેલો છે.
- 11 તમારા શુભ નિર્જયને કારણે સિયોન પર્વત આનંદ પામશે અને યહુદ્દિયાનાં નગરો હરખાશે.
- 12 સિયોનની આસપાસ આંટા મારો અને નગર તરફ જુઓ; અને તેના બુરજોની ગણતરી કરો.
- 13 તેનો કોટ ધ્યાનથી જુઓ, ને તેના મહેલોની મુલાકાત લ્યો; જેથી તમે તે વિષે તમારા સંતાનોને કહી શકો.
- 14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે જે આપણને સદાય દોરી જશે.

ગીત 49

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

- 1 હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
- 2 નિમ્ન કક્ષના હો કે ઉચ્ચકક્ષનાં, શ્રીમંત હો કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
- 3 હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ; મારા હદ્યમાંથી નિકળતા ઉદ્ગારો શાન વિષે હશે.
- 4 હું દ્રષ્ટાત પર કાન લગાડીશ, અને વીજા પર મારો મર્મ ખોલીશ.
- 5 જ્યારે સંકટો આવે છે ત્યારે, ચારેબાજુથી મને શત્રુઓ ઘરી લે એવા દુષ્ટોના સર્કારીમાં મારે ડરવાની જરૂર નથી.
- 6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે, તેઓ કેટલાં ધનવાન છે, તેનું અભિમાન કરે છે.
- 7 તેઓ કોઈ પોતાના ભાઈને કોઈ રીતે છોડાવી શકતાં નથી; દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
- 8 માનવ-જીવનની એટલી મોટી કિંમત છે કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકતો નથી.
- 9 જેથી તે સદાકણનું જીવન પામે, અને નરકનાં ખાડાની શિક્ષાથી બચ્યે જાય.
- 10 બધા લોકો સાક્ષી છે કે વિજ્ઞાન મૃત્યુ પામે છે, અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે. અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
- 11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે, જાણેક સદાકણને માટે તે તેઓની જ રહેવાની હોય; અને જાણે તેઓ સદાકણ અધિકાર ભોગવવાના હોય.
- 12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં ક્રાયમ માટે રહેવાના નથી. જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
- 13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો, અંત તો તેમનો અંત એવોજ આવશે.

- 14 પેલા લોકો બરાબર ઘેટા જેવાજ છે. કબર તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ભરવાડ બનશે. જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો તેમના વૈભવી ધરોથી ખૂબ દૂર કબરોમાં ધીમેથી સડી જશે તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.
- 15 દેવ મને મોતની પકડમાંથી છોડવશે કારણ કે તેઓ મને તેમની સાથે રહેવા લઈ જશે.
- 16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે એટલા માટે તે લોકોથી ડરશો નહીં.
- 17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઈ જઈ શકશે નહીં અને તેમનો વૈભવ તેમની પાછળ તેમની કબરોમાં જવાનો નથી.
- 18 ધનવાન વ્યક્તિ તેના જીવનકાળ દરમ્યાન, પોતાની જાતને મહાન ગણતી હશે, અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા, તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
- 19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે અને પછી તે જીવનનું અજવાણું ક્ષારેય પણ નહીં જુએ.
- 20 જે વ્યક્તિ પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી; તે વ્યક્તિ બુદ્ધિહીન નાશ પામનાર પણ સમાન છે.

ગીત 50

આસાફનું ગીત.

- 1 યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પચ્છિમ સુધી બોલાવે છે.
- 2 સિયોનમાંથી દેવ સર્વોચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
- 3 આપગા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહીં, ભર્મ કરનાર અભિન આગળ આવે છે, તેમની આસપાસ મહાતોકાન જગથે.
- 4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યા છે. જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષીઓ તરીકે બોલાવશે.
- 5 જોઓએ મારી સાથે કરાર કર્યા છે, બલીદાન અર્પણ કરી અને પોતાનું સર્વ મને અર્પણ કર્યું છે; એવાં ભક્તોને મારી પાસે ભેગા કરો.
- 6 દેવ પોતેજ ન્યાયાધીશ છે તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
- 7 હે મારા લોકો હું કહું તે સાંભળો, "હે ઈસાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું."
- 8 મારી વેદી પર તમે જે યજો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે. તે માટે, હું તને ઠપકો દઈશ નહીં.
- 9 હું તમારા દોરવાડામાંથી બળદો નહીં લઉં કે તમારા નેસડામાંથી બકરાં નહીં લઉં.

- 10 કારણકે અરાધનાં પ્રત્યેક પણ અને હુંગરો પરનાં હજારો પ્રાણી મારાં છે.
- 11 હું પર્વત પરના સર્વ પક્ષીઓને આંગણું છું, અને જગતનાં સર્વ હિસ્ક પ્રાણીઓ પણ મારા જ છે.
- 12 જો હું ભૂખ્યો હોઈશ, તો ય તમને કહીશ નહીં, કારણ સમગ્ર સૂષ્પિનું સર્વ મારું જ છે.
- 13 શું હું બળદોનું માંસ ખાઉં? અથવા બકરાઓનું રક્તપાન કરું?"
- 14 તથી તમારા દેવ માટેના આભાર અર્પણો લઈ આવો અને તમે આપેલા વચ્ચનો પરિપૂર્જ કરો.

- 15 "મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો."
- 16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છે, "શા માટે તમે મારા કારણાઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઈએ?
- 17 મારા નિયમોનો તે તિરસ્કાર કર્યા છે અને મારી શિસ્તની તો અવગાણના કરી છે.
- 18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો. અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
- 19 તારું મુખ શાય આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે. અને તારી જીબનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
- 20 તું તારા પોતાનાં ભાઈની નિંદા કરે છે, ને તારી માતાના પુત્રની બદનામી કરે છે.
- 21 તમે આ ખરબ વસ્તુઓ કરી છીતાં મેં કાઈ કંધું નહીં. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
- 22 તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરું તે પહેલા તમારે આ સમજવાનું છે કે તમને બચાવવાવાળું કાંઈ નહીં હોય.
- 23 જે વ્યક્તિ આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માર્ગ ચાલે છે તે વ્યક્તિનું રક્ષા કરવાં હું મારી શક્તિ બતાવીશ."

ગીત 51

- નિર્દ્દશક માટે દાઉદનું ગીત. જ્યારે નાથન પ્રબોધક દાઉદને મણ્યો, બાયથેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
- 1 હે પ્રેમાળ દયાળ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂસી નાખો.
 - 2 હે યહોવા, મારા અપરાધ ને પાપોથી મને ધુઓ અને પરિશુદ્ધ કરો.
 - 3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.

- 4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
- 5 હું પાપમાં જન્મ્યો હતો, મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
- 6 તમે માંગો છો અંતઃકરણની સત્યતા અને પ્રમાણિકતા, મારામાના ઊડાણમાં સાચું જ્ઞાન મૂકો!
- 7 મારા પાપો જુણાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઈશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધૂઓ.
- 8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકો, જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
- 9 મારા પાપો તરફ જોશો નહીં, બૂસી નાખો મારા સર્વ પાપ.
- 10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હદ્ય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો !
- 11 મને તમારી સન્મુખતામાંથી સદાકાળ માટે દૂર કરશો નહીં, અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
- 12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો. મારા આત્માને મજબૂત, તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
- 13 ત્યારે ઉત્તલંઘન કરનારાઓને હું તમારા માર્ગો શીખવીશ, અને એ પાપીઓ તમારા તરફ ફરશે.
- 14 હે મારુ દેવ, મારા તારણહાર; મને મૃત્યુદુંધરી બચાવો; હું આનંદથી તમારી સ્તુતિ ગાઈશ, અને હું તમારી નિર્ણક્ષતા વિષે બોલીશ.
- 15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો; મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
- 16 તમે યજોથી રીઝતા નથી, નહીં તો હું તે અર્પણ કરત; તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
- 17 દેવને જે અર્પણ જોઈએ છે તે છે ભંગિત, ખેદિત, પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ અને આજ્ઞાકિત હદ્યના વ્યક્તિનો અસ્વીકાર તમે કરશો નહીં.
- 18 દેવ, તમે સિયોનનું ભલું કરો, અને યરુશાલેમની આજુબાજુ તમે ફરી દીવાલ બાંધો.
- 19 અને પછી તમારી વેદી પર, સાંઘનાં અર્પણ થશે, અને તમને યોગ્ય યજોથી તથા અખંડ દહનાર્પણથી પ્રસન્ન કરશે.

ગીત 52

નિર્દેશક માટે દાઉદનું માસ્કીલ, જ્યારે દોઅંગ અદીમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલબને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.

- 1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છો? તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છો?

- 2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છો. તારી જીબ અણીદાર અસા જેવી છે. તારી જીબ દુષ્ટતા કરવા જૂહુ બોલ્યા કરે છો.
- 3 તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે, તું સત્ય કરતાં વધારે અસત્ય આયરે છે.
- 4 તું અને તારી જુઠી જીબ લોકોને ઈજા કરવા માંગે છે.
- 5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઈહલોકમાંથી તને ઉખેડી નાંખશે.
- 6 નિર્ણક્ષો આ જોશે અને ભય રાખશે, તેઓ ડર રાખશે અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે.
- 7 “જે પુરુષે દેવનો આશ્રય ન કર્યો, અને દુષ્ટર્માને વળળી રહ્યો તે પોતાના આ ઘન પર ભરોસો રાખીને રહ્યો.”
- 8 પણ હું તો દેવનાં મંદિરમાં આબાઈ પામતાં જેતવૃક્ષ જેવો છું. હું હમેશા દેવની કૃપા પર ભરોસો રાખીશ.
- 9 હે યહોવા, તમે જે કાઈ કર્યું છો, તે માટે હું સદાકાળ સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છો, એવું હું પ્રગટ કરીશ.

ગીત 53

નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.

- 1 માત્ર મૂર્ખ, દુષ્ટ માણસ પોતાના મનમાં કહે છે, “દેવ છે જ નહીં” તેનું હદ્ય દુષ્ટતાથી ભરેલું છે. તેવા માણસો ઘડાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે. તેઓમાં કોઈ સારા કૃત્યો કરનાર નથી.
- 2 દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૂષિત કરીને તપાસ કરે છે કે એવી કોઈ વ્યક્તિ છે જેને સાચી સમજ હોય; ને મનથી દેવની શોધ કરતી હોય.
- 3 તેઓમાંનાં દરેક માર્ગ-ભષ્ટ થયા છે, અને તેઓ સંઘળા અશુદ્ધ થયા છે; કોઈ વ્યક્તિ ન્યાયી જીવન જીવતી નથી. ભલું કરનાર હવે કોઈ રહ્યું નથી.
- 4 દેવ કહે છે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા? મારા લોકોને તે જ્ઞાનો રોટલી ખાતાં હોય તેમ ખાઈ જાય છે. તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”
- 5 તેઓ અચાનક ભયભીત થઈ જશે, જોકે કશું ડરવા જેવું નહીં હોય. દેવ તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે. તેથી દેવના લોકો તેમને હરાવશે, અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાને વિખેરી નાખશે.
- 6 સિયોનમાંથી દેવ જલદી આવે અને ઈસ્થાએલને બચાવે! યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે અને તેમને પાછા તેમના વતનમાં લાવશે, અને પછી યાકૂબ ખુશ થશે, તથા ઈસ્થાએલ આનંદિત થશે.

ગીત 54

નિર્દેશક માટે. વાળુંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીજીઓએ આવીને શાહિલનું કંધુ કે "દાઉદ અમારી વચ્ચે સંતાઈ રહ્યો છે." ત્યારનું ગીત.

- 1 હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાકમથી મારો ન્યાય કરો.
- 2 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મોઢાંની વાતો કાને ઘરો.
- 3 વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ કૂર છે, મારો જીવ લેવા ઈચ્છે છે. દેવ છે' એ હકીકતની તેમને દરકાર નથી.
- 4 યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.
- 5 યહોવા મારા શત્રુઓને દુષ્પ્રતાનો બદલો આપશે, હે દેવ, તમારા સત્ય વચ્ચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
- 6 હું તમારી પાસે, રાજુખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
- 7 દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.

ગીત 55

નિર્દેશક માટે. સંગીતનાં વાળુંત્રો સાથે. ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

- 1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દ્યા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહીં.
- 2 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું; અને હું વિલાપ કરું છું.
- 3 દુશ્મનો મારી સામે ભૂમો પાડી રહ્યા છે. તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને વિકારથી મારા પર હુમલો કર્યો. તેઓ મારા ઉપર તકલીફી લાવ્યા.
- 4 મારા હદ્યમાં ધડી વેદના થાય છે, અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
- 5 મારું શરીર ભયથી ધૂજે છે, હું ભયથી ધેરાઈ ગયો છું.
- 6 મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! કે હું દૂર ઊડી શકત અને વિશ્વામ કરત.
- 7 હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુક્ષમ કરત.
- 8 વિનાશકારી પવનનાં તોઝાનથી હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
- 9 હે યહોવા, આ દુષ્પત્રનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો, મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
- 10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે, શહેરમાં કૂરતા અને દુષ્તા પ્રવતી રહી છે.
- 11 નગરમાં કેવાં વિનાશકારી પરિષ્પણો સર્કિય છે! જ્યાં જુઓ ત્યાં રસ્તામાં ધંતરપિંડી ને જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા; એ તો મારાથી સહન કરી શકત; મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો, નહીં તો હું સંતાઈને નાસી છૂટ્યો હોત.

13 પણ તે તો તારા મારા જેવો માણસ, મારો મિત્ર ને મારો સાથીદાર છે.

14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં. અને જનસમૃદ્ધ સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો, ને જીવતા શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે, તેઓનાં અંતરનાં ઊડાણોમાં દુષ્ટતા છે.

16 હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા, મારું તારણ કરશે.

17 પણ હું, મારા દુઃખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ; અને તે મારી પ્રાર્થના સાંભળશે.

18 હું ધણા યુદ્ધોમાં લડો છું; પરંતુ દેવે હમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.

19 દેવ અનાદિકાળથી રાજ્યાસન પર બિરાજમાન છે, તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે, તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ પણ બદલતાં નથી.

20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે, તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભગ કર્યો છે.

21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા, પણ તેનું હદ્ય યુદ્ધનાં વિચારેથી ભરેલું છે. શબ્દો તેલ કરતાય વધુ નરમ છે, પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

22 તમારી ચિંતાઓ યહોવાને સોંપીદો, અને તે તમને નિભાવી લેશે, તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.

23 હે દેવ તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો.

24 ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષા માટે તો હું તમારો ભરોસો રાખીશ.

ગીત 56

નિર્દેશક માટે. રાગ: "દૂરના ઓકમાં કબૂતર." દાઉદનું મિખ્તામ, ગાથામાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.

1 હે દેવ દ્યા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યા છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.

2 મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યા છે. ધણા લડવેયાઓ મારી સામે ઊભા થયા છે.

3 જ્યારે મને બીક લાગશે ત્યારે, હું તમારો ભરોસો કરીશ.

4 હું દેવની કૃપાથી તેમના વચ્ચન માટે સુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જશપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?

- 5 મારા શત્રુઓ હુમેશા મારા શબ્દોને મયડી નાખે છે.
અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
- 6 તેઓ એકથા થાય છે ને સંતાઈ રહે છે, તેઓ મારા પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
- 7 યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.
- 8 તમે મારી બધી વેદના જોઈ છે. તમે મારા આંસુઓથી શાત છો. તમે તેને તમારી શીશીમાં સંધર્યો છો. અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છો.
- 9 હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પણ છે.
- 10 હું દેવની તેમનાં વચ્ચને માટે સુતી કરીશ, હું યહોવાની તેનાં વચ્ચન માટે સુતી કરીશ.
- 11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી, પછી માણસ મને શું કરનાર છે?
- 12 હે યહોવા, મેં તમને વચ્ચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તેમને મારી આભારસુતી અર્પણ કરીશ.
- 13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છો, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.

ગીત 57

નિર્દેશક માટે: રાગ: "વિનાશ કરતો નહીં" દાઉદનું મિધ્નામ.
તે શાઉલથી ભાગી જઈને ગુજરાતી રહેતો હતો
તે વખતનું ગીત.

- 1 હે દેવ, મારા પર દ્યા કરો, કારણ, હું તમારા પર ભરોસો રાખું છું, આ તોફાન શર્મી જાય ત્યાં સુધી હું; તમારી પાંખોની છાયામાં આશ્રય લઈશ.
- 2 હું પરાતપર દેવને પ્રાર્થના કરીશ, તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
- 3 તે સ્વર્ગમાંથી સહાય મોકલશે અને મને બચાવશે. જેઓ મને નુકશાન કરવા માગે છે તેમનાથી મને ઊગારશે.
- 4 મારું જીવન જોખમમાં છે. હું માનવભક્તી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જુભ જીણે ધારદાર તલવાર સમાન છે.
- 5 હે યહોવા, તમે સ્વર્ગાથી પણ ઉપર ઉચ્ચે છો. તમારો મહિમા પૃથ્વીને ઢાંકે છે.
- 6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધ્યા છે; તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે; જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
- 7 હે દેવ! મારું હદ્ય તૈયાર છે, મારું હદ્ય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવની સુતીઓ ગાઈશ.

- 8 હે મારા આત્મા, મારી વીજા અને તંબુરાઓ આગ્રત થાઓ, હું પ્રભાતમાં વહેલો જાગીશ, ને હું પરોઢને આવકાર આપીશ.
- 9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઈશ. બધા લોકો પાસે હું તમારા વિષે ગાઈશ.
- 10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે. તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉચ્ચે પહોંચે છે.
- 11 હે દેવ, તમે સ્વર્ગોની ઉપર ઉચ્ચે છો. સમગ્ર સંસારને તમારો મહિમા આવરી લે છો.

ગીત 58

નિર્દેશક માટે: રાગ: "વિનાશ કરતો નહીં"

દાઉદનું મિધ્નામ.

- 1 ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો? શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
- 2 ના, તમે કેવળ દુષ્ટટા કરવાના વિચાર કરો છે તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
- 3 દુષ્ટ માણસો જનમથીજ ખોટા માર્ગ વળે છે; ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
- 4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે, તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવાં છે.
- 5 ગારૂડી અતિ કુશળતાથી મહવર વગાડે છે, છતાંય તેનો સાદ સંભળાતો નથી.
- 6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો; હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
- 7 સૂરી ધરતી પર જેમ પાણી ચૂસાઈ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો; સુકાયેલા ઘાસની જેમ તેઓને કયડાઈ અને ચગદાઈ જવા દો.
- 8 તમે તેઓને કાદવમાં ઓગળાતી જતી ગોકળગાય જેવાં, અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
- 9 તમારા હાંલાંને કાંઠાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા, તો પણ, વંટોળીયો પળવારમાં ઘસડીને લઈ જશે તેમ તેનાથી પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
- 10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે તેને શિક્ષા થતી જોઈને સજ્જન વ્યક્તિને આનંદ થશે, તે એક સૈનિક જેવો થશે, જેણે તેનાં શત્રુઓને હરાવ્યા છે.*
- 11 માટે લોકો કહેશે; ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે, સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.

તે એક ... હરાવ્યા છે મૂળ પ્રમાણે, "તે તેનો પગ નીચ માણસોના લોહીથી ધોસે."

ગીત 59

નિર્દશક માટે. રાગ: "વિનાશ કરતો નહીં" દાઉદનું
મિખામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી
કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.

- 1 હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઉઠે છે, તેઓથી તમે મને ઉગારો.
- 2 દુષ્ટા કરનારાઓથી તમે મને બચાવો; અને ખૂની માણસોથી તમે મને બચાવો.
- 3 ધાતકી માણસો છૃપાઈ રહીને મારો જીવ લેવા કેવા, રાહ જોઈ રહ્યા છે! હે યહોવા, મેં કોઈ પાપ કર્યું છે કે કોઈ અપરાધ કર્યો છે, કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે એવું નથી.
- 4 જોકે મારો દોષ ન હોવા છીતાં તેઓ અહીં ઘસી આવ્યા છે અને મારા ઉપર હુમલો કરવાની તેથારી કરે છે. હે યહોવા, જાગ્રત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
- 5 હે યહોવા, સૈન્યોના દેવ; ઈસાઅલના દેવ, જાગૃત થાઓ; આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો; તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહીં.
- 6 પાછા આવે છે તેઓ સંધ્યાકાળે, અને તેઓ કૂતરાની જેમ ધૂરકે છે; નગરની આસપાસ ફરા ખાય છે ને ચોરી છુપીથી આંટા મારે છે.
- 7 તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે. તેઓના હોઠોમાંથી તલવારની જેમ શબ્દો નીકળે છે. તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.
- 8 હે યહોવા, તમે તેઓને હસી કાઢો; અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
- 9 હે દેવ, મારા સામર્થ્ય! હું તમારી વાટ જોઈશ; તમે મારી સુરક્ષાનો ઊચો મજબૂત ગઢ છો.
- 10 યહોવા મારો કૂપાળું દેવ મને મદદ કરવા આગળ આવશે. તે મને શત્રુઓનો પરાજ્ય જોવા દેશે.
- 11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો, કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સામર્થ્યથી હરાવો.
- 12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે, તેઓના જ હોઠે અસત્ય બોલે છે, પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઈ જવા દો.
- 13 તમે તમારા કોધમાંજ તેઓનો સંહાર કરો; જેથી સંપૂર્ણ વિનાશ થાય; પછી સર્વ લોકો જાણશે કે ઈશ્વાઅલમાં દેવ રાજ કરે છે, અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.
- 14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે, અને તેઓ ચોરી છુપીથી નગરમાં ફરે છે.
- 15 ખાવા સારું ખોરક માટે તેઓ રખડે છે, તેઓને સંતોષ ન થાય ત્યારે ધૂરકે છે.

- 16 પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ, સવારમાં હું તમારી કૃપા વિષે ગાઈશ, કારણ તમે મારા મજબૂત ગઢ છો; સકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
- 17 હે મારા સામર્થ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું; કારણ તમે મારા મજબૂત ગઢ છો, દેવ, તમે મને પ્રેમ કરનારા છો.

ગીત 60

નિર્દશક માટે. રાગ: "કરાર નું કમળ" શિખામણ માટે દાઉદનું મિખામ, તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોભાહ સાથે લઙ્ગો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમાના 12,000 સેન્નિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

- 1 હે દેવ, તમે અમને ત્યજી દીધા છે. અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરભાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
- 2 તમે ધરતીકપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે. હે યહોવા, તેને ફરીથી યર્થાર્થ બનાવી દો. જુઓ તેના પાયા હલી ગયા છે.
- 3 તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયાં છો, તમે મારેલી લપડાકોએ અમને લથડીયાં ખવડાવ્યાં છે.
- 4 તમે તમારી બીક રાખનારાઓને ધવજા આપી છે, અને ચેતવણી આપી છે જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.
- 5 આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો. મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.
- 6 જ્યારે દેવે તેમનાં પવિત્ર સ્થાનમાંથી કણું, "વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ; અને સુકોથની ખીણ મારા લોકમાં વહેંચીશ," ત્યારે હું ખૂબ ખુશ થયો.
- 7 ગિલયાદ મારું છે, મનાશા મારું છે; અને એઝાઈમ મારું શિરસ્થા છે. યહુદા મારો રાજદદ બનશે.
- 8 યોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે, અને જે મારા પગરખાં લઈ જાય છે તે અદોમ મારું ગુલામ છે. હું ફિલીસ્તીનીઓને હરાવીશ અને વિજયના પોકાર કરીશ."
- 9 મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
- 10 હે દેવ, શું તમે અમને ત્યજી દીધા છે? તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતાં નથી.
- 11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો; કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
- 12 દેવના સાથથી અમે પરાકમો કરશું; કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

ગીત 61

નિર્દશક માટે. તારવાળા વાજુંત્ર સાથે ગાવા
માટે. દાઉદનું ગીત.

- 1 હે દેવ, મારા પ્રાર્થના ગીતો સાંભળો અને મારી અરજી પર ધ્યાન આપો.
- 2 જ્યારે મારું હદ્ય વ્યાકુણ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ! હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી, તથી તમે, મને લઈ જો.
- 3 તમે મારું આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે મને મારા શત્રુઓથી બચાવે છે!
- 4 સદાકાળ હું તારા મંડપમાં રહીશ, અને તારી પાંખોના આશ્રયે રહીશ.
- 5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિશાઓ તમે સ્વીકારી છે. જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
- 6 રાજના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી તે આવનાર પેઢીઓ સુધી જીવે.
- 7 તે સદાકાળ દેવની સન્મુખ રહેશે. તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
- 8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્જ કરીશ.

ગીત 62

નિર્દશક માટે. યદ્વારાની રીત મુજબ ગાવા
માટે. દાઉદનું ગીત.

- 1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે. મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું, કારણ ફક્ત તેજ મારું રક્ષણ કરી શકે છે.
- 2 હા, તે એકલાંજ મારા ખડક-તારક, અને રક્ષક છે, તે મારા ગઢ છે; સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
- 3 જે વ્યક્તિ નભી ગયેલી ભીત કે ભાગી ગયેલી વાડ જવી નિર્ભળ છે, તેના ઉપર તમે સર્વ માણસો ક્યાં સુધી આક્રમણ કરશો?
- 4 તેઓ તેને તેનાં શ્રેષ્ઠ સ્થાનેથી, નીચે પાડી દેવા ચાહે છે; તેઓ જૂથી હરખાય છે, અને મુખેથી આશીર્વાદ આપે છે, પરંતુ હદ્યથી શાપ આપે છે.
- 5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી અને ધૈર્યથી રાહ જુઓ છે. હું અપેક્ષા રાખું છું કે તે મારી રક્ષા કરે; કારણ, તે એકલાંજ મને બચાવી શકે તેમ છે.
- 6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે, હું ઉથલાઈ જનાર નથી.
- 7 દેવમાં મારું ગૌરવ તથા તારણ છે, મારો સામર્થ્યનો ખડક અને આશ્રય પણ દેવમાંજ છે.
- 8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો, અને તમારી શું મનોકામના છે તે તેને કહો. આપણા સૌનો આશ્રય દેવ છે.

- 9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાઈજ નથી; ફક્ત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
- 10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શક્તિ પર આધાર રાખશો નહીં. લૂટ કરીને મેળવવું છે એવું વિચારશો નહીં. જો તમે ધનવાન બનો તો, તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહીં.
- 11 દેવ એકવાર બોલ્યા છે, ને મેં બે વાર સાંભળ્યું છે: “સામર્થ્ય દેવ પાસે છે.”
- 12 ઓ યહોવા, કૃપા પણ તમારીજ છે, તમે પ્રત્યેક વ્યક્તિને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.

ગીત 63

દાઉદનું ગીત. તે યદ્વારાના અરણ્યમાં હતો તે વખતનું ગીત.

- 1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શાંખમાં હું કેટલું ફર્ખ્યો? જળ જંખી વેરાન સૂકી ભૂમિની જેમ; તમારે માટે મારો આત્મા કેટલો તલસે છો! ને દેહ તલપે છે.
- 2 તથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવા, પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખ્યું છું.
- 3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
- 4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ, ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
- 5 જાણો કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
- 6 મારી પથારીમાં હું તમારું સ્મરણ કરું છું, અને મધરાતે તમારું ધ્યાન ધરું છું.
- 7 તમે મને સહાય કરી છે, અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
- 8 મારા આત્માએ તમારો કેડો પકડો છે, તેથી મને તમારો જમણો હાથ ઊચ્ચાઈ રાખે છે.
- 9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઊડાણમાં ઘડેલાઈ જશે.
- 10 તેઓ તલવારથી માર્યા જશે, અને જંગલી શિયાળો દ્વારા ખવાઈ જશે.
- 11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરેકે જોણે તેમને આજ્ઞાકિત રહેવા વચ્ચે આપ્યા, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓના મોંઢા બંધ કરી દેવશે.

ગીત 64

નિર્દશક માટે. દાઉદનું ગીત.

- 1 હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો, શત્રુ તરફના ભયથી મને ઉગારો.

- 2 દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે. તેમનાથી મને છુપાવી દો.
- 3 તેઓએ તેમની જીબને તલવાર જેવી તિક્ષણ બનાવી છે. તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઈને વીધવા માટે તૈયાર છે.
- 4 તેઓ જાડીમાં છુપાય છે અને નિર્દ્દ્યાપો ઉપર તેમનાં તીર ચલાવે છે. તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે. આમ કરતાં તેઓ ગભરતા નથી.
- 5 તેઓ પોતાની દુષ્ટ ધારણા, દ્રઢ કરે છે; અને ગુપ્ત જાળ બીધાવવા મસલત કરે છે; તેઓ કહે છે: "અમને અહીં જોનાર કોણ છે?"
- 6 તેઓ દુષ્ટ કૃત્યો કરવા માટે યોગ્ય તકની ચંતુરાઈથી રાહ જુએ છે; તેઓનાં હદ્યનાં તીડાણમાં દુષ્ટ વિચારો અને ખરાબ યોજનાઓ છે.
- 7 પણ દેવ પોતે તેઓને "બાણ" મારશે, અને એકાએક તેજ તેઓને વીધી નાખશે.
- 8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે. અને તેઓ ઠોકર ખાશે; જે કોઈ તેઓને જોશે તે સર્વ આશ્રયથી માથા ધુણાવશે.
- 9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે. અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે અને દેવનાં અદ્ભૂત કાર્યો વિષે બીજાઓને શીખવશે.
- 10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે. તે દેવ પર આધાર રાખે છે. અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.

ગીત 65

નિર્દ્દશક માટે. પ્રશંસાનું દાઉદુનું ગીત.

- 1 હે દેવ, સ્થિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઈએ છીએ; અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
- 2 તમે હુમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
- 3 અમારા પાપો આપણા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂસી નાંખો છો.
- 4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચાવતા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ધરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી, અમે તૂટ થયા છીએ.
- 5 હે તારણાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
- 6 દેવે તેમની અદ્ભૂત શક્તિથી પર્વતો રચ્યાં. તેઓ સામર્થ્યથી સુસજ્જુત હતા.

- 7 તોઝાની "સમુદ્રોને" અને મોજાઓની ગર્જનાને, તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
- 8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવત કાર્યો નિહાળણો, અને આશ્રય પામશે. સૂર્યનાં ઉદ્ય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
- 9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છો. દેવની નદીઓ પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે.
- 10 તમે ખેતરનાં ચાસોને વરસાદનું પાણી આપો છો, વરસાદનાં જાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો, અને તેમાં થથી ફસલને આશીર્વાદ આપો છો.
- 11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરી હતી. તમે ઋતુઓના ચકને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો.
- 12 વેરાન ખેતરો ધાસથી ભરાઈ ગયા છે અને ધાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઈ ગઈ છે.
- 13 વળી ધાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઈ જાય છે, અને ખીંચો, ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે; આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે. અને હા, તેઓ ગીતો ગાય છે.

ગીત 66

નિર્દ્દશક માટે. સ્તુતિગીત.

- 1 હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સન્મુખ હર્ષના ગીત ગાઓ.
- 2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ. સ્તુતિગાનથી તેમનો આદર કરો.
- 3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સામર્થ્યથી તમારી આગળ નમે છે.
- 4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
- 5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો કેવાં આશ્રયકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
- 6 સૂક્વી નાંખ્યો તેણે સમુદ્રને, તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી. ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
- 7 તે પોતાના પરાકરમાં સદાકાળ રાજ કરે છે; હુમેશા રાજ કરે છે, પ્રજાઓની સર્વ હિલચાલ; તેની આંખો જુએ છે, બંદખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું તીચું નહીં કરે.
- 8 હે પ્રજાજનો, આપણા દેવને, ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધનિ સંભળાવો.
- 9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
- 10 હે યહોવા તમે અમારી કસોટી કરી છે; અમને ચાંદીની જેમ અનિન્થી શુદ્ધ કર્યા છે.
- 11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે; અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.

- 12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં, અમને અભિન અને પાણીમાંથી ચાલવું પડ્યું; પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઈ આવ્યા.
- 13 દહનાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ, હું તમારી સન્મુખ માનતાઓ પૂર્ણ કરીશ.
- 14 હું સંકટમાં હતો ત્યારે મેં તમારી સમક્ષ પ્રતિશાઓ લીધી હતી.
- 15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં, ઘેટાં અને વાછરડાં લાવ્યો છું; તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
- 16 હે દેવનાં ભક્તો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઈ કર્યું છે તે હું તમને કહીશ.
- 17 મેં મારા મુખે તમને અરજ કરી, અને મારી જીબે તેમનું સ્તવન કર્યું.
- 18 જો હું મારા હદ્દયમાં દુષ્ટતા કરવાનો ઈશાદો રાખ્યું તો યહોવા મારં નહીં સાંભળે.
- 19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર ક્રાન ધર્યા છે.
- 20 સ્તુતિ હો દેવની, તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી, કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

ગીત 67

નિર્દેશક માટે. વાળુંતો સાથે સ્તુતિનું ગીત.

- 1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો; ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
- 2 દેવ પૃથ્વી પરનો પ્રત્યેક વ્યક્તિ તમારા માર્ગાં વિષે ભલે શીખે. ભલે બધીજ પ્રજાઓ તમારી તારણની શક્તિ વિષે જાણો.
- 3 હે દેવ, પૃથ્વીના સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરો.
- 4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઈન્સાફ કરશો.
- 5 હે દેવ, લોકો આભારસ્તુતિ કરો; હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
- 6 પૃથ્વીએ આપણાને તેનો વિપુલ પાક આપ્યો છે. હા, યહોવા આપણા દેવ આપણાને આશીર્વાદ આપશે.
- 7 દેવ આપણાને આશીર્વાદ આપે, પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

ગીત 68

નિર્દેશક માટે. પ્રશસ્તાનું દાઉદનું ગીત.

- 1 હે દેવ ઉઠા, તમારા શત્રુઓ વિખરાઈ જાઓ; તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
- 2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અણિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સન્મુખ નાશ પામો.

- 3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સન્મુખ; હા, સૌ અતિ આનંદ કરો.
- 4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો; જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે. રણમાં તેમના માટે સરડકો બાંધો ; જેમનું નામ છે યાહ, * તેમની સામે ઉલ્લાસ કરો.
- 5 આ દેવ, પોતાના પવિત્ર સ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રસ્કક છે.
- 6 દેવ અકાકી લોકોને ઘર આપે છે. કેટીઓને બંધનમાથી મુક્ત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂદી અને વેરાન પદેશમાં રહેવાની ફરજ પાડે છે.
- 7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં, અને તમે વેરાન રણમાં કૂચ કરી.
- 8 દેવ, ઈસાએલનાં દેવ સિનાઈ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધૂજુ ઊઠી અને આકાશ ઓગળી ગયું.
- 9 હે દેવ, તમે ઘોઘમાર વરસાદ મોકલ્યો; અને સૂક્કીભં જમીનને તાજુ કરી.
- 10 ત્યાં તમારી પ્રજાએ ક્રાયમી વસવાટ કર્યો, હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
- 11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગ્યાએ હતું. લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
- 12 "ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે. અને ઘરે સીઓ લડાઈમાં કરેલી લૂટ વહેંચી લે છે.
- 13 જેઓ ઘરે રહ્યાં છે તેમને રૂપાથી મફેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે."
- 14 જેમ સાલ્માનના હિમાચાદિત શિખરોનો બરફ પીગળી જાય છે, તેમ જુઓ દેવ તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
- 15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે, બાશાનનો ઘણાં શીખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
- 16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઈ કરો છો? કે જેને યહોવા પોતાને રહેવા માટે ઈચ્છતા હતી જ્યાં તે સદાકાળ રહેશે.
- 17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઈના પર્વત પરથી આવે છે; અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
- 18 જ્યારે તે ઉચાઈ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસો* પાસેથી બેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.

યાહ, આ દેવ માટેનું હિંજુ નામ છે. આ સામાન્ય રીતે "યહોવા" જેમ ભાષાંતરિત થતું હિંજુ નામ છે.
 જે... તથા માણસો "તેણે માણસોને બેટો તરીકે લીધા." આથવા, "તેણે માણસોને બેટો આપી," પૌરાણીક સાવરીઆક અને અરમાનીક અનુવાદો પ્રમાણે.

- 19 ધન્ય છે યહોવાને, કે જેઓ રોજ આપણો બોજો ઊચકી લે છે, અને તેઓ જ સૌનું તારણ કરે છે.
- 20 તેઓજ આપણને મૃત્યુથી મુક્ત કરે છે, યહોવા જ આપણા તારણના દેવ છે.
- 21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ, તેઓ અપરાધના માર્ગા છોડી દેવાની ના પાડે છે.
- 22 યહોવા મારા માલિકે કર્યું, "હું તેમને બાશાનથી પાછા લાવીશ, પરંતુ શત્રુઓને ઊડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
- 23 જેથી ભલે તમે શત્રુઓનાં રક્તમાં ચાલો, અને તમારા કૂતુરાઓની જીબને પણ તે ભલે ચાખવા મળો."
- 24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે! તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
- 25 આગલી હોરણમાં ગાયકો કૂચ કરતાં આવે છે. તેમના પછી સંગીતકારો, અને તેઓ ઉફ્લી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
- 26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો; ઈસાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો. કારણ, એ ઈસાએલનાં જરા સમાન છે.
- 27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે, યહૂદાના સરદારો, જબુલોન-નફતાલીના સરદારો તેઓની સભા પાછણ છે.
- 28 હે દેવ, હે યહોવા! તમારી તાકાત બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યું હતું તેમ, તમારી મહાન શક્તિની અમારી ભલાઈ માટે જાણ થાય.
- 29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં રાજાઓ ઉપહારો લઈને આવે છે.
- 30 બરુઓ વચ્ચે છુપાયેલા "પ્રાણીઓને" ઠપકો આપો, રાષ્ટ્રોના "વાછરડાઓના" વચ્ચેના "આખલાઓનાં ટોળાઓને" પણ ઠપકો આપો, જેથી તેઓ તમારે શરણે આવે અને તમારા માટે ચાંદીની ભેટો લાવે, યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાખો.
- 31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઈને આવશે. કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
- 32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ, અને યહોવાનું સત્વન કરો.
- 33 પુરાતન કાળનાં આકાશોમાં થઈને વાદળ પર સવારી કરનારા, એ અને જેમનાં પરાકમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
- 34 પરાકમ કેવળ દેવનું છે, તેમની સત્તા ઈસાએલ પર છે; તેમનું સામર્થ્ય આકાશોમાં છે; પરાકમ પણ આકાશોમાં છે.
- 35 હે દેવ, તમે તમારા પવિત્ર સ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો, ઈસાએલના દેવ જેઓ પોતાના લોકોને સામર્થ્ય તથા પરાકમ આપે છે, તેમને ધન્ય હો!

ગીત 69

- નિર્દેશક માટે રાગ : "શોશાનીમ." દાઉદનું ગીત.
- 1 હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યુ છે, મારી રક્ષા કરો.
 - 2 કીચડમાં હું ઊડે ને ઊડે ખૂપતો જાઉ છું, જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી, હું ઊડા જળમાં આવી પડ્યો છું, જળપ્રલયે મને દૂબાડી દીઘો છે.
 - 3 હું રડી રડીને નિર્ગત થઈ ગયો છું અને માણ ગળું સુકાઈ ગયું છે. મારા દેવની વાટ જોતાં, આંખોનું તેજ ઘટી ગયું છે.
 - 4 જેઓ વિના શરણે મારો દ્રેષ્ટ કરે છે, તેઓ મારા માથાનાં વાળથી વધારે છે; હું નિર્દ્દીષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શક્તિશાળી બન્યા છે. તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે. કહે છે મેં વસ્તુઓ ચોરી હતી. તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
 - 5 હે દેવ તમે મારી મૂર્ખાઈ જાણો છો, અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
 - 6 હે યહોવા સૈન્યોના દેવ, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીદા ન થાય. ઈસાએલનાં ઓ દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
 - 7 મેં તમારા માટે શરમ સહન કરી છે, ને માણ મુખ પણ શરમથી ઠંકાયેલું છે.
 - 8 મારા ભાઈઓને મન હું પારક જેવો છું, ને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
 - 9 કારણ, મારું હદ્દય, દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉતેજીત થયું છે. જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યા છે.
 - 10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદ્ધ અને ઉપવાસ કરું છું, ત્યારે તેઓ મારી મશકરી કરીને નિંદા કરે છે.
 - 11 જ્યારે હું મારા પાપનુંદુઃખ પ્રગટ કરવા અને આત્માનું રંકપણું દર્શાવવાં તાટનાં વસ ધારણ કરું છું, ત્યારે તેઓ મારી મશકરી કરે છે.
 - 12 ભાગોળમાં બેસનારાઓ મશકરી કરે છે. અને છોકરાઓ મારા વિષે રાસડા ગાય છે.
 - 13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્ત્વતાએ પ્રત્યુત્તર આપો.
 - 14 મને કીચડમાંથી કાઢો, મને ઊડા પાણીમાં દૂબવાં દેશો નહીં અને દ્રોષીઓથી મારી રક્ષા કરો.
 - 15 રેલ સંકટ મારા પર ફરી ન વળો, સાગરનાં ઊડાણ મને ગળી ન જાય; અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
 - 16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ, તારી કૃપા સારી છે; તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.

- 17 તમારું મુખ તમારો આ દાસથી છુપાવશો નહીં, હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
- 18 હે યહોવા, આવો, મારો આત્માની રક્ષા કરો! મને મારા સર્વ શત્રુઓથી મુક્ત કરો.
- 19 તમે જાજો છો કે મારે શરમ અપમાન અને હિણપદ સહન કરવાં પડે છે. મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઈ છે.
- 20 નિદાથી શરમે મારું હદ્ય ભાંગ્યું છે, અને હું લાંબું જીવવા માટે ખૂબ દુર્બળ બની ગયો છું. દિલાસો અને આરામ બતાવનારની રાહ જોઈ પરંતુ મને કોઈ પણ મળ્યું નહીં.
- 21 ખોરાકને બદલે મને પિત ખાવા મળ્યું ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
- 22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને, અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
- 23 ભલે તેઓની આંખો કરીપણ જોવા માટે જાંખી બને, અને ભલે તેઓ અંધ બની જાય. અને ભલે તેમની કર્મશોનભણી બને. ૨૪ ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો, તમારો ક્રોધાઙ્ગ તેઓને પદ્ધતિ પાડો.
- 25 તેમનાં ઘરો ઉજ્જવલ થાઓ, ને તેમાં કદી કોઈ નિવાસ કરે નહીં.
- 26 કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂર્ણ પકડે છે, ને જેને તમે ધાયલ કર્યો છે, તેનાં દુઃખની વાત કરે છે.
- 27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે. તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.
- 28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂતી નાખો, સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો.
- 29 પણ હે દેવ હું તો નિઃસહાય અને ઉદાસ છું; હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
- 30 પછી હું ગીત ગાઈને દેવના નામનું સ્તવન કરીશ, ને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
- 31 અને તે બળદાનાં અથવા વાઇરડાનાં બલિદાન કરતાં તેમને વધુ આનંદ આપશો.
- 32 નમ જનો તે જોઈને આનંદ પામશે, દેવને શોધનારાઓ તમારા હદ્યો નવું જીવન પામો.
- 33 કારણ યહોવા દરદ્રીઓની અરજ સાંભળે છે, અને તેમનાં જે લોકો બંદીવાન છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આદું ફેરવતાં નથી.
- 34 આકાશો તથા પૃથ્વી તમનું સ્તવન કરો; સમુદ્રો તથા તેમનાં સર્વ જળયર તેમની સ્તુતિ કરો.
- 35 કારણ, દેવ સિયોનને બચાવશે, અને યહૂદાનાં નગરોનું નવનિર્માણ કરશે; તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
- 36 વળી તેનાં સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે, તેમનાં નામ પર પ્રિતિ રાખનારા તેમાં વસશે.

ગીત 70

- નિર્દેશક માટે. દાઉદનું એક ગીત – લોકોને યાદ રાખવા માટે.
- 1 હે દેવ મારું રક્ષણ કરો; હે યહોવા, મને સહાય કરવા દોડી આવો.
 - 2 જેઓ મારો પ્રાણ લેવા ઈચ્છે છે તેઓ નિરાશ થાઓ અને મુંજાઈ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઈચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.
 - 3 જેઓ મારી મશક્કરી કરે છે, તેઓ પોતાના પરાજ્યથી લાજીજત થાઓ.
 - 4 જેઓ તમારું મુખ શોધે છે, તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો; જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો દેવને મહાન માનો.
 - 5 પણ હું તો દરદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમેજ એકલાં મારા સહાયક ઉદ્ઘાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલબ ન કરો.

ગીત 71

- 1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે. મને શરમિદો કરશો નહીં.
- 2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુક્ત કરો; મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારા તરફ કાન ધરી મારો ઉદ્ઘાર કરો.
- 3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ, તમે મને તારવાની આજા કરી છે કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
- 4 મારા દેવ, તમે મને દુષ્ટોના ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
- 5 ઓ યહોવા, ફક્ત તમેજ મારી આશા છો! મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
- 6 હું ગર્ભસ્થાનમાં હતો ત્યારથી તમે મારા આધાર રહ્યા છો. મારી માતાનાં ઉદરમાંથી મને કાણનારા તમેજ છો. ઓ દેવ હું હમેશા તમારી સ્તુતિ ગાઈશ.
- 7 હું બીજા લાકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું. પણ તમે તો મારો શક્તિશાળી આશ્રય છો.
- 8 તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે, આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
- 9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શક્તિ ખૂટે ત્યારે મને તરછોડી ને મારો ત્યાગ ન કરો.
- 10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે, મારો પ્રાણ લેવાં તાડી રહ્યા છે; ને તેઓ અંદરો અંદર મસલત કરે છે.
- 11 તેઓ કહે છે, “દેવે તેને ત્યજુ દીધો છે, આપણે પાછણ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઈ નથી.”
- 12 હે દેવ, મારાથી દૂર ન જશો; તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો; અને મને સહાય કરો.

- 13 મારા આત્માનાં દુશ્મનો ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા ને અપમાનથી ઢકાઈ જાઓ.
- 14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ; અને વધુને વધું સુતિ કરીશ.
- 15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ઘારનાં કૃત્યો માલં મુખ આખો દિવસ પ્રગટ કરશે. તેઓની સંખ્યા કેટલી મોટી છે તે હું જાણતો નથી.
- 16 હે યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યાને પ્રગટ કરીશ! તમારા ન્યાયીપણ વિષે લોકોને જણાવીશ.
- 17 હે દેવ, મારું બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચ્યાત્કરો વિષે જણાવતો રહ્યો છું.
- 18 હે દેવ, હું હવે ધરડો થયો છું ને વાળ પણ સર્કેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચ્યાત્કરો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું, તે માટે મને સમય આપો.
- 19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉર્ચય છે; હે યહોવા, તમે મોટાં કામો કર્યા છે; તમારા જેવો બીજો કોણ છે?
- 20 ધણાં બેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુનર્જીવિત કરશો.
- 21 તમે મને અગ્રાઉ કરતાં ય વધારે માન આપશો, અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
- 22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ, હે મારા દેવ, હું તમારી સાત્યતાનું સ્તવન કરીશ; હે ઈસાએલનાં પવિત્ર દેવ; હું લીણા સાથે તમારા સ્તોત્રો ગાઈશ.
- 23 હું તમારી સ્તુતિ કરીશ ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશો, અને ઉદ્ઘાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
- 24 મારી જીબ આખો દિવસ તમારી દ્યા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે જેઓ મને હાની પહોંચાડવા હીછે છે તેઓને લંઘિજત અને અપમાનિત કરાયાં છે.

ગીત 72

ગીત સુલેમાનને.

- 1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા શાન અને અધિકાર આપો, ને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
- 2 તેઓ તમારા લોકોનો નિષ્પક્તાથી ન્યાય કરશે. તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
- 3 પર્વતો અને હુંગરો ન્યાયીપણે લોકો માટે, શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.
- 4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુઃખીઓનો, દરિદ્રીઓનો દીકરાઓનો ઉદ્ઘાર કરશે; ને જુલમગાર પાપીઓને કયડી નાંખશે.

- 5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી બીજો અને રાજાને માન આપે.
- 6 જેમ ખેતરો પર વરસાદ પડે છે વરસાદનાં જાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
- 7 તેના શાસનકાળમાં ન્યાયીઓની આબાદી થશે, અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
- 8 વળી સમુદ્રથી સમુદ્ર સુધી અને યુઝેનિસ નદીથી પૃથ્વીના છંડા સુધી તે રાજ કરશે.
- 9 તેની સમક્ષ રણવાસીઓ નમશે, અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
- 10 ને તાર્થીશના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના ડિનારના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
- 11 ને સર્વ રાજાઓ તેને નમન કરશે, અને સર્વ રાજ્યો તેની સેવા કરશે.
- 12 કારાજાકે તે ગરીબ અને જરૂરીયાત વાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઈ મદદગાર નથી તેમને તે બચાવે છે.
- 13 તે લાચાર દરિદ્રીઓ પર દ્યા બતાવશે, અને દરિદ્રીઓનાં આત્માનું તારણ કરશે.
- 14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે; તેઓની નજરોમાં તેઓનું રક્ત મૂલ્યવાન છે.
- 15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે, રાજા ધણું લાંબુ જીવો! તેમના માટે પ્રાર્થનાઓ થશે; ધન્યવાદ આપશે સર્વ લોકો સદ્ય તેને આશિષ આપશે.
- 16 દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ટ્રગલાં થશે, તેનાં ફળ લબાનોનાં ફળ જેવાં થાઓ, ધાસની જેમ વધશે નગરનાં રહેવાચીઓ.
- 17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે; અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે; તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે; તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
- 18 ઈસાએલનાં દેવ, યહોવા દેવને ધન્ય હજો; એકલા તેઓજ આશ્રયકારક કર્મા કરે છે.
- 19 તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
- 20 અહીં પૂર્ણ થાય છે પ્રાર્થનાઓ ઈશાઈનાં પુત્ર દાઉદની.

ભાગ ત્રીજો

ગીત 73

આસાફના સ્તુતિગીત.

- 1 જેઓના હદ્ય શુદ્ધ છે ઈસાએલ પર; તેમનાં પર ખરેખર દેવ કૃપાવાન છે.
- 2 પરંતુ હું લગમભગ લપસ્યો અને પાપ કરવા લાગ્યો,
- 3 કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઈ.

- 4 તેઓને જીવનપર્યત મુશ્કેલી આવતી નથી, અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.
- 5 તેમનાં પર માનવજીતનાં દુઃખો આવતાં નથી; અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
- 6 તેઓનો ગર્વ ગળાની કઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વખ ધારણ કર્યા છે.
- 7 તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા હશ્ચ છે; તેને પ્રાપ્ત કરવાના માર્ગો હુમેશા શોધે છે.
- 8 તેઓ અન્યોની મશકરી કરે છે અને વિકારથી વાત કરે છે, તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનની બોલે છે.
- 9 સ્વર્ગની વિદ્યુત તેઓ બાળગાં કૂંકે છે, તેઓની જીબ અભિમાનની વાતો કરે છે; પૃથ્વી પર.
- 10 તેથી દેવના લોકો પણ તેમની રત્ન વળે છે અને તેઓ જે કહે તે સ્વીકારે છે.*
- 11 તેઓ પૂછે છે, “જે કાઈ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે? શું પરાત્પરમાં કાઈ જ્ઞાન છે?”
- 12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હુમેશા ચિંતામુક્ત હોય છે; અને તેઓ શાંતિમાં રહીને, સંપત્તિ વધારતા જાય છે.
- 13 મે મારું હંદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિર્દ્દ્યાપ રાખ્યાં છે; પણ તેથી કોઈ વિશેષ ફાયદો નથી.
- 14 કારણ, હું આખો દિવસ પીડાયાં કરું છું, અને દર સવારે મને શિક્ષા થાય છે.
- 15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત, તો મેં તમારા લોકોનો વિશ્વાસધાત કર્યો હોત.
- 16 જ્યારે મેં તે સમજવા ઉડો વિચાર કર્યો, ત્યારે મને લાખ્યું કે તે સમજવું મારે માટે બહુ કરીન છે.
- 17 પરી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો, ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.
- 18 તમે તેઓને લપસણી જગ્યાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
- 19 તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે, અને તેઓ અનંતકાળ પર્યત ત્રાસ પામશે.
- 20 તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે, માનવ સ્વપ્નમાંથી જાગી વાતસ્વિકતા નિહાળે છે; તેમ તેઓ જાગ્રત થશે, હે યહોવા સત્ય સંબંધી નીશે.
- 21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો ત્યારે મારું હંદય ઉદાસ બની ગયું.
- 22 કટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાગી શક્યો; હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
- 23 પરંતુ, તેમ છતાંય, હું હુમેશા તમારી સાથે છું. અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
- 24 તમારા જ્ઞાન અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે મારો સ્વીકાર કરશો માહિમાવંત સ્વર્ગમાં.
- 25 સ્વર્ગમાં તમારા વિના મારું બીજું કોણ છે; અને પૃથ્વી પર મને બીજું કોઈ પ્રિય નથી.
- 26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હંદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
- 27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે. અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
- 28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છી! મેં મારા દેવ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

ગીત 74

આસાફનું માસ્કીલ.

- 1 હે દેવ તમે અમને સદાને માટે શા માટે ત્યજી દીઘા છું? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજુ આજેય ગુર્સામાં છો?
- 2 હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીયા. તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા. સ્મરણ કરો સિયોન પર્વત, જે જગ્યાએ તમે રહો છો.
- 3 દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો. પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યું છે!
- 4 તમે જ્યાં અમારીમુલાકાત લો છો, તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધવજાઓ ઊભી કરી છે.
- 5 તેઓ જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા છે.
- 6 તેઓ તેનું તમામ નકશીદાર ક્રામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
- 7 તેઓએ તમારા પવિત્ર સ્થાનને આગ લગાડી છે. તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
- 8 તેઓએ તેમને પોતાને કંધું હતું: “તેમને પૂરોપૂરા કચડી નાખીએ.” તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યો.
- 9 અમે તમારા લોકો છીએ દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વને અંત ક્યારે? કોણ કરી શકે?
- 10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશો? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
- 11 શા માટે તમે વિલંબ કરો છો? શા માટે તમારા સામર્થ્યને અટકાવી રખો છો? હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ધા કરો.

- 12 પુરાતન ક્રાણથી, દેવ મારા રાજી છે. દેવ પૃથ્વીના એક છિડાથી બીજા છિડા સુધી લોકોનું રક્ષણ કરે છે.
- 13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યા.
- 14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
- 15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘણે વહેવાળી; નિરંતર વહેતી નદીઓને સૂક્વિને તમે સુદી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
- 16 દિવસ અને રાત બંને તમારા છે, અને તમેજ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યું છે.
- 17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમેજ કરી છે; ઉનાળો-શિયાળો ઝતુઓ પણ તમે બનાવી છે.
- 18 હે યહોવા, શત્રુઓ તમારી મશકરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.
- 19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં, જવા દેશો નહીં; તમારા લોકોને, ભૂલશો નહીં અને હિંસક પ્રાણીઓથી બચાવો.
- 20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો, આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
- 21 હે દેવ, તમારા આ દુઃખી લોકોનું સતત અપમાન થવા ના દેશો. દરદીઓ અને લાચારોને તમારું સતવન કરવાને કારણ આપો.
- 22 હે દેવ તમે ઉઠો અને તમારી લડાઈમાં લડો! મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
- 23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊચા ને ઊચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ અને બરાડાઓને તમે ના વિસરશો.

ગીત 75

નિર્દેશક માટે. રાગ: "ના કરશો વિનાશ."
આસાફના સ્તુતિગીતો માનું એક.

- 1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્રયકારક કામો પ્રગત કરે છે
- 2 યહોવાએ પ્રત્યુત્તર આપો, "હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ અને નિષ્પક્તાથી ન્યાય કરીશ."
- 3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધૂજતાં હશે, અને પડવાની તેયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ."
- 4 "મેં ધમંડીઓને અભિમાન નહીં કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કણ્ણું છે, કે ધમંડ કરીને ડક્ષાસ ન મારો."

- 5 ડોક ઉચી કરીને અભિમાન સાથે ન બોલો ધમંડ કરીને ડક્ષાસ ન મારો."
- 6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો. તે રાજ પર્વતોમાંથી પણ નથી આવતો.
- 7 પણ દેવ છે, ને તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊચો કરે છે.
- 8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે; ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના દુષ્ટો પર રેડી દેવાય છે. અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
- 9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ. અને હું યાકૂબનાં દેવની સ્તુતિઓ ગાઈશ.
- 10 યહોવા કહે છે, "હું દુષ્ટ લોકોનાં સામર્થ્યને નષ્ટ કરીશ, પરંતુ હું સજ્જનોનાં સામર્થ્યની વૃદ્ધિ કરીશ."

ગીત 76

નિર્દેશક માટે. વાળુંતો સાથે.

આસાફનું સ્તુતિ ગીત.

- 1 યહૂદીયામાં દેવ જાણીતા છે, ઈસાએલમાં તેમના નામનો ઊચો આદર છે.
- 2 તેમનો મંડપ યરૂશાલેમમાં છે, અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
- 3 ત્યાં તેણે ચણકતાં બાણોને ભાંગી નાખ્યાં, ને ઢાલ-તલવારને શશ્ચ ભાંગી નાખ્યાં.
- 4 દેવ તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
- 5 જેઓ શૂરવીર છે, તેઓ લુંટાયા છે, ને ચિર નિન્દ્રાવશ થયા છે; અને કોઈ પરાકમીઓના હાથથી કાંઈ પણ થઈ શક્યું નથી.
- 6 હે યાકૂબના દેવ, તમારી હાંકથી રથ અને ઘોડા બંને ચિરનિન્દ્રામાં પડ્યાં છે.
- 7 દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
- 8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયનીત બની શાંત થઈ ગઈ.
- 9 હે દેવ, તમે ન્યાય કરવા માટે તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
- 10 તમારો માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
- 11 જે પ્રતિશાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે તે તમે પૂર્ણ કરો. ભયાવહ દેવ સમક્ષ તમે સૌ, તમારા ઉપહારો અર્પો.
- 12 પૃથ્વી નરેશો તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

ગીત 77
નિર્દેશક માટે.

યદ્વયુનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

- 1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો; મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
- 2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું મેં સહાય માટે યહોવા તરફ દૃષ્ટિ કરી. મેં તેમને આકાશ તરફ હાથ ઉચ્ચા કરીને આખી રાત પ્રાર્થના કરી જ્યાં સુધી મારા હકમાં કરી કરશે નહીં ત્યાં સુધી દિલાસો પામીશ નહીં.
- 3 હું દેવનું સંભારું છું, અને નિઃસાસાની શરુઆત કરું છું. મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ હું નિર્બણ અને લગભગ મૂર્છિત થાડી છું.
- 4 તમે મને સૂવામાંથી જાગતો રાખ્યો હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકું.
- 5 હું વિચાર કરું છું અગાઉના દિવસો અને પૂર્વના વર્ષાનો.
- 6 તે સમયે આનંદના ગીતોથી મારી રત્નિઓ ભરપૂર હતી, હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
- 7 "શું યહોવા સર્વકાળ માટે ત્યજુ દેશે? ફરીથી કઢી તે શું પ્રસન્ન થશે નહીં?
- 8 શું અદ્રશ્ય થઈ ગયો તેમનો અચયન પ્રેમ? શું નિર્ઝળ ગયાં તેમણે અમને આપેલા વચન?"
- 9 અમારા પર કૃપા કરવાનું દેવ શું ભૂલી ગયાં? શું તેમણે તેમની સહાનુભૂતિને ક્રોપમાં બદલી નાખી?
- 10 પછી મેં મારી જાતે વિચાર્યું, "મને જે સૌથી વધારે અસ્વરથ કરે છે તે આ છે."
- 11 શું પરાતપર દેવે તેમનું સામર્થ્ય બતાવવાનું બંધ કર્યું છે? અને હું તેમનાં અગાઉના ચમત્કાર સંભારીશ.
- 12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
- 13 હે યહોવા, તમારા માર્ગાં પવિત્ર છે, તમારા જેવા મહાન ક્રોધ દેવ નથી!
- 14 તમે ચમત્કારો અને અદ્ભૂત કાર્યો કરવાવાળા દેવ છો, તમે રાખ્યોને તમારું સામર્થ્ય બતાવી દીધું.
- 15 તમે તમારા લોકો યાદૂબ અને યુસુફનાં બાળકોને તમારા મહાન સામર્થ્યથી બચાવ્યાં છે.
- 16 તમને રાતા સમુદ્ર જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયબિત થયો, અને તેનાં ઊડાણો પણ ધૂજુ ઉઠ્યા'તા.
- 17 વાદળોએ પાણી વરસાવ્યું, ગજનાના પડધા આકાશે પાણ્યાં; વીજળીરૂપી બાણો ચોતરફ ઉઝ્યા.
- 18 મેઘ ગર્જનામાંથી ભયંકર ધોંઘાટ આવ્યો ગર્જનાનો વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યું. અને પૃથ્વી કંપીને ડોલી.
- 19 તમારો માર્ગ તો સમુક્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઈનાં જોવામાં આવ્યાં નહીં.

ગીત 78

આસાફનું માસ્કીલ.

- 1 મારા લોકો, મારો ઉપદેશ સાંભળો; મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
- 2 હું દ્રાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ, અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
- 3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે; જે આપણા પૂર્વજીએ આપણને કહી છે.
- 4 યહોવાના મહિમાવંત સુતિપાત્ર કૃત્યો, તેમનું પરાકમ અને આશ્રયકર્મ આપણા સંતાનોથી આપણે સંતારીશું નહીં; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
- 5 કારણકે તેમણે યાદૂબ સાથે તેમનો કરાર કર્યો અને તેણે ઈસાએલને નિયમ આપ્યો, તેમણે આપણા પૂર્વજીને આદેશ આપ્યો કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
- 6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, અને તેઓ મોટા થઈને પોતાનાં સંતાનોને તે જણાવે.
- 7 જેથી તેઓ સહુ દેવનો આધાર રાખે, અને દેવનાં અદ્ભૂત કાર્યોને વિસરી જાય નહીં, અને તેમની આશાઓને પાળે.
- 8 વળી તેઓ પોતાના પિતૃઓ જેવા હઠીલા, બંડખોર, અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ સોંપવાનો નકાર કરનાર ન થાય.
- 9 એકાઈમના લોકો શસ્સસજ્જ હતાં છતાં તેઓએ યુદ્ધિને પીછેહાડ કરી.
- 10 કારણ, તેમણે દેવનો કરાર પાણ્યો નહીં; અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
- 11 તેમણે કરેલા અદ્ભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતા, છતાં તેમનાં કૃત્યો વિસરી ગયાં.
- 12 તેઓના પિત્રુઓએ મિસર દેશમાં, સીઓનનાં મેદાનમાં; દેવ કરેલા ચમત્કારો જ્યાયા હતા.
- 13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં, તેઓને તેમાં થઈને સામે પાર મોકલ્યા હતાં તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઈ ગયું હતું,
- 14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત, અણીનાં પ્રકાશથી દોરતો.
- 15 તેમણે રણમાં ખડકને તોડીને, ઊડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
- 16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢ્યું, અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
- 17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું, અને અરણ્યમાં પરાતપર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.

- 18 તેઓએ હઠીલાઈ કરીને દેવની કસોટી કરી, દેવ તેઓને આપતા'તા તે કરતાં જુદાજ ખોરાકની માગણી કરી.
- 19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું, "શું રણમાં તે ભોજન મોકલી શકે?
- 20 તેમણે ખડકને મારીને, પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે; શું તે આપણને રોટલી આપી શકે છે? અને તેમનાં લોકોને માંસ આપી શકે?"
- 21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા, તેઓ ઈસાએલ પર ભારે કોપાયમાન થયા અને યાહૂબ પર બહુજ ગુરુસે થયા.
- 22 કારણ, તેમણે દેવમાં તેમનો વિશ્વાસ મૂક્ષો નહીં, અને તેમના તારણની શક્તિનો વિશ્વાસ કર્યો નહીં.
- 23 છતાં તેમણે આકાશોને આશા આપી, અને સ્વર્ગનાં દ્વાર ખોલી નાખ્યા.
- 24 તેઓના ખોરાક માટે માનાની વૃષ્ટિ કરી; અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
- 25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો! અને તેઓ તૃપ્ત થયા, ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
- 26 દેવે તેમનાં મહાન સામર્થ્યથી દક્ષિણ પૂર્વનો પવન ઝૂકાવ્યો.
- 27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યા.
- 28 તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાણા.
- 29 લોકોએ ધરાઈ રહ્યાં ત્યાં સુધી ખાધું, યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
- 30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહીં, અને માંસ હજુ પણ તેમના મોં મા હતું.
- 31 પછી તેમની સામે યહોવાનો ક્રોપ પ્રગટ્યાં, અને તેમણે ઈસાએલમાં જેઓ સૌથી વધુ શક્તિશાળી હતા તેમને મારી નાખ્યાં, તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
- 32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં, અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહીં.
- 33 દેવે તેઓના વર્થ જીવનનો અંત આપતિઓ સાથે કર્યો.
- 34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા, ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
- 35 ત્યારે તેઓએ યાદ કર્યું કે, દેવ તેઓના ખડક છે, અને પરાતપર દેવ તેઓના તારક છે.
- 36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી, અને પોતાની જીબે તેની સમક્ષ જૂબું બોલ્યા.
- 37 તેઓનાં હદ્ય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા; તેઓ કરારને વજાદાર નહોતા.
- 38 તેમ છતાં તેમણે દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો; તેમણે ઘણીવાર કોધ સમાવી દીધો; અને પોતાનો પૂરો ક્રોપ પ્રગટ કર્યો નહીં.
- 39 યહોવાએ સંભાર્યું કે તેઓ કેવળ કુદ્ર છે; અને એક ક્ષમામાં પસાર થતાં વાયુ જેવો છે.
- 40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીયવાર, રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું; અને રણમાં દુઃખી કર્યા.
- 41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી અને તેઓએ ઈસાએલના પવિત્ર યહોવાને દુઃખી કર્યા.
- 42 તેઓ દેવનાં મહાન સામર્થ્યને ભૂલી ગયા, તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
- 43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિનહો અને સીઓનનાં મેદાનમાં આશ્રયકર્માં કર્યા હતાં, તે પણ ભૂલી ગયા.
- 44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેણાઓને લોહી વહેણા બનાવી દીધાં, જેથી તેઓ પી ન શકે.
- 45 તેમણે મધમાખીઓનું મોટું જૂડ મોકલ્યું, અને જે તેઓને કરાયા, અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
- 46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી, ને તેઓનો બધો જ પાક તીડો ખાઈ ગયા હતા.
- 47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓન, તથા હિમથી તેઓના ગુલ્લર જાડોનો નાશ કર્યા હતો.
- 48 ખેતરોમાં તેઓના હોરણાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પક્ષો, અને વેટાનાં ટોળા પર વિજળીઓ પડી.
- 49 દેવે પોતાનો ક્રોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર; તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતો મોકલ્યા.
- 50 તેમણે પોતાના ક્રોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો; અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહીં, પણ તેઓને વિપત્તિ તથા માંદાની સૌંપી દીધા.
- 51 પછી તેણે સર્વપ્રથમ, મિસરનાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાં; તેઓના હામનાં પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
- 52 પરંતુ પોતાના લોકોને તે વેટાનાં ટોળાની જેમ બહાર લાવ્યાં; અને રણમાં થઈને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
- 53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યાં કે તેઓ બધા નહીં, પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
- 54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, દુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શક્તિથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
- 55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા. ઈસાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
- 56 છતાં ત્યારે પણ, તેઓએ પરાતપર દેવની કસોટી કરવાનું અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રખ્યું અને તેમની આશાઓનું અનુસરણ કરવાનો ઈન્કાર કર્યો.
- 57 તેઓ દેવ પાસેથી દૂર થયા તેઓ તેમનાં પૂર્વજીની જેમ દેવને અવિનયી થયાં. ફંકનાર તરફ પાછા ફરતાં,

- વાંકા શક્તિની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.*
- 58 તેઓએ ઉચા સ્થાનો બનાવીને અને જૂઠા દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
- 59 જ્યારે તેઓનાં કૂત્યો દેવે જોયાં દેવનો કોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
- 60 પછી માણસો ભધ્યે તે નિવાસ કરતા; એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
- 61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવા દીધા. દુશ્મનોએ દેવનું “સુંદર રત્ન” લઈ લીધું.
- 62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે, તેમનો કોધ અતિ વધારે હતો.
- 63 તેઓના યુવાનો અણિથી નાશ પામ્યાં; અને તેઓની કન્યાઓ તેઓના લગ્નગીતો ગવાય તે પહેલાં મૃત્યુ પામી.
- 64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ તેઓ માટે રૂદ્ધ કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
- 65 ત્યારે ઉધમાંથી કોઈ જાગે તેમ તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરુષને શૂરાતન આવે તેમ યહોવા ઉદ્ઘા.
- 66 તે તેમના શત્રુઓ તરફ ઢયા, તેમણે તેઓને પાછા વાળ્યા અને તેઓને કાયમ માટે હિંણપદ કર્યા.
- 67 દેવે યુસફના પરિવારનો અસ્વીકાર કર્યો, અને એકાઈમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહીં.
- 68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
- 69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્ત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધું.
- 70 તેમણે ઘેટાની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
- 71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઈ આવ્યા અને પોતાના લોકો, યાકૂબનાં સંતાન અને ઈસ્લાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુક્ત કર્યા.
- 72 દાઉદે તેમને શુદ્ધ હદ્યથી અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.

ગીત 79

નિર્દ્દશક માટે. આસાફના સુતિગીતોમાંનું.

- 1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આકમણ કર્યું છે. અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે. અને તેમણે યરુશાલેમન તારાજ કર્યું છે.

ફક્નાર ... હતા મૂળ પ્રમાણે : પક્ષીઓના શિકાર કરવામાં વપરાતી એક વાંકી લાકડી. સરખી રીતે ફક્તા તે સીધી ઉડે છે અને જમીન તરફ નમે છે અને એકાએક હવામાં ઉચી થાય છે, કોઈવાર ફક્નારની પાસે પાછી આવે છે. મૂળ પ્રમાણે “ઉડું ધનુષ” અથવા “વાંકુ ધનુષ.”

- 2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે અને તેઓએ તમારા વજાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
- 3 તેઓએ, યરુશાલેમની આસપાસ, પાણીના રેલાની જેમ રક્ત વહેવડાયું છે; ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઈ નથી.
- 4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિદા, તિરસ્કાર કરે છે, અને અમારા પાડોશીઓ મશકરી કરે છે.
- 5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો? તમારા કોપનો અંજિ ક્યાં સુધી સણગતો રહેશો?
- 6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો કોધ ઉતારો, જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
- 7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે અને તેના વતનને ઉજજ્જડ કર્યું છે.
- 8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત દ્રાવશો નહીં; અમારા પર તમારી દ્વારા કરવામાં વિલબ કરશો નહીં કારણ, બહુ દુર્દ્શામાં આવી પણાં છીએ.
- 9 હે અમારા તારણના દેવ, અમારી સહાય કરો, તમારા નામના મહિમાને માટે, હે દેવ અમારી રક્ષા કરો, તમારા નામની માટે, અમને અમારા પાપોની માફી આપો.
- 10 રાષ્ટ્રો શા માટે એવું કહે છે “ક્યાં છે તેઓના દેવ?” તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાયું છે, તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણો.
- 11 બંદીવાનોના નિઃસાસા તમારી આગળ પહોંચો; તમારા હાથના પરાકમે મૃત્યુંડ પામેલાઓનું રક્ષણ કરો.
- 12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે તેઓને તમે સાત ગંગી સજા કરો.
- 13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું, તમારા લોક તથા ચારાના ઘેટા પેઢી દર પેઢી તમારું સતવન કરીશું.

ગીત 80

નિર્દ્દશક માટે. રાગ: “કમળ નો કરાર.”

આસાફનું સુતિગીત.

- 1 હે ઈસ્લાએલનાં ભરવાડ, અમારી પ્રાર્થના સાંભળો; તમે તે જાણો છો જેણે યુસફના લોકોને ઘેટાની જેમ દોર્યા હતા. કરુબ દેવદૂત પર બેઠેલા હે દેવ, અમને દર્શન આપો!
- 2 તમારું સામર્થ્ય બતાવો, એકાઈમ, બિન્યામીન અને મનાશા આવો અને અમને બચાવો!

- 3 હે દેવ, અમને તમે સ્વીકારો; તમારા મુખ પર પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ઘાર થાય.
- 4 હે યહોવા, સૈન્યોના દેવ, ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
- 5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
- 6 તમે અમને અમારા પાડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અમારી હાંસી કરે છે અમારા શત્રુઓ.
- 7 હે યહોવા, સૈન્યોના દેવ અમને સંસ્થાપિત કરો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ઘાર થાય.
- 8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢ્યા અને અહીં "દ્રાક્ષાવેલો" રેખ્યો.
- 9 તમે ભૂમિને સરખી સાફ કરી, તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા, અને તેનાથી દેશ ભરપૂર થયો.
- 10 તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઈ ગયા.
- 11 તેણે પોતાની ડાળીઓ સમુક્ષ સુધી પ્રસારી અને તેની ડાંખીઓ નદી સુધી પ્રસારી.
- 12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે? કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચુંટી લે છે?
- 13 જંગલમાંથી દુક્કરો આવીને તેને ભેલાડે છે, અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
- 14 હે સૈન્યોના દેવ, તમે પાદ્ય આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો, અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
- 15 તમે તમારા જમણા હાથે જેને રોખ્યો છે, અને તમે બળવાન કર્યો છે, જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
- 16 તમારો "દ્રાક્ષાવેલા"ને કાપી નાખ્યો છે અને અભિનથી બાળી નાખ્યા છે. તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
- 17 તમારા જમણા હાથે જે માણસ છે, અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
- 18 તમારાથી અમે કદી વિમુખ થઈશું નહીં; અમને પુનર્જીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
- 19 હે સૈન્યોના દેવ યહોવા, અમને સંસ્થાપિત કરો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો જેથી અમારો ઉદ્ઘાર થાય.

ગીત 81

નિર્દશક માટે. રાગ: "ગિનિથ." આસાફના
ગીતોમાનું અકે.

- 1 દેવ, જે આપણું સામર્થ્ય છે તેમની સમક્ષ સુતિ ગાઓ, યાકુબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.

- 2 હોલક અને સિતાર અને મધુર વીજા સાથે તેમના સુતિ-ગાઓ.
- 3 રણશીંગિં વગાડો! આવો અને પુનમનો દિવસ ઉજવો, નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપર્વા; ઉમંગે ઉજવો.
- 4 ઈસ્થાઅલનાં લોકો માટે તે કાયદો છે, દેવે યાકુબને તે હુકમ આપ્યો છે.
- 5 જ્યારે તે મિસરમાંથી ઈસ્થાઅલીઓને લાવ્યાં ત્યારે દેવે યુસુફ* સાથે કરાર કર્યા; જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
- 6 દેવ કહે છે, "મેં તમારા ખભાને બોજથી મુક્ત કર્યા, મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુક્ત કર્યા.
- 7 સંકટમાં તમે મને પોકાર કર્યા, તેથી મેં તમને છોડાવ્યાં; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્રારા મેં પ્રાયુત્તર આપ્યો; તે પાણી નથી એવી ફરિયાદ કરી મરીબાહ આગળ મેં તમારી પરીક્ષા કરી."
- 8 "હે મારા લોકો, સાંભળો; હે ઈસ્થાઅલ માત્ર મારું સાંભળો; હું તમને" કડક ચેતવણી આપું છું.
- 9 અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહીં, અને ધરમાં મૂર્તિ રખવી નહીં.
- 10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું 'યહોવા' તમારો દેવ છું! તમારું મુખ ઉધાડો અને હું તેને ભરી દઈશ. હું તમને ખવડાવીશ.
- 11 પણ ના! મારા લોકો મને નહીં સાંભળે; ઈસ્થાઅલ મારી ચેતવણી સ્વીકારવા ઈચ્છતું નથી.
- 12 તેથી તેઓને, મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગ; અને તેઓની ઈચ્છા પ્રમાણે જીવવા દીધા.
- 13 મારા લોકો મારું સાંભળે તો કેવું સાંભળું! અરે, ઈસ્થાઅલ મારું અનુસરણ કરે અને મારા માર્ગો પર ચાલે તો કેવું સાંભળું!
- 14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું; અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!"
- 15 જેઓ યહોવાને વિકારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે; પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
- 16 પરંતુ તમને તેઓ, શ્રેષ્ઠ ઉર્થી તૃપ્ત કરશે; અને તમને, ખડકમાંના મધથી. સંતોષ આપશે."

ગીત 82

આસાફના સુતિગીતોમાનું.

- 1 દેવી સભામાં દેવ ન્યાયાદીશ તરીક ઉભા રહે છે.
- 2 દેવ કહે છે, "તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ દૃપા કરવાનું ચાલુ રાખશો?"

યુસુફ અહીં તેનો અર્થ છે યુસુફનો પરિવાર, ઈસ્થાઅલી લોકો.

- 3 "તમે નિર્ધન અને અનાથને ન્યાય કરો, ગરીબ અને લાચારને તેમના હક્કો પાછા મેળવવા મદદ કરો.
- 4 નિર્ધન અને લાચાર ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકુત કરો.
- 5 તેઓ જાણતા નથી કે સમજતાં નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉત્તરી રહી છે."
- 6 મેં તમને કહ્યું કે "તમે સર્વ દેવો અને પરાતપર દેવના દીકરાઓ છો.
- 7 તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની જેમ પડશો પણ."
- 8 હે દેવ ઊઠો, ને પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.

ગીત 83

આસાફના સુતુંગીતોમાનુ.

- 1 હે દેવ, તમે છાના ન રહો; હે દેવ, તમે ચૂપ ન રહો; અને નિષ્કય ન રહો.
- 2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે. અને જેઓ તમને વિકારે છે તેમણે તમારી સામે માથું ઊચું કર્યું છે.
- 3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે, અને તમારા જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
- 4 તેઓ કહે છે;"ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઈસાએલ ના નામનું સ્મરણ કરી ન રહે.
- 5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે; તેઓ તમારી વિરુદ્ધ રાષ્ટ્ર સંઘ રચે છે.
- 6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઈસાએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ.
- 7 ગલાલ, તથા આમ્રોન ને અમાલેક; અને તૂર દેશના લોકો પલિસ્તીઓ.
- 8 તેઓની સાથે આશ્ચરૂ સામેલ થાય છે; અને લોતના વંશજોને સહાય કરી છે.
- 9 તમે જે મિધાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે; તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
- 10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા, અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદૂપ થઈ.
- 11 જેમ ઓરેલ તથા ઝબે મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો; સર્વ અધિકારીઓના હાલ ઝેબા તથા સાખુના જેવા થાઓ.
- 12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે સુંદર દેવનો પ્રદેશ કબજે કરીએ.
- 13 હે મારા દેવ તેઓને વંટોળિયાની ધૂળ જેવા; અને પવનથી ઊરતાં ઝોતરાં જેવા કરો.

- 14 જેમ અણિ જંગલોને ભસ્મ કરે છે, અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
- 15 તમારા વંટોળિયાઓ અને તોઝનોથી તેમનો પીઠો કરો અને તેમને ડરાવો.
- 16 તેઓ લજ્જિત થઈ પોતાનાં મુખ સંતારે તેમ કરો. હે દેવ, તેઓ તમારું નામ શોધે.
- 17 તેઓ હમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
- 18 જેથી તેઓ જાણો કે તમારું નામ છે', યહોવા' અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાતપર દેવ છો.

ગીત 84

નિર્દ્દશક માટે. ગિતિથ સાથે ગાવા માટે
કોરાહના કુટુંબનું સુતિંગીત.

- 1 હે આકાશી સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોખામણું છે!
- 2 તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હદ્ય તથા મારો દેહ હર્થનાદ કરશે.
- 3 હે આકાશી સૈન્યોના, યહોવા મારા રાજા, મારા દેવ, ચક્રવિભૂતિઓને પોતાનું રહેવાનું સ્થાન તથા અબાબીલને પોતાનાં બચ્યાં રાખવા માળો બાંધવા તમારી વેદીની પાસેજ છે તે સ્થાન મળ્યું છે.
- 4 તમારા ધરમાં વસનારાઓને ધન્ય છે, તેઓ સદા તમારા સુતિંગીત ગાશે.
- 5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હદ્ય તમારા માર્ગો માટ ઉત્સુક છે, તેઓ ધન્ય છે.
- 6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઝતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.*
- 7 તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન, થતા આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
- 8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
- 9 હે દેવ અમારી થાલને જુઓ; તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાદ્રષ્ટિ કરો.
- 10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે.

પાનખર ... બનાવે છે અથવા "શિક્ષક આશીર્વાદો આપે છે." આ એક બીજી રીત હોય શકે એમ કહેવા માટે કે દેવ આપણા શિક્ષક છે અને તેઓ આપણને ઘણા આશીર્વાદો આપે છે.

- 11 કારણકે યહોવા દેવ સૂર્ય તથા થાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહીં.
- 12 હે સૈન્યોના યહોવા તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર.

ગીત 85

નિર્દ્દશક માટે. કોરાહના દીકરાઓનું એક સુતિગીત

- 1 હે યહોવા, તમારા દેશ ઉપર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
- 2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓના બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે.
- 3 તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનાર કોધનો અંત આવ્યો છે.
- 4 હે મારા દેવ, અમારા તારનારા, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર કોધીની ન થવું પડે.
- 5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
- 6 હે યહોવા અમને પુનઃપ્રસ્થાપિત કરો જેથી અમે, તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
- 7 તમારો પ્રેમ અને દ્યા, અમારા ઉપર રેડી દો. અને અમને તમારું તારણ પમાડો.
- 8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું. યહોવા તેના લોકોને અને તેના વજાદાર અનુયાયીઓને શાન્તિનું વચન આપે છે; પરંતુ તેઓ તેમની મૂર્ખાઈ તરફ ચાક્કસ પાછા ન વળે.
- 9 જેઓ તેમનો બય રાખે છે તેમને દેવનું રક્ષણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
- 10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળોલી છે; ન્યાયીપણા ને શાન્તિએ એકબીજાને ચુંબન કર્યું છે.
- 11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉચ્ચ જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
- 12 હા, યહોવા 'કલ્યાણ' આપશે; અને આપણો દેશ મભલભ પાક ઉપજાવશે.
- 13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલા માટે માર્ગ તેથાર કરે છે.

ગીત 86

દાઉની પ્રાર્થના.

- 1 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો; કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
- 2 મારા જીવનની રક્ષા કરો, કારણ હું તમારો વજાદાર અનુયાયી છું, હે મારા દેવ, તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.

- 3 હે યહોવા, મારા ઉપર દ્યા કરો, કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
- 4 હે યહોવા તમારા સેવકને આનંદ આપો; હે યહોવા, હે માલિક હું મારું જીવન તારા હાથમાં સોંપું છું.
- 5 હે માલિક, તમે સારા; અને ક્ષમા કરનાર છો. સહાયને માટે તમને પ્રાર્થના કરનાર ઉપર તમે બંધનમુક્ત પ્રેમ દર્શાવો..
- 6 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
- 7 મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ, ને મને ખાત્રી છે તમે મને ઉત્તર આપશો.
- 8 હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઈ નથી; અને તમારા જેવા પરાકમો પણ કોઈનાય નથી.
- 9 હે યહોવા, તમે જે રાણ્ટોનું સજેન કર્યું છે તે બધાં આવીને તમને પ્રગામ કરશે; અને તેઓ તમારા નામનું બહુમાન કરશે.
- 10 કારણ તમે મહાન દેવ છો, અને અદ્ભૂત ચમત્કારના કરનાર છો; તમેજ એકલાં દેવ છો.
- 11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો; અને હું તે માર્ગ ઉપર ચાલીશ અને સત્યનું પાલન કરીશ, તમારા નામનો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.
- 12 હે યહોવા, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સુતિ કરીશ; અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
- 13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે; તમે કબરનાં ઊડાણથી મારી રક્ષા કરી છે.
- 14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે; અને કૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
- 15 પણ હે યહોવા, તમે તો દ્યા ને કરુણાથી ભરપૂર છો; તમે કોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યાની ભરપૂર છો.
- 16 મારી તરફ ફરો, ને મારા પર દ્યા કરો; તમારા આ દાસને તમારું વરદાન આપો. મારી રક્ષા કરો, હું તમારો વજાદાર પુત્ર છું.
- 17 તમારી શુભેચ્છાના ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે, કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે, અને દિવાસો આપ્યો છે.

ગીત 87

કોરાહના પરિવારના સુતિગીતોમાંથી એક.

- 1 તેમણે તેનો પાયો પવિત્ર પર્વત ઉપર સ્થાપન કર્યો છે.
- 2 યાકૂબના સર્વ નગરો કરતા, સિયોનના દરવાજાઓને દેવ વધુ ચાહે છે.

- 3 હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
- 4 જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને ફુશમાં જન્મ્યા છે.
- 5 વળી સિયોન વિષે કહેવાશે કે: “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો; દેવે તે શહેર બાંધ્યું અને તેની સ્થાપના કરી.
- 6 યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગ્યાનો સમાવેશ થાય છે.
- 7 વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, મારું સર્વસ્વ યરૂશાલેમમાં છે.”

ગીત 88

ઓરાહના કુટુંબનું એક સુતિગીત. નિર્દેશકને – દર્દનાક
બિમારી વિષે, હેમાન એજાહીનું માસ્કીલ.

- 1 હે યહોવા, મારા તારણના દેવ, મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
- 2 હવે તમે મારી પ્રાર્થના સાંભળો, મારા પોકાર તમારે કાને ધરો.
- 3 કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, અને હું જલદીથી મૃત્યુ પામીશા.
- 4 હું કબરમાં ઊતારનાર ભેગો ગણ્યાયેલો છું, અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
- 5 હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પડેલા મૂતદેહ જેવો છું. જેઓ યુદ્ધમાં મરાયા હતો અને કબરમાં દટાયા હતો. અને હવે તમે તેઓને યાદ કરતાં નથી. તેઓ તમારી કાળજી થી દૂર રખ્યાં છે, હું તેમના જેવો છું.
- 6 તમે મને છેક નીચ્યાલા ખાડામા ઘડેલી દીધોં, તેવા ઊડાણોમાં અતિશય અંધકાર હોય છે.
- 7 મારા ઉપર તમારો કોપ અતિ ભારે છે, તમારા સર્વ મોઝાંથી હું દુઃખમાં દુલ્હિ ગયો છું;
- 8 તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે, મારાથી તેઓ દૂર નાસે છે; હું ફાંદામા ફસાઈ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
- 9 દુઃખને લીધ મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં તને સદ્ય અરજ કરી છે અને તારી સન્મુખ મેં મારા હાથ જોડ્યાં છે.
- 10 શું તમે મૂઢેલાં સમક્ષ ચમત્કારો દેખાડશો? શું તેઓ ઊઈને તારી આભારસ્તુતિ કરશે?
- 11 શું તારી કૃપા કબરમાં આહેરમાં કરવામાં આવશે? કે વિનાશમાં તારું વિશ્વાસપણું?
- 12 શું અંધકારમાં તારાં કૃત્યો જ છે આશ્રયકારક, તે વિષે, અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જગ્યાવવામાં આવે છે?
- 13 પણ હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું, દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.

- 14 હે યહોવા, તમે મને ત્યાજો છો શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
- 15 મારી યુવાવસ્થાથી જ; મારા પર દુઃખઆવી પડ્યાં છે. હું તમારા ગુસ્સાથી દુઃખી થયો છું. હું અસહાય છું.
- 16 તમારો ઉત્ત્ર કોપ મારા પર આવી પડ્યો છે, તમારા તરફથી મને ત્રાસ થાય છે; અને તેથી હું બાંંગી પડ્યો છું.
- 17 મને જગ્યાપલયની જેમ ધેરી લે છે, આખો દિવસ; અને તેઓએ મને દૂબાડી દીધો છે.
- 18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે. ફક્ત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.

ગીત 89

અથેન એજ્રાહીનું માસ્કીલ.

- 1 યહોવાની કૃપા વિષે હું સદ્ય ગાઈશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
- 2 મે કંધું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિયળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
- 3 યહોવા દેવ કહે છે, “મે મારા પસંદ કરેલા એક સાથે કરાર કર્યા છે; અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
- 4 તારા સંતાનને હું સદ્ય ટકાવી રાખીશ; અને વંશપરંપરાગત તારું સ્થિર રાજ્યાસન રાખીશ.”
- 5 પણ હે યહોવા, તમારા ચ્યામત્કારોની સુતિ આકાશો કરશે, અને પવિત્ર વ્યક્તિત્વોની સભા તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
- 6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાચે? “દૈવી” જનોમાં તેના જેવો કોણ છે?
- 7 પવિત્રજનોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે.
- 8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શક્તિશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
- 9 સમુદ્રના ગર્વ ઉપર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોકાની ઊછળતાં મોજાઓને શાંત કરે છો.
- 10 તમે એ છો જેણે રહાબને હરાવ્યો છે. તમારી શક્તિશાળી ભુજાઓએ તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
- 11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
- 12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેર્માન તમારા નામે હર્ષનાદ કરે છે.
- 13 તમારો હાથ બળવાન છે, ને તમારા ભુજામાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊચો છે, મહિમાવંત સામર્થ્યમાં.

- 14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યના પાયામાં છે; તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગત થાય છે.
- 15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાગ્યનાર લોકોને, જેઓ ચાલે છે તમારા મુખના પ્રકાશમાં.
- 16 આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊચા કરાય છે.
- 17 તમે તેમની અદ્ભૂત શક્તિ છો. અને તમારી ઈચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
- 18 હા, યહોવા અમારી ટાલ છે, અમારો ઈસાએલનો પવિત્ર રાજા છે.
- 19 તમારા ભક્તોને તમે દર્શનમાં કર્યું, "મેં સહાય કરી છે જે પરાકર્મી છે તેને; અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊચો કર્યો છે.
- 20 મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
- 21 મારો હાથ તેને ટકાવી રાખશે; અને મારો ભુજ સામર્થ્ય આપશે.
- 22 "તેનાં શત્રુઓ તેને હરાવી નહીં શકે. અને દુષ્ટ લોકો તેની ઉપર વિજય પામી શકશે નહીં.
- 23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ; અને હું તેમના દ્રેષ્ટિઓનો પણ નાશ કરીશ.
- 24 પરંતુ મારું વિશ્વાસપણું ને મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે; ને હું નિરંતર પ્રેમ રાખીશ; મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
- 25 હું, તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ; અને નદીઓ પર તેનો જમણો હાથ.
- 26 તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું રક્ષણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.
- 27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ; અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
- 28 મારી કૃપા તેના પર સદ્ય રહેશે, અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!"
- 29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ. સર્વજ્ઞા અવિનાશી દિવસો જેમ, તેના શાસનનો અંત આવશે નહીં.
- 30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહીં અનુસરે.
- 31 જો તેઓ મારા કાનૂંનોને તોડશે, અને મારી આશાઓ પ્રમાણે નહીં જીવે,
- 32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા કરીશ, અને તેમનાં અન્યાયને ફટકાથી જોઈ લઈશ.
- 33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઈ લઈશ નહીં, અને હું તેમને અવિશ્વાસુ નહીં બનું.
- 34 ના, હું મારા કરારનું ખંડન નહીં કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહીં બદલું.
- 35 મેં એકવાર તારી પવિત્રતાના, સમ ખાદ્ય છે હું દાઉદ સાથે જૂહું બોલીશ નહીં.
- 36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે, અને સૂર્યની જેમ તેમની હક્કુમત, સર્વદા ટકશે.
- 37 તેમનું શાસને મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે."
- 38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિક્તને ત્યજી દીઘાં છે, તિરસ્કાર કર્યા છે અને સજા કરી છે.
- 39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યા છે, તમે રાજ્યના મુગટને કચરામાં ફેંકી દીઘો હતો.
- 40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
- 41 માર્ગ જનારા સર્વ કોઈ તેને લૂટી લે છે, અને પાડોશીઓથી તે અપમાનિત થાય છે.
- 42 તમે તેમના વેરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે. અને તેમના સર્વ શત્રુઓને તમે, આનંદિત કર્યા છે.
- 43 તમે તેમની તલવાર નીચી પાડી છે, અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
- 44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે અને તેમનું રાજ્યાસન ઉથલાવી મુક્ષું છે.
- 45 તેના યુવાનીના દિવસો તમે ટુકડા કર્યા છે અને તમે તેને શરમાવ્યો છે.
- 46 હે યહોવા, ક્રાં સુધી આમ ચાલ્યા કરશે? શું તમે આમ છુપાઈ રહેશો સદાકાળ? શું તમારો ક્રોપ અભિની જેમ સણગાતો રહેશે?
- 47 હે યહોવા, તમે માનવજીવનને કેટલું ટૂંકું બનાવ્યું છે તે જરા સંભારો; શું તમે માનવજીતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યું છે?
- 48 છે કોઈ એવો જે જીવશે ને મરણ દેખશે નહીં? શેઓલના કબજ્ઞમાંથી પોતાનો આત્મા ક્રીણ છોડાવશે?
- 49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્રાં છે જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
- 50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
- 51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યું, અને તેઓએ તમારું પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યું!
- 52 યહોવાની સદાય સ્તુતિ કરો. આમીન તથા આમીન!

ભાગ ચોથો

ગીત 90

દેવના ભક્ત મુસાની પ્રાર્થના.

- 1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.

- 2 તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમેજ દેવ છો; તમારી શરૂઆત નથી કે અત નથી.
- 3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઈ જાઓ છો, અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરોં.
- 4 કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષાં વીતી ગયેલી કાલનાં જેવાં છે! અને રાતના એક પહોર જેવાં છે!
- 5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઈ ચૂક્યા હોઈએ છીએ કે અમે ધાસ જેવાં છીએ.
- 6 તે સવારે ખીલે છે અને વધે છે સાંજે સૂક્ષ્મ જાય છે ને પછી ચીમળાય છે.
- 7 કારણ, તમારા કોંપથી; અમારો નાશ થાય છે, અને તમારા રોષથી, અમને ત્રાસ થાય છે.
- 8 તમે અમારાં બધાં પાપો, અને અમારા ગુપ્ત પાપો બાબત પણ જાણો છો અને તે બધાં તમે જોઈ શકો છો.
- 9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિઃસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
- 10 અમારી વયના દિવસો સિંતેર વર્ષ જેટલાં છે; કેટલાંક તેમનાં બળને કારણો અંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા ગર્વ, શ્રમ, તથા દુઃખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમારો અંત આવી જાય છે.
- 11 તમારા કોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
- 12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
- 13 હું યહોવા, અમારી પાસે પાછા આવો; પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
- 14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
- 15 અમારા અગાઉનાં દુઃખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
- 16 તમારા સેવકોને ફરીથી, તમારા ચ્યામતકારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
- 17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.
- 2 હું યહોવાને કહું છું કે, "તમે મારો આશ્રય અને ગઢ છો મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું."
- 3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
- 4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે, તમને તેની પાંખો નીચે આશ્રય મળશે, તેઓ તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
- 5 હવે તું રાત્રે બીશ નહીં કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહીં.
- 6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી કે મધ્યાહને આવતી પ્રાણધાતક બિમારીથી તું ગભરાઈશ નહીં.
- 7 તારી બાજુએથી હજાર અને તારે જમણે હાથ પડશે દશહજાર, ઇન્નાં તને સ્પર્શી શકશે નહીં.
- 8 તે તમે તમારી પોતાની આંખોથી જોશો કે દુષ્ટ લોડોને કેવી સજા થાય છે!
- 9 શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો. તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગ્યા બનાવ્યાં છે.
- 10 તેથી તમારા પર કોઈ અણધારી આઝત આવશે નહીં, તમારી પાસે તમારા રહેઠાણની જગ્યાની નજીક કોઈ બિમારી આવશે નહીં.
- 11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આશા કરશે.
- 12 તેઓ તેને પોતાના હાથોમાં ધરી રખશે, જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહીં.
- 13 માર્ગમાં સિંહ મણે કે પગ પડે જેરી સાપ ઉપર, તો પણ તું સુરક્ષિત રહેશે; હા, તું તેઓને છૂટી નાંખશે પગ નીચે.
- 14 યહોવા કહે છે; "તે મને ચાહે છે તેથી હું તેને મુક્ત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
- 15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દર્દીશ; સંકટમાં હું તેની સાથે રહીશ અને તેને છોડાવીને સન્માનીશ.
- 16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું મારું તારણ તેને આપીશ."

ગીત 92

વિશ્રામવાર માટેનું સુતિળીત.

- 1 યહોવાની સુતિ કરવી અને આભાર વ્યક્ત કરવો અને તમારા નામના પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
- 2 દસ તારવાળા વાજુંત્રની સંગીતમાં અથવા સિતાર કે વીજાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
- 3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યક્ત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યક્ત કરો.

ગીત 91

- 1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની ધાયામાં રહેશે.

- 4 હે યહોવા, તમે મારા કૃત્યોથી મને આનંદ પમાઝ્યો છે; હું તમારા હાથે થયેલા ક્રામને લીધે હર્ષનાદ કરીશ.
- 5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહુન છે.
- 6 ઊડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજુ શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
- 7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગ્યાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
- 8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાતપર દેવ છો.
- 9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભંડુ કરનારાઓ, વિખેરાઈ જશે.
- 10 પણ તમે મને, જંગલી આખલાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યુ છે, જે ચેતનવંતો બનાવે.
- 11 મેં નજરે નિહાયું છે ને મારા શત્રુઓની હાર થઈ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગડી મૂકવામાં આવ્યા છે.
- 12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
- 13 યહોવાનાં મંદિરમાં જેઓને રોપવામાં આવેલ છે; તેઓ આપણા યહોવાનાં આંગણામાં ખીલી ઊઠશે.
- 14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હુશે.
- 15 તેથી તેઓ કહેશે કે, “યહોવા સારા અને પ્રમાણિક છે. તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કર્ય અન્યાયી નથી.

ગીત 93

- 1 યહોવા રાજા છે, ભવ્યતા અને સામર્થ્યને તેણે વણોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યું છે કે તે અચળ રહેશે.
- 2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે; તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
- 3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે. વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે અને પોતાના મોઝાં ઊચા ઉધાયણ્યાં છે.
- 4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શક્તિશાળી છો, અને સમુદ્રોના મોઝાઓથી વધારે બળવાન. ઉપર વાળો દેવ યહોવા, ખરેખર તાકતવર છે.
- 5 તમારો કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે, તમારું મંદિર લાંબા સમય સુધી પવિત્ર રહે.

ગીત 94

- 1 હે દેવ યહોવા, ખોટું કરનારે તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!

- 2 હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊડો અને ગર્વિષોને યોગ્ય શિક્ષા કરો.
- 3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો? કેટલી વધારે?
- 4 તેઓ અભિમાન યુક્ત વાતો કરે છે; અને સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે.
- 5 હે યહોવા, તેઓ, તમારા લોકો પર જુલમ કરે છે; અને તેઓ તમારા વારસોને દુઃખ દે છે.
- 6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે; અનાથની હત્યા કરે છે.
- 7 તેઓ કહે છે, “દેવ અમને જોતા નથી. યાદૂભના દેવ ધ્યાન આપતા નથી.”
- 8 ઓ મૂર્ખ લોકો, ડાંયાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાંયાં થશો?
- 9 જે કાનનો ઘડનાર છે, તે નહીં સાંભળે? આંખનો રચનારો જે છે તે શું નહિં જુંએ?
- 10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી? દેવ લોકોને તેઓ જે જ્ઞાને છે તે શીખવે છે.
- 11 યહોવા સારી રીતે જ્ઞાને છે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
- 12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.
- 13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા, દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
- 14 યહોવા, પોતાના લોકોને તરણેદર્શે નહીં; ને પોતાના વારસાનો ત્યાગ કરશે નહીં.
- 15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે અને સર્વ સદાચારી લોકો તેને અનુસરસે.
- 16 મારો પક્ષ લઈને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કર્મીઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
- 17 યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
- 18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
- 19 હે યહોવા, મારા મન અને હદ્ય ચિંતા અને પરેશાનીથી ભરાઈ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
- 20 હે દેવ, યોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
- 21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે; તેઓ નિર્દ્યાખને દોષિત ઠરાવીને તેમને મૃત્યુદર આપે છે.

- 22 પણ યહોવા મારા ગઢ છે, અને દેવ મારા સામર્થ્યવાન ખડક છે; અને હું તેમનો આશ્રય લઉં છું.
- 23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણા દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

ગીત 95

- 1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઈએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
- 2 તેની હજૂરમાં આભારસુતિ સાથે આવીએ; અને આપણે તેની સમક્ષ સુતિગાન કરીએ.
- 3 કારણ, યહોવા મહાન દેવ છે; તે સર્વ દેવો પર મહાન રાજી છે.
- 4 તેમનાં હાથમાં પૃથ્વીના ઊડાણો છે ; અને ઊચા પર્વતોના માલિક પણ તે છે.
- 5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ પણ બનાવી તેમના તે માલિક છે.
- 6 આવો આપણે તેને ભજુએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંઠણીયે પડીએ.
- 7 કારણ તે આપણા દેવ છે, આપણે તેના ચારાના લોક અને તેનાં હાથના ઘેટા છીએ. આજે જો તમે તેની વાળી સાંભળો તો કેવું સારું!
- 8 દેવ કહે છે, "ઇસ્તાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સામાં, પોતાના હદ્ય કઠણ કર્યા, તેવું તમે કરશો નહીં.
- 9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી, પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!"
- 10 યહોવા દેવ કહે છે, "ચાણીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કટાય્યો મેં કથ્યું; તે લોકો અવિનયી છે. તેઓએ મારા માર્ગો કદી શિષ્યાં નથી.
- 11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્વામાં વચ્ચનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહીં."

ગીત 96

- 1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ! સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ. 2 તેમના નામને ધન્યવાદ આપો; તેનું તારણ પ્રગટ કરો, દિનપ્રતિદિન.
- 3 પ્રજાઓને તેના મહિમા વિષે જગાવો અને બધા લોકોને તેમના ચયત્કારો વિષે કહો.
- 4 કારણ, યહોવાની મહાનતા અવર્જાનીય છે; અને તે બહુ સુન્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ; સર્વ "દેવોની" ઉપર છે.

- 5 મૂર્તિઓ માત્ર છે સર્વ લોકોના "દેવો," પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
- 6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચ્યમકે છે. સામર્થ્ય અને સૌન્દર્ય તેમના પવિત્ર મંદિરમાં છે.
- 7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી; તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
- 8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો, તેમની આરાધના કરવાને તેમના મંદિરે તમારા અર્પણો લઈને જાઓ.
- 9 પવિત્ર જીવનોની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો; અને ધૂંજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
- 10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, "યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે, તેથી તેનો વિનાશ થશે નહીં. બધા લોકોનો નિષ્પક્તતાથી ન્યાય કરશે.
- 11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી, સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા, હર્ષથી પોકારો.
- 12 ખેતરો અને તેમાં જે કર્દ ઊગ છે તે સર્વ સુખી થાઓ હે વનનાં સર્વ વૃક્ષો, હર્ષ સાથે ગાઓ.
- 13 પૃથ્વીનો ન્યાય કરવાને, યહોવા આવે છે; તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે; અને જગતને સત્યતાને યથાર્થપણે.

ગીત 97

- 1 યહોવા શાસન કરે છે. હે પૃથ્વી, આનંદિત થાઓ! હે દૂરનાં પ્રદેશો, સુખી થાઓ!
- 2 તેની આસપાસ મેઘ ને અંધકાર છે; ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
- 3 અણી તેમની આગળ ચાલે છે અને તેમનાં સર્વ શત્રુઓને ભર્સમ કરે છે.
- 4 તેમની વીજળીઓ; જગતને ચ્યમકાવે છે અને પ્રકાશિત કરે છે; તે જોઈને પૃથ્વી થરથર કર્યો છે.
- 5 પૃથ્વી પરના બધા પર્વતો સમગ્ર પૃથ્વીના માલિક યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
- 6 તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે; અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
- 7 મૂર્તિઓનું પૂજન કરનારા અને તેના વિષે ડંકાસ હંકનારા સહુ શરમાઓ, તેમના "દેવો" નમશે અને યહોવાની ઉપાસના કરશે.
- 8 હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું, તે સાંભળી યહૂદીયાની દિકરીઓ હરખાઈ.
- 9 હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાતપર દેવ છો; અને તમે સર્વ દેવો કરતાં શેષ છો.
- 10 હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને વિકારો, તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છો. તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.

- 11 સજજનો પર તેજ પ્રકાશ છે, જેઓના હદ્ય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
- 12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો; અને તેનાં પવિત્ર નામને માન આપો!

ગીત 98

સ્તુતિગીત.

- 1 યહોવા સમક્ષ, કોઈ એક નવું ગીત ગાઓ; એના એવાં અદ્ભૂત કાર્યો સાચે. એણે પવિત્ર બાહુબળનાં પુષ્ય પ્રતાપે; જીત પ્રાપ્ત કરી છે.
- 2 યહોવાએ પોતાની તારણ શક્તિ બતાવી છે, તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યું છે.
- 3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઈસાએલના લોકો માટે સંભાર્યા છે. બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે, આપણા દેવે તેમના લોકોન ડેવી રીતે બચાવ્યા.
- 4 હે જગતનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
- 5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો, સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
- 6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો! ભૂંગણા અને રણશિંગડા જોરથી વગાડો.
- 7 સધળા સમુકો ને ત્યાં સંચરનારા ગજી ઊકો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાઝો.
- 8 નદીઓના પ્રવાહો તાળી પાડો ને પર્વતો ગાન પોકારો; હર્ષનાદ કરો,
- 9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં, પદ્ધારે છે.

ગીત 99

- 1 યહોવા રાજા છે, પ્રજાઓ તેમની સમક્ષ કાપો, કરુંબીમ પર તે બિરાજે છે, સમગ્ર પૃથ્વી કાપો.
- 2 સિયોનમાં યહોવા મહાન છે તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
- 3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
- 4 સામર્થ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ, તમે ભલાઈનું સર્જન કર્યું છે અને તમે ભલમનસાઈ અને ન્યાય ઈસાએલમાં સ્થાપિત કર્યો છે.
- 5 આપણા દેવ યહોવા વૃદ્ધિ પામો, અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
- 6 તેમના યાજક, મૂસા હારુન અને શમુઅલે, સહાયને માટે વિનંતી કરી; ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
- 7 તેમણે મેધસંભમાંથી તેમની સાથે વાત કરી, તેઓ તેમને આપેલા તેના આદેશો અને કાયદાને અનુસર્યા.
- 8 હે યહોવા, અમારા દેવ, તેંતેઓને ઉત્તર દીધો; જો કે તેંતેઓના કામનો બદલો વાણી દીધો. તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.

- 9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો, કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.

ગીત 100

આભારસ્તુતિનું ગીત.

- 1 હે પૃથ્વીના લોકો, યહોવા સમક્ષ ગાઓ!
- 2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો.
- 3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણાને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
- 4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો, અને સત્વન કરતાં તેના આંગણામાં આવો; આભાર માનીને તેનાં નામને આશીર્વાદ આપો.
- 5 કારણ, યહોવા માયાણું છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

ગીત 101

દાઉંદનું ગીત.

- 1 હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઈશ. હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઈશ.
- 2 હે યહોવા, હું મારા ધરમાં શુદ્ધ હદ્ય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?
- 3 હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો; અને સર્વ પ્રકારની અપ્રમાણિક બાબતો; જેમાં મારો કોઈ લાગભાગ ન હોય તેને ધીકારવા મને મદદ કરો.
- 4 હું ઠાગ અને અપ્રમાણિક લોકોનો અસ્વીકાર કરીશ, અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
- 5 હું જે કોઈ તેમનાં પાંડેશીઓની વિરુદ્ધમાં ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ. જેની આંખો અને હદ્ય અભિમાનથી ભરેલાં છે; તેમને હું સહન કરીશ નહીં.
- 6 હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ અને તેઓને મારા મહેલમાં રહેવા દઈશ, ફક્ત જેઓ સંપૂર્ણ પ્રમાણિક છે તેઓ મારી સેવા કરશે.
- 7 વિશ્વાસધાતી લોકો મારા ધરમાં રહી શકશે નહીં, જૂઠું બોલનારા કોઈ મારી નજીક રહેશે નહીં.
- 8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હમેશા વિનાશ કરીશ, હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.

ગીત 102

એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુઃખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.

- 1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને કાન પર આવવા દો.

- 2 સંકટ ને દુઃખના સમયમાં તમે, મારાથી મુખ અવળું ના ફેરવો; કાન ધરીને તમે મને સાંભળો; અને તમે મને જલ્દી ઉત્તર આપો.
- 3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે, અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
- 4 મારું હદ્ય તો, ઘાસના જેવું, કપાયેલું અને ચીમાયેલું છે; તે એટલે સુધી કે; રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉ છું.
- 5 મારા ધેરા વિધાદ ને નિઃસાસાને કારણે ફક્ત ચામડીથી ઢકાયેલા હાડપિંજર જેવો હું થઈ ગયો છું.
- 6 હું દૂરના રણનાં ધુવડ જેવો થઈ ગયો છું; વિધવસની વચ્ચે જીવતા એક ધુવડ જેવો.
- 7 હું જાગતો પડ્યો રહું છું, એકાકી છાપરે બેઠેલી એકલવાયી ચક્કલીના જેવો.
- 8 મારા શત્રુ આખો દિવસ મને મહેણા મારે છે; અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
- 9 રોટલીને બદલે હું રાખ ખાઉ છું; મારા આસુ વહીને મારા ઘ્યાલામાં પડે છે;
- 10 તે તમારા રોષ તથા કોપને કારણે છે; કેમકે તમે મને ઊચો કરી નીચે ફંકી દીઘો છે.
- 11 મારા દિવસો નમતી છાયા જેવા છે; ઘાસની જેમ હું કરમાઈ ગયો.
- 12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો! પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
- 13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન ઉપર તમારી કૃપા વરસાવશો. તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
- 14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે, અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
- 15 પ્રજ્ઞાઓ બીંશે અને યહોવાના નામનો આદર કરશે, અને તેમના રજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
- 16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધશે; અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થશે!
- 17 તે લાચાર અને દુઃખીની પ્રાર્થનાઓ સાંભળશે; અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
- 18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો; જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે. અને જે લોકો હજુ જન્મ્યા નથી તે યહોવાની સ્તુતિ કરશે.
- 19 તેઓને કહો કે; દેવ સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર દૂધિ કરી છે.
- 20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે, જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુક્ત કરશે.
- 21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરશે અને તેઓ યરુશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
- 22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો તથા પૃથ્વીના રાજ્યો એકઠાં થશે.
- 23 મારા જીવનના મધ્યાહને તેમણે મારી શક્તિ ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
- 24 મેં તેમને પોકાર કર્યો, “ઓ દેવ, તમે સદા સર્વકાળ જીવનું છો! મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
- 25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાંખ્યો હતો અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
- 26 એ સર્વ પણ નાશ પામશે તમે સર્વકાળ છો; તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે; અને માણસ જૂનું વસ્ત્ર ફંકી નવું ધારણ કરે, તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
- 27 પરંતુ તમે, હે દેવ, તમે કદી બદલાતાં નથી; અને તમારા વર્પાનો કદી અંત આવશે નહીં.
- 28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે, અને તેમનાં વંશજો તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”

ગીત 103

દાઉદનું ગીત.

- 1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હદ્યથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
- 2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો! ભૂલીશ નહીં તું કે તેઓ અદ્ભુત કાર્યો તારા ભલા માટે કરે છે.
- 3 તારાં સભળાં પાપ તે માફ કરે છે; અને તારાં સર્વ રોગ મટાડે છે.
- 4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે, ને નક્કમાંથી; અને પ્રેમભરી ભલાઈ અને કૃપાથી નવાજે છે.
- 5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે; જેથી તારી યુવાની ગરુદીની જેમ તાજુ કરાય છે.
- 6 જેઓ જુલમથી હેરાન થયેલા છે, તે સૌને માટે એ ‘યહોવા’ ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
- 7 મૂસા તથા ઈસાઅલનાં લોકો સમક્ષ; તેમણે તેમના માર્ગો અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
- 8 યહોવા, દયાળું અને ક્ષમાશીલ છે. તે દયા તથા પ્રેમથી ભરપૂર છે, પણ તે ગુસ્સે થવામાં ઘીમાં છે.
- 9 યહોવા, હંમેશા ટીકા કરતાં નથી, અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
- 10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી વર્ત્યા. તેમણે આપણાને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
- 11 કારણ તેના ભક્તો પરની તેની કૃપા, જેટલું આકાશ પૃથ્વીથી ઊચુ છે તેટલી છે.
- 12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી, એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
- 13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળું છે; તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળું છે.

- 14 કારણકે તે જાણો છે બંધારણ આપણું; માત્ર ઘૂળ છીએ આપણે; અનું તે સંભારે છે.
- 15 આપણા જીવનનાં દિવસો ધાસ જેવાં છે, અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
- 16 પવન તેના પર થઈને વાય છે, ને તે ઊડી જાય છે; અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઈ જાય છે.
- 17 પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર; અનાદિકાળથી તે અનંતકાળસુધી છે. અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
- 18 જેઓ તેમનો કરાર અનુસરે છે; અને તેમની આશાઓનું પાલન કરે છે તે તેમને મદદ કરે છે.
- 19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્ય છે; ને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
- 20 તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આશાઓને સાંભળનારા; સમર્થ દૂતો, તમે યહોવાને ઘન્યવાદ આપો.
- 21 હે યહોવાનાં સૈન્યો તમો બધા, જે તેમના સેવકો છો તે જે ઈચ્છા છે તે કરો છો, તેમની સ્તુતિ કરો!
- 22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે; હે મારા આત્મા તેમની સ્તુતિ કર; દેવની સ્તુતિ કર!

ગીત 104

- 1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હે મારા યહોવા દેવ, તમે ધારા મહાન છો તમે માન અને ગૌરવના વસ્તો ધારણ કર્યા છો.
- 2 તમે પ્રકાશથી વિટળાયેલા છો, અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
- 3 તમારા આકાશી ધરનો પાયો; તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે; વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
- 4 તમે (વાયુઓને) પવનોને તમારા દૂત બનાવો છો, અને તમારા સેવકો અભિના ભડકા છો!
- 5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થીર કરી છે, જેથી તે કદી ચલિત થાય નહીં.
- 6 તમે પૃથ્વીને વસ્તની જેમ ઊડાણથી ઢાંકી છે; અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
- 7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ધસી ગયાં, તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
- 8 તમે જળાવેલી સપાટી સુધી પર્વતો ઊચા થયાં; અને ખીંચો ઊડી થઈ ગઈ.
- 9 તમે મહાસાગરને હદ બાંધી આપી; જેથી તે ઓળંગે નહીં અને પૃથ્વીને ઢાંકી ન દે.
- 10 તમે ખીંચોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
- 11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે; અને ગંધારાઓ ત્યાં તરસ છીપાવે છે.
- 12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાધે છે; અને વૃક્ષોની ડાણીઓ મધ્યે ગાયન કરે છે.
- 13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો; અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
- 14 તે હોરને માટે ધાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
- 15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી, આપણી ત્વચાને નરમ કરવા તેલ અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
- 16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો; જે તેણે રોષ્યા હત્યા ને તેઓ ધરાયેલાં છે.
- 17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાધે છે; વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
- 18 ઊચા પર્વતો પર; જંગલી બકરાને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
- 19 દેવે પવિત્ર સભાઓનાં નિર્ધાર માટે ચંદ્રનું સર્જન કર્યું, ક્ષારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
- 20 રત્નિ અને અંધકાર તમે મોકલો છો; જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
- 21 પછી સિંહનાં બચ્યાં શિકાર માટે ગર્જના કરે છે; તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
- 22 પરોછિયે તેઓ ગૂપ્યુપ્ય જંગલોમાં પાછા જાય છે; અને પોતાની ગુજાઓમાં સૂર્ય જાય છે.
- 23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે; અને સાજ સુધી પોતપોતાના કામ કરે છે.
- 24 હે યહોવા, કેટલા છે તારો સર્જનો! તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે. તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
- 25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના અને મોટા કેટલા અસંખ્ય જીવો, તેની અંદર છે!
- 26 અને જુઓ, વહાંઓ તેમાં આવ જા કરે છે; વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
- 27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો; તેથી આ સધળાં જીવો તમારી વાટ જુએ છે.
- 28 તમે જે કાંઈ આપો છો તે તેઓ વીજો છે; તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધા ઉપકારથી તૃપ્ત થાય છે.
- 29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે, તેઓનો પ્રાણ તેઓને છોડે છે અને તેઓ નબળા થઈને મૃત્યુ પામે છે તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
- 30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને ફરીથી પૃથ્વીની સપાટી; તેઓથી ભરપૂર થાય છે.

- 31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો; અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
- 32 જ્યારે યહોવા પૃથ્વી પર દૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કુપે છે; ને જ્યારે તે પર્વતોને સ્પર્શ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
- 33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છંલવા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
- 34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ કારણકે યહોવા મારા સર્વ આનંદનું ઉદ્ભવ સ્થાન છે.
- 35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! યહોવાની સ્તુતિ કર, હાલેલુયા!

ગીત 105

- 1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો. તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
- 2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ; તેમનાં ચમત્કારોનું મનન કરો ને સૌને તે જગ્યાવો.
- 3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો; યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
- 4 યહોવાને તથા તેનાં સામર્થ્યને શોધો; સદા- સર્વદા તમે તેનાં મુખને શોધો.
- 5 તેણે જે આશ્રયકારક કર્મા કર્યા છે તે; ને તેનાં ચમત્કરો ને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
- 6 તમે લોકો દેવના સેવક ઈબાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો. અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
- 7 તેઓ આપણા દેવ યહોવા છે; તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
- 8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે; અને હજાર પેઢીઓને આપેલું વચ્ચન પાણે છે.
- 9 એટલે તેમણે ઈબાહિમ સાથે કરાર કરેલો; અને તેમણે ઈસહાક પ્રત્યની પ્રતિજ્ઞા લીધલી,
- 10 તેમણે યાકૂબ માટેના કાયદા તરીકે, તેનું સ્થાપન કર્યું, અને તેમણે ઈસાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
- 11 તેમણે કંધું "કનાન દેશ હું તમને આપીશ; અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે."
- 12 જ્યારે યહોવાએ આ કંધું તેઓ; અલ્ય સંખ્યામાં હતાં તેઓ કનાન દેશમાં ફક્ત પ્રવાસીઓ તરીકે જ હતાં.
- 13 તેઓ, એક દેશથી બીજે દેશ ફરતાં; અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં.
- 14 તેમણે તેઓ પર કોઈને દુર્ઘટવહાર કરવા દીધો નહીં; દેવે રાજાઓને તેમને ઈજા નહીં કરવાની ચેતવણી આપી.

- 15 દેવ કહે છે, "તેમણે ચેતવણી આપી; મારા અભિષિકતોને રંજાડશો નહીં; ને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહીં."
- 16 તેમણે કનાનની ભૂમિમાં દુષ્કાળ આવવા દીધો; અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
- 17 પછી તેમણે તેઓની પહેલાં યૂસુફને મિસર મોકલ્યો, અને તેને ગુલામ તરીકે વેચ્યો.
- 18 બંદીખાનામાં તેઓએ; તેના પગોએ સાંકળો બાંધી, અને તેઓએ લોખંડનો પછો તેના ગળે બાંધ્યો.
- 19 દેવના શબ્દે પૂરવાર કર્યું કે તે યૂસુફ સાચો હતો ત્યાં સુધી યૂસુફ જેલમાં રહો.
- 20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
- 21 પછી રાજાએ યૂસુફને તેના મહેલનો તેમજ તેની સર્વ મિલકતનો વહીવટ સોંઘ્યો.
- 22 અને યૂસુફ રાજાના અમલદારો ને સૂચનાઓ આપી વૃદ્ધ નતાઓને સમજાવ્યું.
- 23 પછી યાકૂબ મિસરમાં આવ્યો; અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
- 24 દેવે તેમની વૃદ્ધિ કરી, અને તેમના દુશમનો કરતાં વધારે બળવાન કર્યા.
- 25 દેવે મિસરવાસીઓને ઈસાએલીઓ વિરુદ્ધ કર્યા; અને મિસરવાસીઓએ તેનો વિકાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
- 26 પણ યહોવાએ મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
- 27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા; ભયાવહ ચમત્કાર કરવા.
- 28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઠ અંધકાર મોકલ્યો, છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
- 29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફરવી દીધું; અને સર્વ માછલાં મારી નાખ્યા.
- 30 પછી દેશ પર અસંખ્ય દેડક ચઢી આવ્યાં; તે રાજાનાં ખાનગી ઓરડામાં ધૂસી ગયાં.
- 31 યહોવાએ આદેશ આપ્યો, અને જૂ'ઓ મિસરમાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઈ ગઈ.
- 32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યાં; અને વીજળીની સાથે ઘસી ગયા અણિ.
- 33 તેમણે તેઓનાં દ્રાક્ષવેલાઓ તથા અંજુરીના ઝડોણોનો નાશ કર્યો. અને તેમની આપી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાણ્યાં.
- 34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીધોડા તથા તીડો આવ્યા.
- 35 તેઓ તેઓનાં દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.

- 36 તેઓનાં દેશમાના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
- 37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે, સુરક્ષિત રીતે પાછા લઈ આવ્યાં અને તેઓમાંથી કોઈ ગબડ્યું કે પણ્યું નહીં.
- 38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પાખ્યાં; કારણકે તેઓ તેમનાથી ત્રાસ પાખ્યાં હતાં.
- 39 યહોવાએ મેધસ્તંભથી તેઓ પર છાયા કરી; અને રાતે પ્રકાશ માટે અભિસંસ્ત આપ્યો.
- 40 જ્યારે તેઓએ માંગ્યું ત્યાર લાવરિઓ લાવ્યાં; અને આકાશમાંથી માના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
- 41 તેમણે ખડક તોડ્યો ત્યાં પાણી નીકળ્યું; જે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા માંડ્યું.
- 42 તેમણે પોતાના સેવક ઈબાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.
- 43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યાં.
- 44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી; અનેતે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસા રૂપે મળી.
- 45 તેઓ ભરોસો કરે અને તેના કાયદાઓનું પાલન કરે અને તેના માર્ગાને અનુસરે તેથી યહોવાએ આ કર્યું; હાલેલૂયા!

ગીત 106

- 1 હાલેલૂયા! યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે, તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
- 2 યહોવાના મહાન કૃત્યો કોણ વર્ષાવી શકે? તેમની સંપૂર્ણ સુત્તિ કોણ કરી શકે?
- 3 ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હુમેશા જે સાચું છે તે જ કરે છે.
- 4 હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો; ત્યારે મને યાદ રાખશો, અને; તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
- 5 જર્થી તમારાં પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં; તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણ્યું; અને તમારા વારસોની સાથે હું હર્ષનાદ કરું.
- 6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યું છે; અમે અન્યાય કર્યાં છે, અમે દુષ્ટતા કરી છે.
- 7 મિસરમાના તમારાં ચ્યમતકારોમાંથી અમારા પિતૃઓ કાઈ શિખ્યાં નહીં, અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા, તેઓએ રતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બડ પોકાર્યું.
- 8 તો પણ, પોતાના નામની માટે તેણે તેમને તાર્યા; અને તેઓને પોતાના પરાકરમ દેખાડવાનું માટે.
- 9 તે દેવે રતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઈ ગયો, અને તેણે અમારા પિતૃઓને ઊડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
- 10 તેમણે તેઓને, વેરીઓના હાથમાંથી તાર્યા; અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
- 11 તેઓનાં દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાનો એકેય બચ્યો નહીં સૌ દૂબી ગયાં.
- 12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રશંસામાં સુતિ ગાઈ.
- 13 તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયાં; તેમની સલાહ સાભળવા, ધીરજ રાખી નહીં.
- 14 રણમાં તેઓ પોતાની ઈચ્છાઓને આધીન થયા, અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
- 15 યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી; પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
- 16 તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષા કરી, તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઈર્ષા કરી.
- 17 તેથી પૃથ્વીએ મોં ખોલ્યું અને; દાથાન, અભીરામ અને તેમના સમૂહને ગળી ગઈ.
- 18 આકાશમાંથી અક્ષિ તેમની છાવણીમાં આવ્યો, અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
- 19 તેઓએ સિનાઈ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો; ને એ મૂર્તિની પૂજા કરી.
- 20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા, ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા સામે!
- 21 આ રીત તેઓ, પોતાના ચ્યમતકારિક કાર્યા વડે મિસરને બચાવનાર દેવને ભૂલી ગયાં!
- 22 તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો ને પોતાના તારણને, ભૂલી ગયાં.”
- 23 યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા, દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો. અને મૂસાએ તેમને રોક્યા, જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.*
- 24 તેમણે તે મનોહર દેશને તુચ્છ ગળ્યો; અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહીં.
- 25 તેઓ પોતાના મંડપોમાં જઈને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી, ને યહોવાના આદેશોનો અનાદર કર્યો.
- 26 તેથી યહોવાએ રેતીનાં રણમાં તેમને મારી નાખવા સમ લીધા.
- 27 તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે, અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.
- 28 પછી પેઓરમાં આપણા પિતૃઓ, બાબાલનાં ભજનમાં જોડાયા; એટલું નહીં પણ તેમણે મૃત્તાત્માઓને શત્રુઓના સેનિકો (દેવના કોપ) થી નગર (ઈસાએલ) ની રક્ષા કરી.

અને ...કર્યો મૂળ પ્રમાણે: દેવે કંધું કે તેમાં તેમનો વિનાશ કરશે. પણ મૂસા, દેવના પસંદ કરેલો વચ્ચે પઢ્યો અને દેવનો વિનાશ કરવા માટેના કોપને પાછો હટાવ્યો. આ બતાવે છે કે મૂસા એક સેનિક જીવો હતો જે નગરની દીવાલની બાખાલમાં ઊભા રહીને શત્રુઓના સેનિકો (દેવના કોપ) થી નગર (ઈસાએલ) ની રક્ષા કરી.

- અર્પજુ કર્યા અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
- 29 યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
- 30 ફિનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી; તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
- 31 પેઢી દરપેઢી સર્વકણપર્યંત ન્યાયીપજાને અર્થે તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.
- 32 મરીબામાં ઈશ્વાએલીઓએ દેવને કોઘિત કર્યા; મૂસાએ તેઓને કારણે કંઈક ખરાબ કર્યું.
- 33 તેઓના વર્તનને કારણે મૂસા ગુરસે થયા હતાં; અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.
- 34 યહોવાએ, કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી; તેઓએ તેમનો નાશ કર્યો નહીં.
- 35 પજ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા; અને તેઓના દુષ્ટ માર્ગો અપનાયા.
- 36 તેઓએ તેઓની જગ મૂર્તિઓની પૂજા કરી; અને તે તેઓને ફાંદા રૂપ થઈ પડ્યું.
- 37 વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દિકરાઓ અને દિકરીઓના બલિદાનો આપ્યા.
- 38 તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિર્દ્દીપ લોહી વહેવડાયું; અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યું, આમ દેશ લોહીથી ભષ થયો.
- 39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની દ્રષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
- 40 તેથી યહોવાનો કોપ, પોતાના લોકો સામે સળગી ઉઠ્યો; અને પોતાના વારસોથી કટાળી ગયા, ને તેમના પર ધૂણ થઈ.
- 41 તેમણે તેઓને, વિદેશીઓના હાથમા સોંપી દીધાં; અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યું.
- 42 તેઓના શત્રુઓએ પજ તેઓને કયાઝા; અને, તેઓના હાથ નીચે પડીને તેઓ તાબદાર થયા.
- 43 વારંવાર યહોવાએ મુકૃત કર્યા ગુલામીમાંથી; છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું; અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
- 44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફકો તરફ તેમણે ધ્યાન આપ્યું.
- 45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને તેઓ પ્રતિ, તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
- 46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવ તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવાવી.
- 47 હે યહોવા, અમારા દેવ, અમને તાર; પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો; જેથી અમે તમારા પવિત્રનામનો આભાર માનીએ, અને સુતિ ગાઈને તમારો જ્યયજ્યકાર કરીએ.

- 48 હે ઈશ્વાએલના દેવ યહોવા, અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ; સર્વ લોકો આમીન કહી, અને યહોવાની સ્તુતિ કરો!

ભાગ પાંચમો

ગીત 107

- 1 યહોવાનો આભાર માનો કારણ તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકણપર્યંત ટકે છે.
- 2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઈએ, કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
- 3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂબી ખૂબોથી અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષીણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
- 4 કેટલાંક ઉજ્જવ માર્ગ રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.
- 5 તેઓ ભૂખ્યાં અને તરસ્યાં હતાં, અને નબળા પડી રહ્યાં હતાં.
- 6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો, અને યહોવાએ તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
- 7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
- 8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદ્ભુત કાર્યો માટે ભલે તેઓ દેવનો આભાર માને.
- 9 કારણકે તે તરસ્યા આત્માને સંતોષે છે, ને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૂપ કરે છે.
- 10 કારણ કે તેઓએ દેવના આદેશ સામે બંડ પોકાર્યું હતું તેમણે પરાતપર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
- 11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સણિયા પાછળ તાણું મારીને કેદ કરવામાં આવ્યાં હતાં.
- 12 તેઓ તેમની મુશ્કેલીઓથી નરમ થઈ ગયાં છે. તેઓ લથડીને નીચે પડ્યાં, છતાં તેમને મદદ કરનાર કોઈ ન હતું.
- 13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો; એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા.
- 14 તે તેઓને અંધકાર અને મરણશાયામાંથી કાઢી લાવ્યાં; અને બંધન તોડી નાખ્યા.
- 15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
- 16 તેણે બંદીખાનાના પિત્રણના દરવાજા તોડી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો પજ તોડી નાખી.
- 17 મૂર્ખ લોકો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી; સંકટમાં આવી પડે છે.
- 18 સર્વ પ્રકારના ખોશકથી, તેઓના જીવ કટાળી જાય છે; અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.

- 19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે; અને યહોવા તેઓને દુઃખમાંથી તારે છે.
- 20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે, અને તેણે તેઓને કબરમાંથી ઉગાર્યા છે.
- 21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક ક્રાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
- 22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો. યહોવાના ક્રાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.
- 23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુઅથી બીજુ બાજુ સુધી નૌકા વિહાર કરે છે અને સમુદ્ર પર ક્રાંતિલ્યનું ક્રમ કરે છે,
- 24 તેઓ પણ દેવની ક્રાર્યશક્તિ નિહાળે છે; અને અદ્ભૂત કૃત્યો ઊડાણોમાં જુએ છે.
- 25 તે આશા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે; તેથી મોજાઓ ઊચા ઊછળે છે.
- 26 મોજા સાથે તેઓના વહાણો ઊચા ઊચકાય છે; અને પાછા ઊડાણોમાં પટકાય છે; લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
- 27 તેઓ પીધલાની જેમ આમતેમ ડોલતા લથડે છે; અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
- 28 તેઓ સંકટમાં હોય ત્યારે પોકારે છે; 'યહોવાને', તે તેઓને દુઃખમાંથી કાઢે છે.
- 29 તેણે તોફાનને અટકાવ્યા તથા મોજાઓને શાંત કર્યા છે.
- 30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
- 31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદ્ભૂત ક્રાર્યો માટે; તેઓને યહોવાનો આભાર માનવા દો.
- 32 યહોવાને મોટા મનાવો લોકોની સભામાં; અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.
- 33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે; અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
- 34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
- 35 વળી તે રણમાં સરોવર કરે છે; ઉત્પન્ન અને કોરી ભૂમિમાં તે ઝરણાઓને વહેતા કરે છે
- 36 અને ત્યાં ભૂખ્યાં જનોને વસવાં લાવે છે; જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધ્ય છે.
- 37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષાવાડીઓમા રોપણી કરીને; તેઓ તેનાં ફળની ઉપજ ઉત્પન્ન કરે છે.
- 38 તે આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; અને હોર-દોંખર પણ વધે છે.

- 39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તિ જુલ્બો વિપત્તિઓ અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
- 40 અમીર-ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે, અને રખડતાં કરી દે છે માર્ગ વિનાના રણમાં.
- 41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુઃખોમાંથી બહાર કાઢ્યા અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘટાંના ટોળાઓની જેમ વધી હતી.
- 42 તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
- 43 જેનામાં શાશપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

ગીત 108

દાઉદ નું ગીત.

- 1 હે દેવ, મેં મારા હઠય અને આત્માને તૈયાર કર્યા છે, હું તમારી સ્તુતિ કરીશ ગીતો ગાઈશ અને તમારી સમક્ષ ખુશ થઈશ.
- 2 જાગો, ઓ વીણા અને સારંગી; ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
- 3 "હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઈશ."
- 4 કારણ, તમારી કૃપા આકાશ કરતાંય મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
- 5 હે દેવ, સ્વર્ગથીય ઊચા ઊઠો! ભલે સમગ્ર દુનિયા તમારું ગોરવ જુએ!
- 6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસામર્થ્ય સહિત આવો અને તેમને ઉગારો.
- 7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, "હું યુદ્ધ જીતીશ અને આનંદ પામશે હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુક્કોથની ખીંચ આપીશ.
- 8 ગિલયાદ અને મનાશા પણ મારા છે; એજાઈમ માથાનો ટોપ છે અને, યહૂદીયા મારો રાજદદ છે.
- 9 મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે. અદોમ મારા ખાસડા ઊચકી લાવશે, હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!"
- 10 મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? અને મને અદોમમાં કોણ દોરી જશે.
- 11 હે યહોવા, શું તમે અમને તરણોઝાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
- 12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, અમને મદદ કરો લોકો તરફની મદદ નકામી છે!
- 13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચરી નાંખશે.

ગીત 109

નિર્દશક માટે. દાઉદના સુતિગીતામાંનું એક

- 1 હે મારા દેવ, તમે તે એક છો જેની હું સુતિ કરું છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
- 2 કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આસેપો મૂકે છે; તેઓ મારી સામે પોતાની જીબે જ જૂઠું બોલે છે.
- 3 તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઈ કરવી છે.
- 4 તેઓ મારી પ્રીતિનાય બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના કરું છું.
- 5 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે; અને મારી પ્રીતિને બદલે તેઓ દ્રેષ્ટ કરે છે.
- 6 મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો. અને તેને એક અપ્રમાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
- 7 અને તેનો મુક્કદમો ચાલે ત્યારે ભલે તેને 'દોષી' હરાવાય, અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
- 8 તેનાં આયુષ્યનાં વર્ષો થોડાં અને ટૂંકા થાઓ; અને તેનું પદ કામ લેવાને બીજાં આગળ આવો.
- 9 તેમના સંતાનો પિતૃવિહોણ થાઓ; અને તેની પત્ની વિધવા થાઓ.
- 10 તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માંગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરેમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
- 11 જોરજુલમથી લોણાદાર તેમનું બધું લઈ જાઓ; તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂટી જાઓ.
- 12 તેના પર દ્યા દાખવનાર કોઈ ન રહો;
- 13 ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય! અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણ ભૂસાઈ જાય!
- 14 યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો! માતાપિતાના પાપની તેને સજા મળો! અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડ કાન ન કરે!
- 15 તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉઝેડી નાખવામાં આવે!
- 16 કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળું બનવા ના પાડી છે; અને ગરીબોની સત્તામણી કરી છે; અને ભગ્રહદ્યી માણસોને મારી નાઘ્યા છે.
- 17 બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઈને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
- 18 શાપોને તેના વસ્તો થવા દો! શાપોને તેનું પીવાનું પાણી થવા દો! શાપોને તેના શરીર પરનું તેલ થવા દો.

- 19 પહેરવાના વસ્તની જેમ તે તેને ઢાકનાર થાઓ; અને કમરબંધની જેમ તે સદા વીટળાઈ રહો.
- 20 જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિઝુદ્ધ બોલનાર છે; તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
- 21 પણ હે યહોવા દેવ, તમે મારા માલિક છો! ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો; તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
- 22 હું ગરીબ છું ને તંગી અનુભવું છું; ને મારું હુદય ઉત્ત સુધી ધાયલ થયું છે.
- 23 મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે. મને તીડની જેમ ખંખેરી નાઘ્યો હોય તેવું લાગે છે.
- 24 ઉપવાસથી મારાં ઘૂંઠણ નબળા પડ્યાં છે; અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
- 25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું; જ્યારે મને જુઓ છે ત્યારે પોતાના માથા હલાવે છે.
- 26 હે યહોવા, મારા દેવ, મને મદદ કરો; મને ઉગારો, તમે કૃપાળું અને પ્રેમાળ છો.
- 27 જેથી હે યહોવા, આ તારે હાથ તેં જ કર્યું છે એમ તે સર્વ લોકો જાણે.
- 28 તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહીં; કારણ તમે મને આશીર્વાદ આપો છો; જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
- 29 મારા શત્રુઓ વસ્તની જેમ લાજથી ઢંકાઈ જાઓ! અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઈ જાઓ.
- 30 પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ; અને હું તેમની ઘણા લોકોમાં સુતિ ગાઈશ.
- 31 કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે; અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે; તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.

ગીત 110

દાઉદનું ગીત.

- 1 યહોવાએ મારા ઘણીને કર્યું, "જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું, ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ."
- 2 યહોવા સિયોનમાંથી તારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તારા શત્રુઓ પર રાજ કર.
- 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઈચ્છાશે. સવારે તેં તારા પવિત્ર વસો ઘારણ કરેલા છે. તારી યુવાવસ્થાનું જોર તને દોરવે છે.
- 4 યહોવાએ પ્રતિજ્ઞા કરી, "તું મલ્ખીસંદેકની જેમ, સદાને માટે યાજક છે; તેમનું આ વચન તે કદી રદ્બાતલ કરશે નહીં."
- 5 તારી રક્ષા માટે, તારી પાસે માલિક ઊભા છે; તે ઘણા રાજાઓનો પોતાના કોધને દિવસે નાશ કરશે.

- 6 તે સર્વ પ્રજાઓને શિક્ષા કરશે; અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે, અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂટી નાખશે.
- 7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે; નવી તાજગી સાથે પોતાનું માથું ઊચુ કરશે.

ગીત 111

- 1 હાલેલૂયા! ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
- 2 યહોવાના કાર્યો મહાન છે; લોકોને જે સારી વસ્તુઓ જોઈએ છે જે દેવ પાસેથી આવે છે.
- 3 તેના કાર્યો યશસ્વી અને અદ્ભૂત છે. અને તેની નિષ્પક્તિના સદાકાળ ટકે છે.
- 4 દેવ તેના ચયમન્તકારોને અવિસ્મરણીય સમૃતિ બનાવી દીધાં છે. યહોવા દયાળું અને કૃપાળું છે.
- 5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે, ને તે પોતાના વચ્ચનોને કદી ભૂલતા નથી.
- 6 તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે. અને આ રીતે તેમને તેના સામર્થ્યભર્યા કૃત્યો દેખાયા છે.
- 7 તેમણે જે કાંઈ કર્યું છે તેમાં સત્યતા ને ન્યાય છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસને યોગ્ય છે.
- 8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદ્ભવ્યા છે; તેઓ સદાને માટે અચળ છે.
- 9 દેવ તેના લોકોને સ્વતંત્રતા આપી છે. અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
- 10 દેવ માટે માન અને ડરથી ડાહપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાઢા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

ગીત 112

- 1 યહોવાની સ્તુતિ થાઓ! જે દેવનો ડર શાખે છે અને માન આપે છે તે ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
- 2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે; અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
- 3 તેમના ઘરમાં ઘનદોલતની વૃદ્ધિ થશે; અને તેમનું ન્યાયીપણું કદી વિસરાશે નહીં.
- 4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓને માટે દેવ ભલા, દયાળું અને કૃપાળું છે.
- 5 વ્યક્તિ માટે દયાળું અને ઉદાર થવું તે સારું છે, વ્યક્તિ માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
- 6 તે વ્યક્તિ કદી પડશે નહીં તેથી સારા માણસનું સ્મરણ રહેશે સર્વકાળ.

- 7 તે ખરાબ સમાચારથી ડરતો નથી; અને શું થશે તેની પણ થિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રદ્ર રહે છે.
- 8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે; તેથી તે ડરશે નહીં. શત્રુઓ પર જીત મેળવશે.
- 9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે, અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
- 10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે, તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે; અને દુષ્ટણા થઈ જશે, દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

ગીત 113

- 1 યહોવાની સ્તુતિ કરો, હે યહોવાના સેવકો; સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો.
- 2 યહોવાનું નામ આ સમયથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ;
- 3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
- 4 યહોવા, સર્વ પ્રજાઓ પર સર્વોપરી અવિકારી છે; અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
- 5 આપણા દેવ યહોવા જેવો છે કોણા? જે ઉચ્ચયસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
- 6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊચા છે. પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવું પડે.
- 7 રંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કયરાનાં ઢગલામાંથી.
- 8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે; રાજકુમારોની મદદે.
- 9 તે નિઃસંતાન સી ને સંતાન આપે છે; અને સુખી થશે માતા, હાલેલૂઆ! ભલે યહોવાની સ્તુતિ થાઓ.

ગીત 114

- 1 જ્યારે ઈસ્થાએલીઓ વર્ષો પૂર્વે મિસરમાંથી નીકળ્યાં, તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
- 2 પછી યહૂદીયા દેવનું નવું ધર અને ઈસ્થાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
- 3 તેઓને આવતા જોઈને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ ગયો; યદંન નદી પાછી વળી અને દૂર દોડી ગઈ.
- 4 પર્વતો ઘેટાઓની માફક કૂદા અને હુગરો ગાડરની જેમ કૂદ્યા.
- 5 અરે લાલ સમુદ્ર! તને શું થઈ ગયું કે તું બે ભાગમાં વહેંચાઈ ગયો? યદંન નદી, શું થયું તારા પાણીનું? શા માટે તમે પાણા હઠી ગયા?

- 6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? અને કુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
- 7 હે પૃથ્વી, માલિક સમક્ષ, યાકૂબના યહોવા દેવની સમક્ષ તું થરથર કાંપ.
- 8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યુ તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

ગીત 115

- 1 હે યહોવા, અમારું નહીં, તમારું નામ થાઓ મહિમાવાન; તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
- 2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે: "તમારા દેવ ક્યાં છે?"
- 3 કારણ અમારા દેવ સ્વર્ગમા છે અને તેમની ઈચ્છા પ્રમાણે ક્રાંતી કરે છે.
- 4 તેઓના દેવો સોના ચાંદીના જ છે; અને તે ઘડવાનું ક્રામ પણ છે તે માણસોના હાથનું.
- 5 મોંઢા છે તેઓને છતાં બોલતાં નથી; આંખો છે તેઓને છતાં જોઈ શકતાં નથી.
- 6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે પણ તેઓ સુંધરી શકતા નથી.
- 7 હાથ છે તેઓને પણ ઉપયોગ કરતાં નથી; પગ છે તેઓને છતાં તે ચાલી શકતા નથી. પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
- 8 જેઓ તેમને બનાવશે, અને વિશ્વાસ કરશે તેઓ બધાં જલ્દી તેમના જેવા ન્યાયી થશે.
- 9 ઓ ઈસાએલ, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો. તે તારો તારણહાર છે અને તે તારી ફાલ છે.
- 10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો, તે તમારો તારણહાર અને તમારી ફાલ છે.
- 11 ઓ યહોવાના અનુયાયીઓ તેમનામાં તમારો વિશ્વાસ રાખો, તે તમારા મદદગાર ને ફાલ છે.
- 12 યહોવાએ આપણાને સંભાર્યા છે, તે આપણાને આશીર્વાદાપણે, ઈસાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપણે.
- 13 હે યહોવાના ભક્તો, નાનામોટાં સૌને તે આશીર્વાદ આપણે.
- 14 યહોવા ખચીત તમારા છોકરાંની તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
- 15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપણે.
- 16 આકાશો તો યહોવાના પોતાના છે, પણ પૃથ્વી આપી છે તેણે માણસોને.
- 17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઈ શકતા.
- 18 પણ આજથી અમે સર્વકાળપર્યત યહોવાની સ્તુતિ કરીશું. હાલેલુયા! યહોવાની સ્તુતિ થાઓ.

ગીત 116

- 1 યહોવા જ્યારે મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તે મને ગમે છે.
- 2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે; માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યત કરીશ.
- 3 હું સપડાઈ ગયો હતો મરણની જાળમાં; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને મળ્યાં હતાં સંકટ ને શોક.
- 4 ત્યારે મેં પોકાર કર્યો યહોવાના નામનો, "હે યહોવા મને બચાવો."
- 5 યહોવા ન્યાયી અને કૃપાળું છે; આપણા દેવ ખરેખર માયાળું છે.
- 6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે; હું છંક લાયાર બની ગયો તો; ત્યારે તેણે મને બચાવ્યો તો.
- 7 હે મારા આત્મા, વિશ્રાભ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે;
- 8 તમે મારા પ્રાણને મૃત્યુથી અને મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી ઉદારતાથી બચાવ્યાં છે.
- 9 હું જીવલોકમાં જીવતો રહીશ; અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
- 10 "હું ધાર્ષો દુઃખી હું," મેં જ્યારે એમ કંધું ત્યારે પણ મેં તે માનવાનું ચાલુ રાખ્યું છે.
- 11 મારા ગભરાટમાં મેં હકી દીધું હતું કે, "સર્વ માણસો જૂઠ છે."
- 12 યહોવાના મારાં પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને શોબદલો આપું?
- 13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે હું ગ્રાસ્કારસનું અર્પણ લઈ જઈશ; અને હું દેવના નામે પોકારીશ.
- 14 મેં જે માનતા લીધી છે યહોવા સમક્ષ, તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
- 15 યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તનું મૃત્યુ કિંમતી છે.
- 16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુક્તિ આપી છે, ઓ યહોવા, ખરેખર હું તમારો દાસ; તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
- 17 હું તમારી માટે આભાર અર્પણ લઈ આવીશ, અને હું યહોવાના નામે પોકારીશ.
- 18 મેં યહોવા સમક્ષ લીધેલી પ્રતિશ્શાઓ; તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
- 19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના મંદિરમાં સ્તુતિ થાઓ, યહોવાની સ્તુતિ થાઓ.

ગીત 117

- 1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળો યહોવાની સ્તુતિ કરો.
- 2 કારણકે તેમની અનહદ કૃપા આપણા પર છે; દેવની સત્યતા ટકે છે સર્વકાળ; યહોવાની સ્તુતિ હો.

ગીત 118

- 1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
- 2 ઈસાએલના પ્રજાજનો, તેમની સુતિ કરો આ શબ્દોથી, "તેમની કૃપા સદાય રહે છે."
- 3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ, "તેમનો સાચો પ્રેમ સદાય રહે છે."
- 4 યહોવાના અન્ય ભક્તો, તમે પણ કહો કે; "તેમનો સાચો પ્રેમ સદાય રહે છે."
- 5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી; તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
- 6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
- 7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે; તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઈશ.
- 8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં; યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ.
- 9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં; યહોવામાં આશ્રય મેળવવો તે વધુ સારો.
- 10 બધી પ્રજાઓએ મને ઘરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઈને તેમને પરાજીત કરીશ.
- 11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો; પણ યહોવાના નામ ઉપર હું તેમને હરાવીશ.
- 12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સણગતાં કાંઠાની જેમ તુરંતજ ઓલવાઈ ગયા. હું તેમને યહોવાનું નામ લઈને હરાવીશ.
- 13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી.
- 14 પણ યહોવા મારું સામર્થ્ય છે ને વિજયગીત છે; તે જ મારું તારણ થયા છે.
- 15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે, યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
- 16 યહોવાનો જમણો હાથ ઊચો થયેલો છે; અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
- 17 હું મરીશ નહીં પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યાને ઉચ્ચારીશ.
- 18 યહોવાએ મને ભારે શિક્ષા કરી, પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
- 19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉધાડો, હું તેમા થઈને જઈશ; અને યહોવાનો આભાર માનીશ.
- 20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે; યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
- 21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે; અને મારો ઉદ્ઘાર કર્યો, હું તમારો આભાર માનું છું.

- 22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
- 23 આ કાર્ય તો યહોવાથી થયું છે; આપણી દૃષ્ટિમાં તે આશ્ર્યકારક છે.
- 24 યહોવાએ આપણાને આ દિવસ આપ્યો છે; આપણે આનંદોત્સવ કરીએ.
- 25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને ઉગાર, હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
- 26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; દેવના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
- 27 યહોવા દેવ છે અને તે અમારો પકાશ છે. બલિદાન માટે બાંધવા વેટાને વેદીના શિંગ તરફ લઈ જતાં ઉત્સવના સરધસમાં તમે બધા જોડાઈ જાઓ.
- 28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ; તમે મારા દેવ છો, હું તમને મોટા મનાવીશ.
- 29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીત 119

આલેઝ

- 1 જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
- 2 જેઓ પૂર્ણ હદ્યથી યહોવાની શોધ કરે છે અને હમેશા યહોવાના કરારનું પાલન કરે છે, તેઓ સર્વ આશીર્વાદિત છે.
- 3 તેઓ કટી ખરાબ ક્રામ કરતા નથી, અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેરીએ ચાલે છે.
- 4 તમે અમને નિયમો આપ્યાં છે, તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કર્યું છે.
- 5 હું મારા કાર્યો તમારા કાન્દુનો સાથે સુમેળમાં રહે તેમ ઈરથું છું.
- 6 પછી જ્યારે હું તમારા બધાં આદેશોનો અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
- 7 તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઈશ; ત્યારે શુદ્ધ હદ્યથી હું તમારો આભાર માનીશ.
- 8 હું તમારા કાયદાઓને અનુસરીશ, તેથી કૃપા કરી મને છોડ્શો નહીં!!

બથ

- 9 યુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા હુકમોને અનુસરીને તે કરી શકે છે.
- 10 મે મારા ખરા હદ્યથી સેવ્યો છે તને; તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
- 11 મેં તમારા શબ્દો કાળજી પૂર્વક મારા હદ્યમા રાખી મૂક્યા છે; જેથી, હું ફરી પાપ ન કરું તમારી વિરુદ્ધ.

- 12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને મને તમારા કાયદાઓ શીખવો.
- 13 હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
- 14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં મને વધુ આનંદ મળે છે.
- 15 હું તમારા કાયદાઓની ચર્ચા કરું છું, હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
- 16 હું તમારા કાયદાઓને માનું છું હું તેમને ભૂલી જઈશ નહીં.

ગિમેલ

- 17 મને તમારા સેવકને બદલો આપો; જેથી હું જીવિત રહું અને તમારા આદેશનું પાલન કરું.
- 18 તમારા નિયમશાસ્ત્રની આશ્ર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉધાડો.
- 19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું; તારી આજાઓ મારાથી સંતાડ નહીં.
- 20 મારું હદ્ય તમારા કાયદાઓ માટે હુંમેશા તીવ્ર ઝંખના કરે છે.
- 21 તમે ઉદ્ઘત લોકોને જેઓ તમારી આજાઓને માનતા નથી. તેમને ઠપકો આપો છો.
- 22 મહેણાં ને અપમાનને મારાથી દૂર કરો; કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
- 23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા મારી વિરુદ્ધ બોલતા હતાં; પણ તારા સેવકે તમારા નિયમોનું મનન તો કર્યું છે.
- 24 હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.

દાલથ

- 25 હું મૃત્યુ પામવાની તેવારીમાં છું. જેમ તમે વચન આપ્યું હતું તે પ્રમાણે તમે મારું પુનરૂત્થાન કરો.
- 26 મેં મારા માર્ગાં પ્રગટ કર્યાં; અને તે મને ઉત્તર આપ્યો; મને તારા નિયમો શીખવ.
- 27 તમારા કાનુનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
- 28 વ્યથાને કારણે, હું રૂદ્ધ કરું છું, દુઃખને કારણે મારું હદ્ય ભારે થઈ ગયું છે, તમે આપેલા વચન પ્રમાણે મારું પુનરૂત્થાન કરો.
- 29 તમે મને પ્રત્યેક ભૂંડાઈથી દૂર રાખો; કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
- 30 તમને વફાદાર થવાનું મેં પસંદ કર્યું છે. તમારા શાશ્વત નિર્ણયો વિષે વિચારવાનું મેં સતત ચાલું રાખ્યું છે.
- 31 હું વળગી રહ્યો છું તમારી આજાઓને; મારે લજિજિત થવું પડે એવું થવા ન દેશો.

- 32 તમારી આજાઓના માર્ગમાં હું જીવન જીવીશ; કારણ તમે મારી સમજશક્તિ ખીલવો છો અને મારા હદ્યને પ્રકુલ્પિત કરો છો.

૩

- 33 હે યહોવા, તમારા કાયદા મને શીખવો; અને પછી હું તેને ક્રાણજીપૂર્વક અનુસરીશ.
- 34 મને સમજાણ આપો, એટલે હું તમારા નિયમ પાણીશ; હા, મારા અંત:કરણથી માનીશ.
- 35 મને તમારા આદેશોના માર્ગ દોરો. કારણકે હું તેમાં આનંદ માણું છું.
- 36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહીં કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર.
- 37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; અને તમારા માર્ગ જીવન જીવવા માટે મને મદદ કરો.
- 38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
- 39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
- 40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખું છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.

વાવ

- 41 હે યહોવા તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે તમારું તારણ મારા પર આવો.
- 42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે, હું તમારા શબ્દોનો વિશ્વાસ કરું છું.
- 43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઈ જશો, હું તમારા ચયપન નિર્ણયો ઉપર આધાર રાખું છું.
- 44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
- 45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાયું છું; તેથી જીવન જીવવામાં હું સ્વતંત્રતા અનુભવીશ.
- 46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ, અને તેઓ (રસ પૂર્વક સાંભળણે અને) મને મૂંજવણમાં મુકશે નહીં.
- 47 તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજાઓમાં હું આનંદ માણું છું.
- 48 હું તમારા આદેશોની સ્તુતિ કરું છું, હું તેને ચાહું છું અને હું તેના વિશે ચર્ચા કરું છું.

આઈન

- 49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.
- 50 મને મારા દુઃખમાં આશ્વાસન મળ્યું છે; અને તમારા વચને મને જીવાઓ છે.
- 51 અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા શિક્ષણમાંથી પાછો હઠ્યો નથી.

- 52 હે યહોવા, પુરાતન ક્રાણથી પ્રચલિત તમારા ચપળ નિર્જયોને મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે. અને મને હુમેશા સાંત્વન મળ્યું છે.
- 53 જે ભૂંડાઓ તમારી આશાની અવગાણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
- 54 તમારા આ નિયમો મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે ઘરે.
- 55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું; સ્મરણ થાય છે, અને હું તમારા નિયમો પાળું છું.
- 56 આ મારું આચરણ છે: હું તમારા આદેશોનું પાલન કરું છું.

ખેથ

- 57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મેં કર્યું છે.
- 58 મેં મારા હદ્યની ઉત્કર્ષથી તમારી કૃપાની માંગણી કરી છે; તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
- 59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે, અને પછી વણ્ણો છું તમારા કરાર તરફ.
- 60 તમારી આશાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; જરાય મોરું કર્યું નથી.
- 61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
- 62 હું મધરાતે ઊરીને તમારા ન્યાયી નિર્જયો બદલ તમારો આભાર માનીશ.
- 63 જે ક્રોઈ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ રાખે છે, અને તમારા આદેશોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
- 64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે, મને તમારા ક્રાયદાઓ શીખવો.

ટેથ

- 65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે, મારા માટે સારું જ કર્યું છે.
- 66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો, હું તમારા આદેશોનો વિશ્વાસ કરું છું.
- 67 મેં દુઃખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી વસ્તુઓ કરી, પણ હાલમાં હું તમારા આદેશ પાળું છું.
- 68 તમે સારા છો અને સારું કરો છો; મને તમારા ક્રાયદાઓ શીખવો.
- 69 ધમણી લોકો મારા વિશે જૂદું બોલે છે, પણ હું તમારાં નિયમો ખરા હદ્યથી પાળીશ.
- 70 તેઓનું અંત:કરણ સ્થળ છે; પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
- 71 મેં જે સહન કર્યું તે મારા સારા માટે પૂરવાર થયું, એ રીતે હું તમારા નિયમો શીખ્યો.

- 72 હજરો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.

યોદ

- 73 તમે તમારા હાથેથીજ મને ઘણો છે અને બનાવ્યો છે; તમારી આશાઓ શીખવો; અને તેનું પાલન કરવાની સમજ આપો.
- 74 તમારો ભય રાખનારા, મને જોઈને આનંદ પામશે; કરણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
- 75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે નિર્જયો સાચા અને ન્યાયી હોય છે. અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
- 76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
- 77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દી, તમારા શિક્ષણને હું માનું છું.
- 78 ભલે અભિમાનીઓ લજ્જા પામો; તેઓ મારા વિષે જૂદું બોલ્યા છે અને ખોટી રીતે મારા પર આશ્રેપ કર્યા છે. છતાં હું તો તમારા ઉપદેશોની ચર્ચા કરું છું.
- 79 ભલે તમારા અનુયાયીઓ, જેઓ તમારો આદર કરે છે અને જેમને તમારા કરાર વિષે જ્ઞાન છે; તેઓ મારી પાસે આવો.
- 80 તમારા નિયમોથી આધીનતામાં મારું હદ્ય નિર્દ્દ્યશ શુદ્ધ રહો; તમારી દરેક ઈચ્છાને ચાહવામાં મારી સહાય કરો; જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે, જોઝો.

કાફ

- 81 મારો જીવ તમારા વિનાશમાંથી બચવા માટે વ્યથિત છે. હું તમારા આદેશોમાં આશા રાખું છું.
- 82 તમે જે વસ્તુઓ માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે. જેને કરણો મારી આંખો નબળી થઈ રહી છે. તમે મને ક્યારે આશ્વાસન આપશો?
- 83 હું કર્યાના ઠગલા પર પડેલી સૂક્ષ્માયેલા ચામડાની કોથળી જેવો થઈ ગયો છું, પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
- 84 કેટલા દિવસ છે તારા સેવકના? તમે મને સત્તાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
- 85 જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા; તેઓએ ખાડા ખોઢા છે મારા માટે.
- 86 તેઓ વિના કરણો મને ત્રાસ આપે છે. મદદ કરો, તમારા સર્વ હુકમો ભરોસાપાત્ર છે.
- 87 તેઓએ લગભગ મને મારી નાખ્યો, છતાં મેં તમારા આદેશોનું પાલન કરવાનું છોશ્યું નહીં.
- 88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

લામેદ

- 89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
- 90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
- 91 તમારું ન્યાયી નિર્જયોને કારણે દરેક વસ્તુ આજની તારીખ સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ, તે સર્વ તમારા સેવકો છે.
- 92 જો મેં આનંદ માઝ્યો ન હોત તમારા નિયમમાં; તો હું મારા દુઃખમાંજ નાશ પાખ્યો હોત.
- 93 હું કદી ભૂલીશ નહીં તમારા શાસનોને, કારણકે તમે મને તેઓથીજ જીવાઝો છે.
- 94 હું તમારો છું મારું રક્ષણ કરો; કારણ, મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
- 95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઈ રહ્યા છે; છતાં હું શાંત રહીને વચનોમાં ધ્યાન રાખીશ.
- 96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પરંતુ તમારા આદેશની તો સીમા જ નથી.

મેમ

- 97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે વાતો કરતો રહું છું.
- 98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણકે મારી પાસે સર્વદા છે.
- 99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાશ્વતપણ છે કારણ કે હું તમારા કરાર વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
- 100 વૃદ્ધાના કરતાં હું વિશેષ જાણું છું; કારણકે મેં તમારા નિયમો પાણ્યા છે.
- 101 હું તમારું વચન પાણી શર્કું તે માટે મેં; મારા પગ સર્વ ભૂંડા માર્ગાથી પણ પાછા વાય્યા છે.
- 102 તમારા ન્યાયી આદેશોને મેં ત્યજ્યા નથી; કારણકે તમે મને તે શીખવ્યા છે.
- 103 મારી ઇચ્છિને તમારાં વચનો કેવા મીઠા લાગે છે! મારા મુખને તે મધ્યથીય વધુ મીઠા લાગે છે.
- 104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને વિકારું છું.

તુન

- 105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે; મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ડોકર ખાતાં બચાવે છે.
- 106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, “હું તમારું યથાર્થ ન્યાય શાસનો પાણીશ,” ને મેં તે પાણ્યા પણ ખરા.
- 107 હે યહોવા, હું દુઃખમાં કયડાઈ ગયો છું; તમારા વચનો પ્રમાણે મારું પુનરૂત્થાન કરો.

108 હે યહોવા, મારા મુખનાં રાજુખુશીથી આપેલાં અર્પજોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાય વચનો મને શીખવો.

109 મારો પ્રાણ સદા મારી મુઢીમાં છે; છતાં હું ભૂલતો નથી તારા નિયમને.

110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે; છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.

111 હું તમારા કરારોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હદ્યનો આનંદ છે.

112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે મારા હદ્યથી જવાબદારી સ્વીકારી છે.

સામેદ

113 બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું વિકારું છું. પણ હું તમારા નિયમોને ચાહું છું.

114 તમેજ મારી ઓથ તથા ગાલ છો; મને તમારી આજ્ઞાની આશા છે.

115 દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાણું.

116 તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું. મારી આજ્ઞાઓને નિરાશ ન કરો.

117 મને ટકાવી રાખો, જેથી હું બચી શકું. અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.

118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગાને પ્રગટ કરો છો.

119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.

120 હું તમારા ભયથી કાંપું છું, હું ડરું છું અને તમારા કાનૂનોનો આદર કરું છું.

હાયિન

121 મેં જે સારું અને સાચું છે તે કર્યું છે; યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો.

122 તમારા સેવક એવા મારા માટે સારી વસ્તુઓ તૈયાર કરો. ઉદ્ઘત લોકોને મારા પર જુલમ કરવા ન દો.

123 તમારા તારણની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ.

124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો; અને તમારા નિયમો મને શીખવજો.

125 હું તો તમારો સેવક છું, મને શાશ્વતપણનું વરદાન આપો, જેથી હું તમારા કચરાને જાણી શકું.

126 હે યહોવા, હજુ સમય છે કિર્દક પગલા ભરો; કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યું છે.

127 જ્યારે હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.

128 તમારા શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખ્યું છું યથાર્થ; અને હું દરેક જૂઠ માર્ગને વિકારું છું.

યે

129 તમારા નિયમો અદ્ભૂત છે; તેથી હું તેમને આધીન છું.

130 તમારા શબ્દો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે, અને તેથી એક સામાન્ય માણસ પણ સમજું શકે છે.

131 તમારા વચનો માટે મને ઉત્સુકતા છે; હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.

132 તમારા પર પ્રેમ કરનારાઓ સાથે તમે જે રીતે વર્તો છો; તેમ તમે મારા તરફ જોઈને મારા પર દયા કરો દેવ.

133 હે યહોવા, તમારા શબ્દથી મને દોરો. ક્રોઈપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.

134 જુલ્મી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા આદેશોનું પાલન કરી શકું.

135 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા બધાં નિયમો મને શીખવો.

136 તેઓ તમારા નિયમો પાળતાં નથી, તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.

સોદ

137 હે યહોવા, તમે ન્યાયી છો, તમારા ન્યાયવચનો યથાર્થ છે.

138 તમે તમારા ન્યાયી કરારો અમને આપ્યા, ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.

139 તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે, કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.

140 તમારા શબ્દો તદ્દન નિર્મણ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.

141 જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી, હું તમારા આદેશને કદ્દી ભૂલી જતો નથી.

142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; તમારા ઉપદેશો સાચા અને વિશ્વસનીય છે.

143 મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે. પરંતુ તમારા આદેશમાં મારી પ્રસન્નતા રહે છે.

કોઝ

144 તમારા નિયમો સદાકાળ ન્યાયયુક્ત છે, માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.

145 મેં ખરા હદ્દયથી અરજ કરી છે, હે યહોવા મને ઉત્તર આપ; હું તમારા નિયમોનું પાલન કરીશ.

146 'મારું રક્ષણ કરો' મેં તમને પ્રાર્થના કરી છે; એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.

147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી; અને મેં તમારી વાતની આશા રાખી.

148 તારા વચનનું મનન કરવા માટે; મારી આંખો રાતના છેલ્લા પ્રહર અગાઉ ઉઘડી ગઈ હતી.

149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જીવવાડો.

150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.

151 હે યહોવા, તમે મારી નજીદીક છો; અને તમારી સર્વ આશાઓ સત્ય છે.

152 લાંબા સમય પૂર્વ તમારા કરારમાંથી મેં જાણ્યું કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.

રેશ

153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો; કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.

154 મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે; કારણકે તે તમારા નિયમો શોધતા નથી.

156 હે યહોવા તારી કરુણા ઘણી મહાન છે; તારા ન્યાયવચનો પ્રમાણે મને જીવવાડો.

157 મને સત્તાવનારા, મારા શત્રુઓ ઘણા છે; છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.

158 જ્યારે મેં વિશ્વાસધાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો; કારણકે, તેઓ તમારા કાન્નુગાનું પાલન કરતાં નથી.

159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખ્યું છું, તે ધ્યાનમાં લેજો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જીવવાડો.

160 તમારા બધાં શબ્દો અથથી તે ઈતિ સુધી સત્ય છે; અને તમારા સર્વ ન્યાયી નિર્ણયો અનંતકાળ સુધી ટકવાના છે.

શીન

161 મને સરદારોએ વિના કારણ સત્તાવ્યો છે; પણ મારું હદ્દય તમારાં વચનોનો ભય રાખે છે.

162 જેમ કોઈકને મોટો ખજાનો મળે તેમ તમારા શબ્દો મને રાજુ કરે છે.

163 હું અસત્યને વિકારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું પરંતુ હું તમારા ઉપદેશોને ચાહું છું.

164 તમારા યથાર્થ અને ન્યાયી નિર્ણયોને કારણે, હું દિવસમા સાત વખત તમારી સુતિ કરું છું.

165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ વસ્તુ ઠોકર ખવડાવી શકે તેમ નથી.

- 166 હે યહોવા, તમારો તારણની મેં આશા રાખી છે; કારણ, મેં તમારી આજાઓ પાળી છે.
- 167 હું તમારો કરારને અનુસર્યો અને તેથી હું તેમના પર ધશો પ્રેમ રાખું છું.
- 168 હું તમારો બધાં આદેશો અને કાનૂનોને અનુસર્યો છું, હે યહોવા, હું જે કરું તે બધી વસ્તુ તમે જાણો છો.

તાવ

- 169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો; અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજાડું આપો.
- 170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; અને તમારો વચન પ્રમાણે મને ઉગારો.
- 171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણકે, તમે મને તમારો કાનૂનો શીખવો છો.
- 172 મને તમારો વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો. કારણ કે, તમારી આજાઓ પૂર્વી ન્યાયી છે.
- 173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં આદેશોને અનુસરવાનું પસંદ કર્યું છે.
- 174 હે યહોવા, હું તારો તારણ માટે અભિલાષી છું; તમારો નિયમ એ જ મારો આનંદ.
- 175 મારા આત્માને જીવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
- 176 હું ભૂલા પડેલા ઘેટાની જેમ ભટકી ગયો છું; તમે આવો અને મને તમારો સેવક ને શોધી કાઢો. કારણકે હું તમારો આદેશોને ભૂલ્યો નથી.

ગીત 120

મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.

- 1 મારા સંકટોમાં મેં યહોવાને પોકાર કર્યો; અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
- 2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી તમે મારા આત્માને બચાવો.
- 3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાથી તમને શો લાભ થશે?
- 4 તને તીક્ષ્ણ ભાજોથી વીંઘવામા આવશે; અને ધગધગતા અંગારથી તને દાખાશે.
- 5 અફસોસ હું મેશેખમાં રહું છું અને કેદારનાં તંબુઓમાં વસું છું.
- 6 જે શાંતિ પર દેખ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
- 7 જ્યારે મેં કાંધું, “મારે શાંતિ જોઈએ છે. હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઈ જોઈતી હતી.

ગીત 121

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

- 1 હું પર્વતો તરફ મારી આંખો ઊચી કરું છું, મને સહાય ક્યાંથી મળે?

- 2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે.
- 3 તે તમને ઠોકર ખાવા દેશે નહીં, કે લપસવા દેશે નહીં. તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
- 4 જુઓ, ઈસ્થાઅલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.
- 5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.
- 6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહીં કરે, અને ચંદ્ર રાત્રિ દરમ્યાન તમને દુઃખ નહીં પહોંચાડે.
- 7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની રક્ષણ કરશે.
- 8 તમે જે બધું કરશો તેમાં યહોવા તમારી પર નજર રાખશો. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશો.

ગીત 122

મંદિર ચઢવાનું ગીત.

- 1 યરુશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું મને કાંધું તેથી મને ખૂબ આનંદ થયો.
- 2 અને હવે અમે પણ યરુશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યાં.
- 3 ફરી એક વખત યરુશાલેમ એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
- 4 ઈસ્થાઅલની સર્વ જમાતો જે યહોવાની પોતાની છે તેઓ તેમનો આભાર માનવા; અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
- 5 જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
- 6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
- 7 ઓ યરુશાલેમ, તારો નગરકોટની અંદર શાંતિ થાઓ; અને તારો નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.
- 8 મારા ભાઈઓ તથા મારા મિત્રો માટે હું પ્રાર્થી રહ્યો છું. તારામાં શાંતિ થાઓ.
- 9 યહોવા અમારા દેવના મંદિરને માટે હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

ગીત 123

મંદિર ચઢવાનું ગીત.

- 1 ઓ આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; હું તારો ભાજી આંખ ઊચી કરું છું.
- 2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; જેમ દાસીની આંખો પોતાની શેડાણીને જોયા કરે; તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દ્યા થાય ત્યાં સુધી તેના ભાજી તાકી રહે છે.

- 3 અમારા પર દ્યા કરો, હે યહોવા દ્યા કરો; ખરાબ વ્યવહારથી અમે કટાળી ગયા છીએ.
- 4 પેલા આણસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

ગીત 124

મંદિર પર ચઠવા માટેનું દાઉદનું ગીત.

- 1 ઈસાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
- 2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો; ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ના હોત.
- 3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
- 4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઈ ગયા હોત; અને પાણીએ અમને દૂબાડી દીઘા હોત.
- 5 તે અભિમાની માણસોએ અમને પાણીમાં દૂબાડી દીઘા હોત.
- 6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીઘા, ને તેમણે અમારો નાશ થબા દીઘા નહીં.
- 7 જેમ પારધીની જ્ઞાનમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જ્ઞાન તૂટી ગઈ છે ને અમે બચી ગયા છીએ.
- 8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે.

ગીત 125

મંદિર ચઠવાનું ગીત.

- 1 જેઓ યહોવામાં વિશ્વાસ કરે છે, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહીં તેઓ સદાકાળ ટકી રહેશે.
- 2 જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે; તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
- 3 કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પદેશ ને તાબામાં રાખી ન શકે, નહીં તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરૂ કરે.
- 4 હે યહોવા, જેઓ સારા છે; અને જેઓના હદ્ય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઈ કરો.
- 5 દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મા કરવા વાળા લોકોની સાથે કુટીલ કર્મા કરે છે તેમને દૂર લઈ જાય છે. ઈસાએલમાં શાંતિ પ્રસરે!

ગીત 126

મંદિર ચઠવા માટેનું ગીત.

- 1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઈ આવ્યા, ત્યારે અમે સ્વર્પણ જોતાં હોઈએ એવું લાગ્યું.

- 2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં; ત્યારે વિદેશીઓએ કથ્યું; “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
- 3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે જેથી અમે આનંદ-મંગલ માનીએ છીએ.
- 4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો, અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
- 5 આંસુ પાડતાં પાડતાં જેઓ વાવે છે; તેઓ હર્ષનાદ કરતાં લાણશે.
- 6 જે કોઈ મૂલીભર બીજ લઈને રહતાં વાવણી કરવા જાય છે; તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊચકીને પાછો આવે છે

ગીત 127

સુલેમાનનું મંદિર ચઠવા માટેનું ગીત.

- 1 જો યહોવા ધર ના બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
- 2 જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી સખત પરિશ્રમ કરવાનો કોઈ અર્થ નથી, કારણકે તે તેમને ચાહનારા પ્રત્યેકને આરામ આપે છે.
- 3 બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.* તેઓ માતાના દેહમાંથી મળેલું ઈનામ છે.
- 4 યુવાવસ્થામાંના પુત્રો તો; બળવાન વીર યોધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
- 5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે; તેને ધન્ય છે.
- 6 જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે ત્યારે તે પરાજિજત નહીં થાય. કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

ગીત 128

મંદિર ચઠવાનું ગીત.

- 1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે.
- 2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
- 3 તારી પત્ની તારા ધરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
- 4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.

બાળકો ... ભેટ છે મૂળ પ્રમાણે “વારસામાં મળેલું” સામાન્યપણે આનો અર્થ એ છે કે દેવે ઈસાએલના પ્રત્યેક પરિવારને આપેલી જમીન. આ જમીન તે ભેટ હતી જે ખરેખર પરિવારથી કદી બહાર નથી ગઈ. કોઈ વ્યક્તિ જમીન વહેચી શકે, પરંતુ વિશ્રામવર્ષના (જુબીલી) સમયે તે જમીન પરિવારને પાછી આપી દેવામાં આવતી.

- 5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે યરુશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો, જીવનના સર્વ દિવસો પર્યંત.
- 6 તું પોતાના સંતાનોના સંતાનો જોશે; ઈસ્થાએલને શાંતિ થાઓ.

ગીત 129

મંદિર ચઢવા માટેનું ગીત.

- 1 ઈસ્થાએલને કહેવા દો, “મારી યુવાવસ્થાથી મારી પાસે ધણાં દુશ્મનો હતો.”
- 2 મારી યુવાવસ્થાથી મારી પાસે ધણાં દુશ્મનો હતા પણ તેઓ મને હરાવી ન શક્યા!
- 3 પીઠ પર લાંબા અને ઊડા કાપા પડ્યા તેટલો માર્યો, હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
- 4 પરંતુ યહોવા તો ન્યાયી છે, દુષ્ટ લોકોએ મને બાંધલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
- 5 સિયોનને વિક્કારનારા બધાં અપમાનિત થાઓ અને હારીને ભાગી જાય.
- 6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ; જે વૃદ્ધ પામ્યાં પહેલા સુકાઈ જાય છે.
- 7 જીથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
- 8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો! યહોવાના નામે આશિષ આપીએ છીએ અમે.”

ગીત 130

મંદિર ચઢવા માટેનું ગીત.

- 1 હે યહોવા, સંકટોનાં ઊડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો.
- 2 હે યહોવા, મારી હાકલ સાંભળ; અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
- 3 હે યહોવા, અમારા માલિક; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઈનું અસ્તિત્વ રહેત નહીં.
- 4 પરંતુ તમે લોકોને માર્ઝી આપો છો, તેથી તમે આદર પામશો.
- 5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચ્યન પર આધાર રાખ્યું છું.
- 6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ હું યહોવાની રાહ જોઉ છું.
- 7 હે ઈસ્થાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો, કારણ, તે દયાળું ને કૃપાળું છે અને તે; આપણને બચાવવા આપજી પાસે આવે છે.
- 8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઈસ્થાએલને માફ કરશો.

ગીત 131

મંદિર ચઢવા માટેનું ગીત.

- 1 ઓ યહોવા હું ગર્વિષ નથી, હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી. હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ” સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
- 2 મેં મારી જાતને શાંત કરી છે. મારો આત્મા સ્વસ્થ અને શાંત છે. મારો આત્મા માતાના બાહુમાં ધાવણીથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
- 3 હે ઈસ્થાએલ, યહોવા પર હંમેશા અને સદ્ગ્ય ભરોસો રાખ.

ગીત 132

મંદિર પરના ચઢાણ માટેનું ગીત.

- 1 હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉંટ સહન કર્યા હતાં તેને યાદ કરો.
- 2 યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી; હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
- 3 “જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું; અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
- 4 ત્યાં સુધી હું મારા ધરમાં જઈશ નહીં; ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહીં.
- 5 વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિદ્રા આવવા દઈશ નહીં.”
- 6 દેવ, અમે તેના વિષે એજાથાહમાં સાંભળ્યું, અમને તે કરારકીશ ડિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મખ્યો.
- 7 પણ હવે ચાલો આપણો મંદિરમા, દેવના કાપયમી ધરમાં જઈએ; ચાલો આપણો દેવની ચરણરજ લેવા નીચે નમીએ.
- 8 હે યહોવા ઊંઘ અને, તમે તમારા શક્તિશાળી ક્રોષની સાથે તમારા વિશ્વામસ્થાનમાં આવો.
- 9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; અને તારા ભક્તો હર્ષનાદ કરો.
- 10 તમારા સેવક દાઉંને માટે દેવ, તમે જે એકને પસંદ કરીને અભિપ્રિકત કર્યા છે તેનો અસ્વીકાર ન કરો.
- 11 યહોવાએ દાઉંની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચ્યન તોડશે નહીં.
- 12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાણે; તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદ્ગ્યાણ બેસરા.
- 13 હે યહોવા, તમે સિયોનને તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું છે.
- 14 તમે કર્યું છે, “મારા સદ્ગ્યાણના વિશ્વામનું આ સ્થળ છે. હું અહીં બિરાજમાન થઈશ.” મેં તેમ કરવા ચાંદું હતું.

- 15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઈશ. અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
- 16 હું તેના યાજકોને તારણનો જભ્બો પહેરવીશ; મારા પરમ ભક્તો આનંદથી ગાશે.
- 17 દાઉદની શક્તિ આ જગ્યાએ, મજબૂત બનશે. "મારા અભિષિક્ત માટે મેં દીવો તેથાર કર્યો છે."
- 18 તેના શત્રુઓને હું શરમથી ઢાકી દઈશ; પણ તે પોતે એક ગૌરવી રાજી બનશે.

ગીત 133

મંદિરે ચઠવા માટેનું દાઉદનું ગીત.

- 1 ભાઈઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!
- 2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી અને તેના વસ્તની કોર સુધી ઉત્તરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
- 3 વળી તે હેર્માન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના જાળ જેવું છે.
- 4 કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યો છે.

ગીત 134

મંદિર પર ચઠવા માટેનું ગીત.

- 1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સુન્ય માનો.
- 2 પવિત્રતામાં તમારા હાથ ઊચા કરો અને યહોવાની સ્તુતિ કરો.
- 3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તમને આશીર્વાદ આપે!

ગીત 135

- 1 યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
- 2 યહોવાના મંદિરમાં, આપણા દેવનાં મંદિરમાં; આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
- 3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ભલા છો; તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદધાયક છે.
- 4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે; ઈસ્થાઅભેલને પોતાની ખાસ સંપત્તિ થવા માટે.
- 5 હું યહોવાની મહાનતા જાળું છું, સર્વ દેવો કરતાં તે મહાન છે.
- 6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊડામાં ઊડા સમુદ્રોમાં યહોવાએ જે ઈચ્છયું તે કર્યું.
- 7 તે પાણીની વરણને ઊચે લઈ જઈ તેના વાદળાં બાંધે છે; અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે; તે વિજણી મોકલી વરસાદે વરસાવે છે; પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

- 8 મિસરમાં તેણે માણસોના ને પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
- 9 તેણે હારુન અને તેના અધિકારીઓ વિઝુદ્ધ પોતાની નિશાનીઓ અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
- 10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો; અને પરાકમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
- 11 અમોરીઓના રાજી સીહોનને, તથા બાશાનના રાજી ઓગને; અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજ્ય આપ્યો.
- 12 તેમના દેશને તેણે પોતાના લોક ઈસ્થાઅભેલને વારસામાં આપ્યો.
- 13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે; હે યહોવા, તારું સ્મરણ પેઢી-દરપેઢી ટકી રહેનાર છે.
- 14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે; તે તેના સેવકો પ્રતિ દયાળું થશે.
- 15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે. તેઓ માણસોના હાથે જ બનેલા છે.
- 16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી; આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
- 17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી; અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
- 18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે; અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવાં જ થશે.
- 19 હે ઈસ્થાઅભેલનું કુણ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુણ, યહોવાની સ્તુતિ કરો!
- 20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, હે જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
- 21 યહોવા યેરૂશાલેમમાં નિવાસ કરે છે; યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો, યહોવાની સ્તુતિ કરો!

ગીત 136

- 1 યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે; તેમનો સાચો પ્રેમ સર્વકાળ ટકે છે.
- 2 સર્વ દેવોના દેવની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 3 દેવોના દેવની સ્તુતિ કરો! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 4 દેવની સ્તુતિ કરો જે એકલાજ મહાન ચમત્કારો સર્જ છે! અભની ભલાઈ સદાય રહે છે.
- 5 જેણે પોતાના ડાહુપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો; કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 6 જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ છે.

- 7 આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો; તેમની ભલાઈ સદાય ટકે છે!
- 8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 9 રત્નિ પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો; તેમનો સાચોપ્રેમ અનંતકાળ ટકે છે.
- 10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 11 વળી તેઓની પાસેથી ઈશ્વાએલને છોડાવનારની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 13 તેઓની આગણ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 14 સમુદ્રમાં થઈને જે તેઓને સુરક્ષિત સામે પાર લઈ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 16 રણમાં થઈને પોતાના લોકોને જેમણે દોર્યા; તેમની સ્તુતિ કરો; તેમની કૃપા અનંતકાળ છે.
- 17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો. તેમની ભલમનસાઈ સદાકાળ રહે છે!
- 18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો; તેમની ભલાઈ સદાય રહે છે.
- 19 અમોરીઓના રાજા સિહોનનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ રહે છે.
- 21 જેમણે આ રાજાઓની ભૂમિ ઈશ્વાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 22 જેમણે તે પોતાના સેવક ઈશ્વાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 23 જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો; તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
- 25 દરેક સજુવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો, તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

- 26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો; કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

ગીત 137

- 1 અમે બાબિલની નદીઓને કાંઠ બેઠા; સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રક્યાં.
- 2 એટલે અમે વીજાઓ વગાડવી બંધ કરી; અને નેતરના વક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
- 3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કર્યાં; જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાયું કે, કક્ત તેમને ખુશ કરવા સિયોનના ગીતોમાંનું કોઈ એક ગીત ગાયો.
- 4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
- 5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉ તો એવું થાઓ, "મારો જમણો હાથ તંતુવાધની કળા ભૂલી જાય."
- 6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું, અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો મારી જીબ મારા તાળવાને ચોટી જાય અને હું ફરી કદી ય ગાઈ શકું નહીં.
- 7 હે યહોવા, બેબિલોનના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યું તે દિવસે અદોમીઓએ જે કલ્યાં તે તમે ભૂલી ન જતાં; તેઓએ કલ્યાં હતું "તને જમીનદોસ્ત કરી નાખો."
- 8 ઓ બેબિલોન તે અમારો નાશ કર્યો છે એજ રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજી આપે તેને આશીર્વાદ આપ.
- 9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે; તે ધન્ય કહેવાશે.

ગીત 138

દાઉદને સમર્પિત એક ગીત.

- 1 હે યહોવા, હું મારા ખરા હદયથી તમારી આભારસ્તુતિ ગાઈશ; હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઈશ.
- 2 તમારી વજાદારી અને સાચા પ્રેમ માટે, હું તમારા પવિત્ર મંદિર તરફ નીચે નમીશ, હું તમારો આભાર માનીશ અને સ્તુતિ ગાઈશ કારણ કે તમારા શદ્ધોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચયપદે મૂક્યું છે.
- 3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
- 4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચ્ચન સાંભળ્યાં છે; તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
- 5 તેઓ યહોવાના માર્ગ વિષે ગીત ગાશે, કારણકે યહોવાનો મહિમા મહાન છે!
- 6 જો કે યહોવા સર્વોચ્ચ (સ્થાને બિરાજે) છે. તે નિર્ધન અને રંગ લોકોની કણજી લે છે. પણ ગર્વિષ માણસોને તો તે દૂરથીજ ઓળખે છે.

- 7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો; મારા શત્રુઓના કોધની સામે તું તારો હાથ લાંબો કરજે તમારા પરાકમથી તમે મને બચાવજો.
- 8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે; હે યહોવા, તમારી દૂપા, સદાકાળ વહેતી રહે છે; મને તરછોડશો નહીં; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

ગીત 139

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

- 1 હે યહોવા, તમે મારા હદ્યની પરીક્ષા કરી છો; અને તમે મારા વિષે બધું જાણો છો.
- 2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; મારા વિચારો પણ તમે વંગણેથી સમજો છો.
- 3 તમે જાણો છો હું ક્યાં જઈ રહ્યો છું અને હું ક્યારે સુઈ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.
- 4 હું બોલું તે અગાઉ તમે જાણો છો, કે હું શું કહેવા ઈચ્છુ છું.
- 5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છો; અને તમે તમારા હાથે મને ઝીલી રાખ્યો છો.
- 6 આવું શાન અતિ ભવ્ય અને અદ્ભૂત છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કહી શકતો નથી.
- 7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉ? તમારી હાજરી માંથી હું ક્યાં નાસી જાઉ?
- 8 જો હું આકાશમાં જાઉ તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉ તો પણ તમે ત્યાં જ છો.
- 9 જો હું પરોદ્ધિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણો દૂર જાઉ
- 10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશો; તમારું સામર્થ્ય મને સહાય કરશે.
- 11 જો હું અંધકારમાં સમાઈ જવાનો પ્રયત્ન કરું તો રત્નિ મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
- 12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી; તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશ છે; અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
- 13 મારું અંત:કરણ તમે ઘણું; અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
- 14 ભય તથા નવાઈ પમાડે તે રીતે મારી રચના થઈ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઈશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદ્ભૂત છે!
- 15 જ્યારેમારી માતાનાં ગર્ભાશયમાં સંતાઈને* મારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા તે કહેવાની આ રીત છે.

મારી ... સંતાઈને મૂળ પ્રમાણે માતાના ગર્ભાશયમાં “ધરતીના ઊડામાં ઊડા ભાગો” જે જગ્યાનાં વિષે આપણે કાઈ જાણતા નથી તે કહેવાની આ રીત છે.

- નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતુંહતું.
- 16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતું જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
- 17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે! દેવ તમે ઘણું બધું જાણો છો!
- 18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ, તો હજુ પણ હું તારી સાથે હોઈશા!
- 19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
- 20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે; અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે; તેઓ કેટલા મૂર્ખ છે!
- 21 હે યહોવા, તમારો દ્રેષ કરનારાઓનો શું હું દ્રેષ ન કરું? જેઓ તમારી સામે ઊંઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
- 22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
- 23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ; મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
- 24 તમને દુઃખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જાણાવો; અને સનાતન માર્ગે મને દોરી જાઓ.

ગીત 140

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

- 1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુક્ત કરો; જીલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
- 2 તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે; ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
- 3 તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે; અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
- 4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો; જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે; એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
- 5 આ ગર્વિષ માણસોએ મને પકડવા છટકું ગોઈવું છે; આચક્કે મારીને મને ઊચે જેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે; તેઓ મારા ઉપર જાળ નાખવા જીડીમાં છુપાયા છે.
- 6 મેં યહોવાને કંધું; તમે મારા દેવ છો; હે યહોવા, દ્વયા માટેની મારી અરજ સાંભળો.

- 7 ઓ યહોવા, મારા સમર્થ તારક; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
- 8 ઓ યહોવા, આ દુષ્ટો જે ઈચ્છે છે તે તેમની પાસે ન હોય તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહીં; નહીં તો તેઓ ઊચા ઊઠશે.
- 9 તેઓના ક્રવતરાંની જાળમાં તેઓ જ ફસાય; તેવું થાઓ; મારું ભૂંડું થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
- 10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; અથવા તેઓને અભિનમાં ફંકી દેવામાં આવે; અથવા તો ઊડા ખાડાઓમાં નાખવામાં આવે; જ્યાંથી તેઓ કદી બચ્ચી શકે નહીં.
- 11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહીં, તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
- 12 મને જાણ છે; યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે, અને ગરીબોનો હક જાળવશે.
- 13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીત 141

દાઉદનું ગીત.

- 1 યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો; કારણકે, મેં પ્રાર્થના કરી છે. મદદ માટેનો પોકાર સાંભળો.
- 2 મારી પ્રાર્થના તારી સંન્મુખ ધૂપ જેવી થાઓ મારા ઊચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહ્નાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!
- 3 હે યહોવા, મારું મુખને બંધ રાખવા અને મારા હોઠોને બીરેલા રાખવા મને સહાય કરો.
- 4 મારા હદ્યમાં કદ્દ દુષ્ટ વસ્તુ પ્રવેશ નહીં, જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુસ્કાર્યોમાં હું જોડાઉં નહીં અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તમને સાથ ન આપું.
- 5 જો કોઈ ન્યાયી માણસ મને સુધારે હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજુશ. તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે. હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું. પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
- 6 તેઓના નેતાઓને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે. તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શઠ્ઠો સાચા અને સારા છે.
- 7 જેમ કોઈ જમીન ખેડુ અને આજુબાજુ ગંદકી ફેલાવે, તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિભરાયેલાં હતા.
- 8 પણ હે યહોવા દેવ હું મદદ માટે તમારી તરફ જોડિ છું. હું તમારો વિશ્વાસ કરું છું. મારા આત્માનો નાશ ન થવા દો.

ગીત 142

દાઉદ ગુજરાતીમાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના.

દાઉદનું માસ્કીલ.

- 1 હું મોટા સાદે યહોવાને આજુજુ કરું છું; અને દયા માટે ઊચા સ્વરે વિનંતી કરું છું.
- 2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
- 3 હું બેણોશ થવાનો હોઉં, ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ; જે રસ્તે હું ચાલું છું; તેમાં તેઓએ ફિદા ગોઠવ્યા છે.
- 4 જ્યારે હું આજુબાજુ જોડિ છું, હું કોઈ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
- 5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મેં તમને પોકાર કર્યો અને કર્યું, "યહોવા, મારા સંતાવાની જગ્યા માત્ર તમેજ છો આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો."
- 6 મારા પોકારો સાંભળો, કેમકે હું દુઃખી છું; જેઓ મારી પાછળ પદ્ધાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
- 7 મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઊદાર છો.

ગીત 143

દાઉદનું ગીત.

- 1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજુજુનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
- 2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઈ નિર્દ્યાખ મળશે નહીં.
- 3 મારા શત્રુઓ મારી પાછળ પદ્ધાં પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીવો છે, જાણો હું મરી ગયો હોડું તેમ.
- 4 માટે મારો આત્મા ઘણો મુઝાઈ ગયો છે; અને મારું અંત:કરાડા સત્ય થઈ ગયું છે.
- 5 હું ભૂતકાળનાં વર્ષો સમરું છું; તે વખતે તમે મહિમાવંત ચ્યમતકારો કર્યા હતાં; તેનું મનન કરું છું.
- 6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તલસે છે.

- 7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નભળો થતો જાઉ છું; તમે મારાથી મોહું ફેરવશો, તો હું મૃત્યુ પામીશ.
- 8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારો પર ભરોસો રાખું છું. જે માર્ગ મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારો હાથોમાં મૂકું છું.
- 9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણો આવ્યો છું.
- 10 મને તમારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગ દોરી જાઓ.
- 11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
- 12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સત્તાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.

ગીત 144

દાઉદનું સ્તુતિગાન.

- 1 યહોવા, મારો ખડક છે, તેની સ્તુતિ કરો તે મારા હાથને અને મારી આંગણીઓને યુદ્ધમાં લડતાં શીખવે; તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
- 2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે; મારું સામર્થ્ય અને મારી સુરક્ષા છે; તે મારા રક્ષક છે; તે મારા લોકોને મારે તાબે કરે છે. યહોવા મારો સાચો પ્રેમ છે.
- 3 હે યહોવા શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
- 4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે. લોકોના જીવન તો પસાર થઈ રહેલા પડછાયા જેવા હોય છે.
- 5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઈ જશે.
- 6 વિજણી ચ્યમકે અને મારા શત્રુઓ વિખેરાઈ જાય. તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
- 7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો મને બહાર ખેચી કાઢો, અને વિદેશીઓથી મને બચાવો.
- 8 તેઓ જૂઠું બોલે છે, તેઓ છેતરપિંડી કરે છે.
- 9 હે યહોવા, દસ તારવાળાં વાળુંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ, તમારી સ્તુતિનું ગીત ગાઈશ.
- 10 તે રાજાઓને વિજય આપે છે; તે પોતાના સેવક દાઉદને ઘણતી તલવારથી બચાવનાર છે.
- 11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો; આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે તે લોકોથી તમે મને ઉગારો.

- 12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શાશ્વતારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
- 13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ; અને તે અમને હમેશા મળતું રહે અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને દશ હજારો બચ્યાં જણનાર થાઓ.
- 14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; અમારા નગર પર શત્રુઓનું આકમજા ન થાઓ; સર્વત્ર શાંતિ વિસ્તરો; શેરીઓમાં કોઈ અપરાધ ન કરો.
- 15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ઘન્ય હો. જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ઘન્ય છે.

ગીત 145

દાઉદનું ગીત.

- 1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ! હું તમારા નામની સ્તુતિ સદ્ગ્ય અને હમેશા કરીશ!
- 2 હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ, અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઈશ.
- 3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતાનો તાગ પામી શક્ય તેમ નથી.
- 4 પેઢી-દરપેઢી તમારાં ક્રામની પ્રશંસા થશે; અને તમારા પરાકમનાં કાર્યો પ્રગટ કરવાશે.
- 5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ; હું તમારા અદ્ભૂત ચ્યમત્કારો વિષે ચર્ચા કરીશ.
- 6 લોકો તમારાં પરાકર્મી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
- 7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી ક્રીતિ ગજાવશે; અને તમારા ન્યાયીપણ વિષે ગીતો ગાશે.
- 8 યહોવા દયાળું અને ભલા છે; તે કોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
- 9 તેઓ પ્રત્યેક પ્રત્યે ભલા છે; અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
- 10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો, અને તમારા અનુયાયીઓ તમારી સ્તુતિ કરે.
- 11 તેઓ લેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તમારું પરાકમ પ્રગટ કરશે.
- 12 જેથી સર્વ લોકો તમારા ચ્યમત્કાર વિષે, તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
- 13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી; અને તમારું શાસન પેઢી-દરપેઢી ચાલું રહે છે.
- 14 બંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે; બોજા તળે ક્રયડાયેલાઓને તે બળવાન કરે છે.

- 15 સર્વ કોઈ તમને આતુરતાથી જોઈ રહ્યાં છે. અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
- 16 પ્રત્યેક જીવંત વસ્તુની ભૂખ અને તરસ તમે સતત સંતોષો છો.
- 17 યહોવા જે કઈ કરે છે તે સર્વમાં પ્રમાણિક અને દ્યાથી ભરપૂર છે.
- 18 જેઓ પ્રમાણિક પણો તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
- 19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
- 20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઈનું તે રક્ષણ કરે છે; પણ દુષ્ટોનો નાશ કરે છે.
- 21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ; તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જાણ સદાકાળ કરતો રહેશે!

ગીત 146

- 1 યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
- 2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઈશ.
- 3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે ઉગારવાની શક્તિ નથી.
- 4 તેનો આત્મા તેમને છોડી જાય છે; અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; અને તેમની બધી યોજનાઓ નકારી જાય છે.
- 5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેનાં દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
- 6 યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે, તે પોતાના પ્રત્યેક વચનનું પાલન કરે છે.
- 7 તે કયડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે યહોવા કેદીઓને મુક્ત કરાવે છે.
- 8 યહોવા આંધળાને દેખતા કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
- 9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે; અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે; પણ દુષ્ટોની યોજનાઓને ઊધી વાળે છે.
- 10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે. યહોવાની સ્તુતિ થાઓ!

ગીત 147

- 1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે.
- 2 યહોવા યરૂશાલેમને બાંધે છે; તે ઈસ્યાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
- 3 હંદ્યાંગ થયેલાઓને તે સાજા કરે છે; ને તે તેઓના ધા રૂજવે છે ને પાટા બાંધે છે.
- 4 તે તારાઓની ગણતરી કરે છે; અને તેઓને નામ દઈને બોલાવે છે.
- 5 આપણા દેવ કેવા મહાન છે! તેમના સામર્થ્યનો પાર નથી! તેમના શાનની કોઈ સીમા નથી.
- 6 યહોવા નમજનોને આધાર આપે છે; પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
- 7 દેવે કેલા ઉપકારો માટે તેમનો આભાર માનો; આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
- 8 તે આકાશને વાદળોથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
- 9 પણ જેઓ તેમનો ભય રાખે છે; ને યહોવાની કૃપા માટે વાટ જુઅે છે; તેથી યહોવા ખુશ રહે છે.
- 10 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો; હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
- 11 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે. અને તારા કુણના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
- 12 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે; અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
- 13 તે પોતાની આશા પૃથ્વી પર મોકલે છે; અને તેનું વચન અતિ વેગથી ઢોડે છે.
- 14 તે જમીનને ઢાંકવા સર્કદ ઊંફ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
- 15 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
- 16 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ઝૂકવાની આશા કરે છે; અને સર્વ નદીઓમાં પાણી વહેતાં થાય છે.
- 17 દેવે યાકૂબને તેમનો આદેશ આપ્યો, તેમણે તેમના કાયદાઓ અને નિયમો પણ ઈસ્યાએલેને આપ્યા.
- 18 અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; અન્ય પ્રજાઓએ તેમની આશાઓ જાણી નથી. યહોવાની સ્તુતિ થાઓ.

ગીત 148

- 1 યહોવાની સ્તુતિ કરો! સ્વર્ગમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચાઈઓ પરથી તેમની સ્તુતિ કરો!
- 2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ
સૈન્યો તેમની સ્તુતિ કરો!
- 3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો! સર્વ ઝગજગતાં
તારા તેમની સ્તુતિ કરો!
- 4 ઉચ્ચામાં ઉચ્ચા સ્વર્ગમાં યહોવાની સ્તુતિ કરો! આકાશ
ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
- 5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યું છે તે યહોવાનાં
નામની સ્તુતિ કરો; કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
- 6 દેવે આ બધી વસ્તુઓ સદ્ય, સદ્યકાળ માટે સ્થાપન
કરી છે તેમણે જે ક્રાયદાઓ પ્રસ્થાપિત કર્યા છે તેનો
અંત કદાપિ આવશે નહીં.
- 7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ
કરો; હે મહાસાગરનાં ઉડાણોમાં વસતાં સૌ જીવો
તેમની સ્તુતિ કરો.
- 8 અણી તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે
એનુ વચન પૂરુ કરે છે; તે.
- 9 તમે પર્વતો તથા હુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
- 10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં
જીવજીતું તથા ઉડનારાં પક્ષીઓ;
- 11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ, તથા તેઓના
અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
- 12 યુવાનો અને કન્યાઓ, વૃદ્ધો અને બાળકો;
- 13 તમે સર્વ યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું
એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! સ્વર્ગ અને પૃથ્વી
પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
- 14 તે તેમના લોકોની તાકાત વધારશે, તેના વઝાદાર
અનુયાયીઓ તેમની સ્તુતિ કરો. સર્વ ઈસ્થાએલીઓ
જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

ગીત 149

- 1 યહોવાની સ્તુતિ કરો; તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
અનુયાયીઓની સભામાં તેની સ્તુતિ કરો.

- 2 ઈસ્થાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે
આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની
નિકટાનો આનંદ મનાવો.
- 3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા
વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
- 4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; ને
નમજનોનો ઉદ્ઘાર કરે છે.
- 5 તેમનાં અનુયાયીઓ તેમના ગૌરવથી હરખાય છે;
પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો
ગાઓ.
- 6 તેઓના કંઈમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
અને તેઓના હાથમાં બેધારી તલવાર રહે.
- 7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે અને તેમને પાઠ ભણાવે.
- 8 તેઓના રાજાઓને અને આગેવાનોને; લોખંડની
સાંકળોથી બાંધે.
- 9 અને તેઓને દેવના આદેશ મુજબ તેઓ સજા કરે!
યહોવા તેમના બધાં અનુયાયીઓનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.

ગીત 150

- 1 યહોવાની સ્તુતિ કરો! તેમના મદિરમાં તેમની
સ્તુતિ કરો! તેમના શક્તિશાળી આકાશમાં તેમની
સ્તુતિ કરો!
- 2 તેનાં પરાકમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની
અંજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
- 3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા
વીણાથી તેમની સ્તુતિ કરો.
- 4 ખંજરી તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી
તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
- 5 જાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
જાંઝોના પ્રચંડ અવાજ સાથે તેમની સ્તુતિ કરો!
- 6 સર્વ જીવંત જીવજીતું, શ્વાસોચ્છવાસ લેનારાં
સર્વ યહોવાની સ્તુતિ કરો, તમે સૌ તેમની સ્તુતિ
કરો!

License Agreement for Bible Texts

World Bible Translation Center
Last Updated: September 21, 2006

Copyright © 2006 by World Bible Translation Center
All rights reserved.

These Scriptures:

- Are copyrighted by World Bible Translation Center.
- Are not public domain.
- May not be altered or modified in any form.
- May not be sold or offered for sale in any form.
- May not be used for commercial purposes (including, but not limited to, use in advertising or Web banners used for the purpose of selling online add space).
- May be distributed without modification in electronic form for non-commercial use. However, they may not be hosted on any kind of server (including a Web or ftp server) without written permission. A copy of this license (without modification) must also be included.
- May be quoted for any purpose, up to 1,000 verses, without written permission. However, the extent of quotation must not comprise a complete book nor should it amount to more than 50% of the work in which it is quoted. A copyright notice must appear on the title or copyright page using this pattern: "Taken from the HOLY BIBLE: EASY-TO-READ VERSION™ © 2006 by World Bible Translation Center, Inc. and used by permission." If the text quoted is from one of WBTC's non-English versions, the printed title of the actual text quoted will be substituted for "HOLY BIBLE: EASY-TO-READ VERSION™." The copyright notice must appear in English or be translated into another language. When quotations from WBTC's text are used in non-saleable media, such as church bulletins, orders of service, posters, transparencies or similar media, a complete copyright notice is not required, but the initials of the version (such as "ERV" for the Easy-to-Read Version™ in English) must appear at the end of each quotation.

Any use of these Scriptures other than those listed above is prohibited. For additional rights and permission for usage, such as the use of WBTC's text on a Web site, or for clarification of any of the above, please contact World Bible Translation Center in writing or by email at distribution@wbtc.com.

World Bible Translation Center
P.O. Box 820648
Fort Worth, Texas 76182, USA
Telephone: 1-817-595-1664
Toll-Free in US: 1-888-54-BIBLE
E-mail: info@wbtc.com

WBTC's web site – World Bible Translation Center's web site: <http://www.wbtc.org>

Order online – To order a copy of our texts online, go to: <http://www.wbtc.org>

Current license agreement – This license is subject to change without notice. The current license can be found at: <http://www.wbtc.org/downloads/biblelicense.htm>

Trouble viewing this file – If the text in this document does not display correctly, use Adobe Acrobat Reader 5.0 or higher. Download Adobe Acrobat Reader from:
<http://www.adobe.com/products/acrobat/readstep2.html>

Viewing Chinese or Korean PDFs – To view the Chinese or Korean PDFs, it may be necessary to download the Chinese Simplified or Korean font pack from Adobe. Download the font packs from:
<http://www.adobe.com/products/acrobat/acrasianfontpack.html>